

Date of Publication 10<sup>th</sup> Posted on Every Month

સપ્ટેમ્બર : ૨૦૧૫

વર્ષ : ૧૦, અંક : ૨

₹ 20




સમાનો મન્ત્ર : ૧ (૪૦૦૭૬)

સમાની પ્રાપ્તા : (અથર્વવેદ)

# પરબુ

તત્ત્વી : ધોગેશ જોધી



સમાનો મન્ત્ર: (ક્રીએટ)

સમાની પ્રપા (અથર્વેદ)

# પરબ

સ્થાપના વર્ષ: ૧૯૬૦

વર્ષ: ૧૦

સાયેન્સ: ૨૦૧૫

અંક: ૨

પરામર્શનસમિતિ

ધીરુ પરીખ  
પ્રમુખ

રત્નિલાલ બોરીસાગર  
મધ્યસ્થ સમિતિના સભ્ય

ઉષા ઉપાધ્યાય  
પ્રકાશનમંત્રી

તંત્રી  
યોગેશ જોધી



## ગુજરાતી સાહિત્ય પરિષદ

મેધાશી શાનપીઠ .૦૦ ક. લા. સ્વાધ્યાયમંદિર

ગુજરાતી સાહિત્ય પરિષદ (પ્રકાશન વિભાગ), ગોવર્ધનભવન,  
ગુજરાતી સાહિત્ય પરિષદ માર્ગ, આશ્રમ માર્ગ, નદીકિનારે, અમદાવાદ-૩૮૦ ૦૦૮  
કોન: ૨૬૫૮૭૮૪૭

# પરબ

ગુજરાતી સાહિત્ય પરિષદના સભ્યપદ અને 'પરબ'ના લવાજમ અંગે :

$\frac{1}{15750}$ 'પરબ' દર મહિનાની દસમી તારીખે પ્રકાશિત થાય છે.

$\frac{1}{15750}$ 'પરબ'ના ગ્રાહક તથા પરિષદના સભ્ય વર્ષમાં ગમે ત્યારે થઈ શકાય છે.

$\frac{1}{15750}$ 'પરબ'નું વાર્ષિક લવાજમ  $\_ 150$  છે.

$\frac{1}{15750}$ દ્વિદ્યાર્થીઓ માટે 'પરબ'નું વાર્ષિક લવાજમ  $\_ 75$  છે. સાથે પ્રમાણપત્ર બીડવું.

$\frac{1}{15750}$ દ્વિદ્યાર્થીઓ માટે 'પરબ'નું વાર્ષિક લવાજમ  $\_ 75$  છે. સાથે પ્રમાણપત્ર બીડવું.

$\frac{1}{15750}$ 'પરબ'ના લવાજમનો સમાવેશ થઈ જાય છે.

$\frac{1}{15750}$ પરિષદના વાર્ષિક વ્યક્તિગત સભ્યપદનું શુલ્ક  $\_ 200$  તથા સંસ્થાગત સભ્યપદનું શુલ્ક  $\_ 300$  છે.

$\frac{1}{15750}$ પરિષદના આજીવન સભ્યપદનું શુલ્ક  $\_ 2,000$  છે તથા સંસ્થા આજીવન સભ્ય ફી  $\_ 3,000$  છે. (વિદેશવાસીઓ માટે ૭૫ પાઉન્ડ અથવા ૧૩૦ ડોલર.)

$\frac{1}{15750}$ 'પરબ' લવાજમ તથા પરિષદ સભ્યપદ શુલ્કની રકમ મનીઓર્ડર અથવા ડિમાન્ડ રિફંટ્ઝી 'ગુજરાતી સાહિત્ય પરિષદ'ના નામે જ મોકલવી.

## દેખાકોને :

$\frac{1}{15750}$ 'પરબ'માં પ્રગટ થતાં લખાણોમાંના વિચાર-અભિપ્રાયની જવાબદારી જે તે દેખાકની રહે છે.

$\frac{1}{15750}$ દેખાકોએ પોતાનું લખાણ ફૂલ્સકેપ અથવા ડાઢ સાઈઝના કાગળની એક બાજુએ, સુવાચ્ય અભિપ્રાય લખી મોકલવું. પોસ્ટકાર્ડ, ઈનલેન કે ચબરખીઓમાં ફૂતિ મોકલવી નહીં. પ્રત્યેક ફૂતિ નીચે પૂરું સરનામું લખવું તથા એક નકલ પોતાની પાસે રાખીને જ ફૂતિઓ મોકલવા વિનંતી.

$\frac{1}{15750}$ દેખાકુત ફૂતિની જાણ કરાશે. ટાલ-ટિકિટે ચોંટાદેલું કવર મોકલવું હશે તો અસ્વીકૃત ફૂતિ પરત કરવામાં આવશે, અન્યથા ફૂતિ અસ્વીકૃત ગણવી. પોસ્ટકાર્ડ મોકલવું હશે તો અસ્વીકૃતિની જાણ કરાશે.

$\frac{1}{15750}$ પ્રત્યેવંઘારનું સરનામું : તંત્રી, 'પરબ', ગુજરાતી સાહિત્ય પરિષદ (પ્રકાશન વિભાગ), ગોવર્ધનભવન, આશ્રમમાર્ગ, 'થાઈમ્સ' પાછળ, નાદીકિનારે, પો.બો. ૪૦૬૦, અમદાવાદ ૩૮૦૦૦૮

**'પરબ'** સંવર્ધક : ગુજરાત સ્ટેટ ફિલ્મલાઇઝર્સ ઓન્ડ કેમીકલ્સ લિ., વડોદરા

E-mail : gspamd@vsnl.net

ફોન અને ફેક્સ : ૨૬૮૮૭૮૮૭

Web-site : [www.gujaratisahityaparishad.org](http://www.gujaratisahityaparishad.org)

[www.gujaratisahityaparishad.com](http://www.gujaratisahityaparishad.com)

ISSNO250-9747 પરબ

છૂટક ક્રિ.  $\_ 20/-$

માલિક : ગુજરાતી સાહિત્ય પરિષદ વતી મુદ્રક અને પ્રકાશક : ઉભા ઉપાધ્યાય (પ્રકાશનમંત્રી), ગોવર્ધનભવન, આશ્રમમાર્ગ, ગુજરાતી સાહિત્ય પરિષદ માર્ગ, અમદાવાદ ૩૮૦૦૦૮ તંત્રી : યોગેશ જોધી મુદ્રણસ્થાન : શારદી મુદ્રણસ્થાન, ૨૦૧, તિલકરાજ, પંચવટી પહેલી લેન, આંબાવાડી, અમદાવાદ ૩૮૦૦૫૬ સાયન્સ સ્કૉર્પિન્સ ૨૦૧૫

## તાર્ફાં

પ્રમુખપદેથી : સાહિત્ય અને પદ્ધનાટક, ધીરુ પરીખ ૬

કવિતા : જળ અને માછલી, કિશોરસિંહ સોલંકી 10, પવનપીઠ પર લયની લગની, ભગીરથ બ્રહ્મભણ 12, બે ગીત, સંજુ વાળા 13, ત્રણ હાઈકુ, ધનસુખલાલ પારેખ 14, બીક ના બતાવો મને, હરીશ દાસાણી 15

વાર્તા : નવાં પ્રયાણ, પ્રવીષસિંહ ચાવડા 16, સારા દિં, રામ મોરી 28

નિબંધ : દિલ્લીકોણ અને અભિપ્રાય, નિર્ભિશ ઠાકર 35, પ્રથમ ગ્રાસે શર્કરા, અરુણા જોજા 39

ભારતીય સાહિત્ય : બે કાવ્યો (બંગાળી), સુનીલ ગંગોપાધ્યાય; અનુ. રમણીક સોમેશ્વર 44, પોરોકાકાની યાદ, પીટર બિક્સલ, અનુવાદ : રમણ સોની 45

આસ્વાદ : બારી બહારનું દર્શન, વિનોદ જોશી 50

### ૨૮મું શાનસત્ર

આચમન : નિબંધની ઝંખી પડતી જતી છબી, કિશોરસિંહ સોલંકી 54, કવિતાની અતિવૃદ્ધિ : વર્ષ 2012-13ની કવિતાનું સરવૈયું, સુધી ચૌંધાણ 61

સમીક્ષા/ગ્રંથાવલોકન : સ્વીકૃત સંવેદનાનો માપદંડ, ડૉ. પન્ના ત્રિવેદી 71, રત્નિલાલ બોરીસાગરનું ‘ભદ્રભદ્ર’ અમર છે !, અશોક દવે 73, પુત્રના હંદ્યસ્પર્શી પત્રો, ક્રીતિદા શાહ 76, શિશુપ્રેમી સોનીએ ઘડેલાં મૂલ્યવાન ઘરેણાં, ઈશ્વર પરમાર 79

### આવરણચિત્ર

સંદર્ભનોંધ : પીપુષ ઠક્કર 81

આપણી વાત : સંકલન : પ્રકુલ્લ રાવલ 82

પત્રસેતુ : એન. એલ. રાठોડ 86

આવરણ : નીલિમા શેખ

ધીરુ પરીખ

નાટક મુખ્યત્વે માનવજીવનનાં વિવિધ મૂલ્યો અને તેનું દાર્શનિક જ્ઞાન આપવા સંસ્કૃત ભાષાકાળથી આપણે ત્યાં ખપમાં લેવાતું આવ્યું છે. આપણે ત્યાં કાવિદાસ ઈત્યાદિનાં નાટકોમાં આ ગદ્યપદ્યમિશ્રિત રીતિ જોઈ શકાય છે. અંગેજમાં શેક્સપિયર વગેરેમાં પણ ગદ્યપદ્યમિશ્રિત રીતિ જોવા મળે છે. એ પૂર્વે ગ્રીક નાટકો કે મધ્યયુગ દરમિયાન યુરોપનાં મિરેકલ પ્લેઝ (miracle plays) પણ પદ્યમાં રચાત્માં હતાં. પરંતુ ત્યારબાદ નાટકો પદ્યાભિમુખ થવાને બદલે પદ્યવિમુખ થતાં ગયાં.

પણ વીસમી સદીમાં આ પદ્ધનાટક પુનઃ સર્જવા લાગ્યાં જેમાં યેટ્સ (Yeats) અને ટી. એસ. એલિયટ (T. S. Eliot)નો ફાળો પ્રમુખ રહ્યો છે. આ હડીકરણે ફેઝરે (Frazer) પોતાના ‘ધ મોર્ડન ચાઈટર એન્ડ ડિઝ વર્ક્સ’ (The Modern Writer and His World)માં જણાવ્યું છે કે ‘We have seen that by the 1930 all the various types of prose drama which we have been considering might be said to have reached a dead end.’ (આપણે જોયું કે ૧૯૩૦ના દાયકામાં ગદ્યનાટકના વિવિધ પ્રકારો સ્વીકારાયા છે તે જોણે તેના અંત તરફ પહોંચ્યો ગયા છે.) બનર્જી શૌંનાં નાટકોમાં નાટ્યના પ્લોટને સ્થાને તરંગલીલાને વધારે મહત્વ અપાયેલું જણાય છે. વળી પાત્રોને સ્થાને જોણે રેખાચિત્રો વધુ આકર્ષક બન્યાં છે. એમનો આશય જૂની વિચારસરણીની સાથે નવ્ય વિચારણાને પ્રાધાન્ય આપવાનો છે.

પરંતુ ટી. એસ. એલિયટે ‘The Rock’ (ધ રોક), ‘Murder in the Cathedral’ (મર્ડર ઈન ધ કથીડ્રલ) તથા ‘The Family Reunion’ (ધ ફેમિલી રિયુનિયન) એમ ઉત્તરોત્તર પોતાનાં નાટકોમાં પદ્યનો મહિમા કર્યો છે અને તેની નાટ્યાત્મક પ્રભાવકતા વધતી જતી જોવા મળે છે.

આપણે ત્યાં મધ્યકાળમાં પ્રેમાનંદે પોતાનાં કેટલાંક આખ્યાનોમાં પ્રસંગોપાત સંવાદો મૂકેલા છે. ‘સુદામાચરિત’માં સુદામા અને તેમનાં પત્ની વચ્ચેનો આ સંવાદ નાટ્યાત્મક છે :

‘જઈ જાયો જાદુવરાય, ભાવઠ ભાંગશે રે;  
હું તો કહું છું લાગી પાય, ભાવઠ ભાંગશે રે;  
ધન નહિ જડે તો ગોમતી-મજાન-હરિદર્શન-ફળ નવ જાય’

સુદામા જવાબ આપે છે :

સુદામા કહે : ‘વિપ્રને નથી માગતાં પ્રતિવાય  
પણ મિત્ર આગળ મામ મૂકી નાચત્માં જીવ જાય.  
માન ન મૂકીએ રે.’

આમ છીતાં આ આજ્યાનો છે. નાટકની કેટલીક કષો પ્રેમાનંદે ઝડપી લીધી છે અને તેને પાત્રમુખે પવસંવાદ પણ પ્રયોજ્યા છે.

આ જ રીતે આપણે ત્યાં ગુજરાતની જૂની રંગભૂમિનાં નાટકોમાં પણ જ્યારે ઊર્મિ-સંવેદનની ઉત્કટ્તા આવતી ત્યારે પાત્રો ગીત ગાતાં. એટલે એ નાટકોમાં પણ પવનો ઉપયોગ થયેલો છે. ભવાઈમાં પણ પાત્રો દેશી ઢાળોમાં ગીતો ગાતાં. આમ, નાટકમાં પવનો ઉપયોગ તો થતો જ આવ્યો છે પણ આપણે ત્યાં સંપૂર્ણ પવનાટકની વિભાવના ન્હાનાલાલમાં કરીક અંશો જોવા મળે છે. એમણે એને હોલનશૈલી કહી છે તે જ પવના લયડોલનની સૂચક છે. અલબત્ત, એ ગાય ન્હાનાલાલને અંગ્રેજી બ્લેન્ક વર્સની અસર તળે નિપાજાવવાની પોતાનાં નાટકોમાં આવશ્યકતા જણાઈ છે. આ વિશિષ્ટ લયાત્મક ગદને એ પવનો પર્યાય માની હોલનશૈલી કહી નાટકમાં પ્રવૃત્ત રચ્યા છે.

ત્યારબાદ પવનાટકની દિશામાં સભાન પ્રયત્ન ઉમાશંકર જોશીમાં જોવા મળે છે. તમે એને સંવાદ-કાવ્યો પણ કહી શકો. પણ સંવાદ કે એકોકિત્ત દ્વારા પાત્રનો વાચિકમું અને આંગિકમું અભિનય પ્રકટતો હોય છે તેથી ત્યાં પવનાટકની પૂરી સંભાવના છે. એમના 'પ્રાચીના' અને 'મહાપ્રસ્થાન'માંની રચનાઓ આપણે ત્યાં આ પવનાટકની દિશામાં સફળ આરંભ છે. એમના 'મંથરા' કાવ્યમાં શરૂમાં ૨૮ પંક્તિની મંથરાની પ્રલંબ ઉક્તિ પછી નાટ્યાત્મક સંવાદ રચાય છે. મંથરાની આ ઉક્તિ સાંભળીને બાલિકા પૂછે છે અને પવાત્મક નાટ્યસંવાદ રચાય છે :

બાલિકા : ધાત્રીને તો ધુક્કારી તેં દૂર કરી,  
તેજોદારી તણી તેને અસૂયા ના જેવીતેવી.

મંથરા : કોણ છે તું, અલ્યમતિ, અતિભાષિષ્ઠી અબુજ ?

બાલિકા : હું તો છું છે જુલા, મને ઓળખી ના ?

મંથરા :

ના..

જુલા :

સુભગે !

માનીશ તું હું છું તું જ.

મંથરા : નાનકડી આવડી હું ?

અલબત્ત, આમાં નાટકમાં જે બોલચાલની સહજ પદાવલી જોઈએ તે ક્યાંક ખોડંગાય છે. પણ એમાં વાચિકમું અવશ્ય અનુભવાય છે અને તે દ્વારા થોડો આંગિકમું અભિનય પણ સિદ્ધ થાય છે.

નાટકમાં વાચિકમું અને આંગિકમું બને સહજ રીતે આવે તો તે સફળ નાટ્યકૃતિ બને અને પવનમાં પવલયની વિશેષતાને કારણે કદાચ કવિ પવનાટકમાં સાહજિક ભાષાકર્મથી થોડા દૂર હઠી જતા હોય છે. આમ, આપણે ત્યાં પવનાટકનો સાચો આરંભ ગાંધીયુગ અને ઉમાશંકર જોશીથી થાય છે.

ત्यारबाद राजेन्द्र शाहे पण पद्धनाटक पर कलम अजमावी છે. એમના પ્રથમ કાવ્યસંગ્રહ ‘ધ્વનિ’માં ‘શૈખ અભિસાર’ અને ‘પ્રાસાનુપ્રાસ’ આ પ્રકારની રચનાઓ છે. તો ‘શ્રુતિ’ કાવ્યસંગ્રહમાં ‘પદ્માવતી’, ‘શાન્ત ડેલાહલ’ સંગ્રહની ‘હેરિયો અને ફક્કડ’ આ પ્રકારના પદ્ધનાટકની ગતિ સૂચવતી કૃતિઓ છે. તો વળી ‘પ્રસંગસપ્તક’ નામના એમના કાવ્યસંગ્રહની સાતેય રચનાઓ આવાં પદ્ધનાટકો છે. ‘શૈખ અભિસાર’ એ એમનું પ્રથમ પદ્ધનાટ્યાત્મક કાવ્ય છે. મરણશાયા પર પેલી એક વ્યક્તિને યમરાજના આગમનનો અણસાર આવી જાય છે. એ જવા તૈયાર છે. આસપાસનાં લોકો મરણશાયા પર પેલી વ્યક્તિની અંતિમ ક્ષણોથી વ્યથિત થઈ કંઈક અવાજ કરતા હોય, રોકકળ કરતા હોય તે સ્વાભાવિક છે. ત્યારે આવાં લોકોને તેમ કરતાં રોકવાની ઉક્તિથી કાવ્યનો આરંભ થાય છે. મરણશાયા પર શ્વસતી સ્ત્રી ઉચ્ચારે છે :

સ્ત્રી :

ચૂપ હો, એ પધારે છે,  
એના મહિષનો દૂર  
ઘૂઘરો રણકે જેનો ઓરો ઓરો પડે ધ્વનિ.

મરણશાયા પર પેલી સ્ત્રીની ઉક્તિની પ્રથમ ત્રણ પંક્તિમાં જ આપણે વાચિકમ્ભૂની સાથે સાથે નાટ્યોચિત આંગિકમ્ભૂ પણ અનુભવી શકીશું.

પહેલી જ પંક્તિ ‘ચૂપ હો, એ પધારે છે’માં ‘ચૂપ હો’ શબ્દોમાં જાણે નાક પર આંગળી મૂકી આસપાસના સ્વજનોને, શોકાતુર સ્વજનોને, ચૂપ થઈ જવા કહે છે, અને શા માટે ? તો જવાબ છે ‘એ પધારે છે’. આ ‘એ’ કોણ ? વાચકને જિજ્ઞાસા જાગે તે સ્વાભાવિક છે અને ક્યાંક કોઈના આવવાનું નિહાળવા સહુ તત્પર બની જાય એવું દશ્ય પણ સર્જય છે. પણ એ જે આવે છે તેનો ઉલ્લેખ તેના આગમનના કોઈક રવથી સૂચવાય છે.

‘એના મહિષનો દૂર  
ઘૂઘરો રણકે જેનો ઓરો ઓરો પડે ધ્વનિ.’

આ અવાજ આવે છે તે ઘૂઘરાનો રણકો છે. આ ઘૂઘરો કોનો ? સ્ત્રી કહે છે કે એ મહિષનો છે. આ ‘મહિષ’ શબ્દથી કવિએ મૃત્યુના દેવ યમરાજનું આગમન સૂચવી દીધું છે. આમ, પુરાણકલ્યાણના ઉપયોગથી મૃત્યુક્ષણની નિકટતા અને નિશ્ચિતતા દર્શાવી છે. આમ તો પેલી મરણશાયા પર પેલી સ્ત્રીને એ અવાજ દૂરથી આવતો સંભળાય છે. પણ કવિએ ત્રીજ પંક્તિમાં ‘ઓરો ઓરો’ શબ્દો વાપરીને યમરાજની ગતિ નજીક આવી રહી છે તે પેલી સ્ત્રીને સમજાઈ ગયું છે તે દર્શાવી આપ્યું છે.

આ રીતે આ સંવાદકાવ્યની પ્રથમ ત્રણ પંક્તિમાં જ કવિએ વાચિકમ્ભૂની સાથે નાટ્યોચિત આંગિકમ્ભૂને પણ આવરી લીધો છે.

બંગાળીમાં પણ પદ્યનાટક લખવાનો પ્રારંભ થઈ ગયો હતો. માઈકલ મધુસૂદન દરે (૧૮૨૪-૧૮૭૬) આ પ્રકારમાં ત્યાં ઓળખાતા ‘અમિતાક્ષર’ છંદમાં લખ્યું છે અને એમાં સાત કરી હોય છે. ત્યાં એમણે મુક્ત છંદથી કામ પાડ્યું છે. પણ ત્યાર પછી રવીન્દ્રનાથે સફળ પદ્યનાટકો આપ્યાં છે. આ ગાળો ૧૮મી સદીનો અંતિમ તબક્કો હતો. ‘ચિત્રાંગદા’, જે ૧૮૮૦માં લખાયું તે, એમનું નોંધપાત્ર પદ્યનાટક છે. પછી તો એમણે ‘વિદાય અભિશાપ’ (૧૮૮૪), ‘માલિની’ (૧૮૮૬), ‘ગાંધારીર આવેદન’, ‘સતી’, ‘નર્કવાસ’ (ત્રણેય ૧૮૮૭)માં, ‘લક્ષ્મીની પરીક્ષા’ (૧૮૮૭), ‘કર્ણકુર્તી-સંવાદ’ (૧૮૮૮) જેવા વિવિધ પૌરાણિક અને લોકકથા-આધારિત વિષયોને કેન્દ્રમાં રાખીને પદ્યનાટકો આપ્યાં છે.

આ રીતે પદ્યનો નાટકમાં ઉપયોગ કરવાની પ્રથા પદ્ધિમમાંથી આવી. એવીયટ તો કહેતા કે જે નાટ્યકાર કવિ ન હોય તે અધમ કક્ષાનો નાટ્યકાર છે. આ રીતે પદ્યનો પદ્યનાટકમાં પ્રયોગ થવો એ આવકાર્ય ઘટના બની રહી. પદ્ધિમમાં અને આપણે ત્યાં પણ વીસમી સદીના ઉત્તરાર્ધથી પદ્યનાટકો લખાવાં શરૂ થયાં છે; પણ વાત આટલેથી અટકતી નથી. પદ્યનાટકમાં ‘નાટક’ મહત્વનું પદ છે. એટલે એમાંનું પદ અભિનયક્ષમ બને તે સર્જેક્ટ જોવું રહ્યું.

## જળ અને માઇલી | કિશોરસિંહ સોલંકી

નદી વહે છે  
નદી છે તો કિનારા છે  
કિનારા છે તો નદી છે  
નદી ને કિનારાને જળ જોઈ રહે છે.



નદીમાં માઇલી છે  
નદી અને માઇલી  
એકબીજાને શોધતાં શોધતાં  
જળ બની જાય છે.



જળમાં નદી છે  
નદીમાં જળ છે  
બન્ને પોતપોતાનું નામ કોતર્યા કરે છે  
કિનારા જોયા કરે છે.



નદી રૂમળૂમ ચાલતી જાય છે  
એકએક એને પ્રશ્ન થાય છે :  
જળ અને માઇલી એકબીજાની સાથે  
અતૃપુરુષ સંબંધી જોડાયેલાં હોવા છતાં  
જોડાયેલાં નથી એવું કેમ થયા કરે છે ?



આ પ્રશ્નને પણ દર્શાની જેમ આંખો છે  
આંખોમાં પવન ખૂંગે છે  
માઇલી પવન વાગોળે છે.



માઇલી સરક્યા કરે છે  
ફરક્યા કરે છે  
નથી ઘર કે માળો બનાવતી  
બસ, તર્યા કરે છે સતત.  
માઇલી સિધર કે અસિધર  
ફક્ત રાહ જોતી હોય છે તરવાની

તરતાં તરતાં તરી જવાય છે  
એટું એ સ્પષ્ટપણે માને છે.

□

જળમાં માછલી  
માછલીમાં જળ  
જળમાં આકાશ  
આકાશમાં વાદળ  
વાદળમાં જળ  
જળમાં માછલી  
એવી સંતાકૂકરી રમતો સમય  
પાંખો ફિફડાની ઊડતો રહે છે.  
માછલી તો નિરાંતે નદીનો  
ખળ...ખળ... આનંદ માણે છે.

□

માછલી જળમાં હોવા છતાંય  
જળમાં હોતી નથી  
જળના અવકાશને એ  
પૂછુંધીથી હલાવ્યા કરે છે  
છતાંય કોરી ને કોરી જ હોય છે.  
વહેતા જળમાં સ્થિર બનીને ઊભી રહે છે  
પસાર થતી પળ પળને પીધા કરે છે.

□

કૃપારેક માછલી મરીને જીવતી લાગે છે  
એ જાણે છે કે  
જળ સાથેનો એનો સંબંધ  
પથ્થર અને ઘડા જેવો છે  
ઘડા ઉપર પથ્થર પડે  
કે પથ્થર ઉપર ઘડો પડે  
આખરે ફૂટવાનું તો ઘડાને જ છે.

□

માછલીને ખબર છે કે  
જળ જ એનો જીવતમા છે  
એ જળના દેહને સારી રીતે જાણે છે.  
જળની છાયામાં સરકતી માછલીમાં

પ્રકૃતિની ચેતનાવંસું પ્રતિબિંબ પડે છે.

□

પ્રકાશ માછલીનો આત્મા છે  
આત્માથી આત્માને જાહી શકાય છે  
સત્યના આધારે માઝી શકાય છે.

□

માછલી તરતી તરતી  
ખોબામાં સમાઈ જાય છે  
પૂછે છે : હું ક્યાં હું ?  
જીવાબ મળે છે : અર્દ્ધના ખોબામાં.  
મારું પાલન-પોષણ કરો  
તમને પાર ઉતારીશ : માછલીએ ખોબાને કહું.  
શાની પાર ? ખોબાના જળમાં પ્રશ્ન પ્રગટ્યો  
જળ જગતને ગળી જશે, તારે બચવું છે ?  
તો મને બચાવ, એવું માછલી દટ્યાણે કહે છે.  
જે બચે છે એ જ બીજાને બચાવે છે.

□

માછલી સરકે છે  
ખોબામાંથી ઘડામાં  
ઘડામાંથી તળાવમાં  
તળાવમાંથી સમુદ્રમાં  
સમુદ્રમાંથી સર્જનમાં  
સર્જનમાંથી સર્જન્યા કરે છે  
જગતના ઉત્પત્તિકણથી....

### પવનપીઠ પર લયની લગની | ભગીરથ બ્રહ્મભક્ત

પવનપીઠ પર લયની લગની  
પલ પલ ઉપર પાકો ટંકો  
કણ કણ ઉપર અસલી આંકો  
જળ પણ લય છે લય છે અગનિ !  
મધ્યમધ મધ્યમધ ધરતી હુંકે  
આભ ઊંઘડે અચરજ હુંકે  
દ્વો, મેં માંડી કથા વિહગની....

## બે ગીત | સંજુ વાળા

### ૧. ચાલ્યા માળવા

આછા રે અણસારે મારગ ખાળવા

બે કંઠનાં બાંધ્યાં ઘમ્મર પૂર

મહાનદ વાટે ચાલ્યા માળવા

કહ્યું ચંદને ધીમા તપજો

સૂરજને બે હાથ જોડવા નહીં ઠરવાને

અજબ રચાયો માદ્ય માદ્ય માહોલ

નીકળ્યા ગગનગોખ પર ઝરમરવાને

ચડવા ને ઉત્તરવા કમનીય ઢાળ અને

ઢોળાવ કળાયલ કળવા

બે કંઠનાં બાંધ્યાં ઘમ્મર પૂર

મહાનદ વાટે ચાલ્યા માળવા

ભાણ્યા જળ ને કમળ નિહાળ્યા

જેના પર પદ્માસન વાળી પવન વિરાજે

ગાય દિશાઓ મંગળ, નભ-નક્ષત્રો વાજે,

લય બેઠા એ સ્થાને આજે

ત્યાં લગોલગ આસન રચવા

શાહીથી કડાર્ય બાજઈ ઢાળવા

બે કંઠનાં બાંધ્યાં ઘમ્મર પૂર

મહાનદ વાટે ચાલ્યા માળવા.

### ૨. ધા.

બહુ ગમતા આ ધા.

તમે કહ્યું : કાજળમાં અગાણિત

રંગ ભાળ અથવા તો ઉઠી જા

બાવાજી, અમને બહુ ગમતા આ ધા.

હતું નજરથી નજીક અને

વનવગડે જઈ શોધ્યું

નાહકનું નતમસ્તક થઈને

અધકચરાને પોસ્યું.

કયા કારણસર નર્યા બતાવા  
 સામે હો કરવાનું તા થૈ તા  
 બાવાજી, અમને બહુ ગમતા આ ધા.  
 ભળી કુતૂહલ ભેળી ભમજા  
 ના ભાળે કેં ચોખ્યું  
 શાનગુંચના આટે-પાટે  
 તળ ઉલેચ્યાં, લોચ્યું.\*  
 ઊંડળમાં લીધા અડસણી  
 જેમ ફૂકતા વેરાનોમાં વા  
 બાવાજી, અમને બહુ ગમતા આ ધા.  
 નીંદરનાં સૌ પડળ ખોલવાં  
 કરી વિનવણી એવી  
 નરી ફૂકથી કરી ઠંશારો  
 વાત કરી નહીં જેવી.  
 શું કરવું કયાં જઈ નાખવી  
 અડાલીડમાં સમજણ નામે ધા  
 બાવાજી, અમને બહુ ગમતા આ ધા.

\* લોચ્યું = વાળનું લોચન કરવું

### ત્રણ હાઈકુ | ધનસુખલાલ પારેખ

વળાવી બાને  
 વાડામાં મૂરાતો  
 તુલસીક્યારો.

વરસાદમાં  
 બંજારો, અંદરથી  
 કોરોધાકોર.

આંગણો રસે  
 છ ગલ્લુડિયાં, પત્ની  
 ભીતર રૂએ.

બીક ના બતાવો મને	થોડુંક ગંડપણ હશે
- કે તું ન રહીશ.	ન
દવા લે, કસરત કર	થોડુંક શાશપણ હશે.
ખાવામાં ધ્યાન રાખ.	ચિંતા ના કર.
તારાં નામ-રૂપ,	જે કઈ મારી પાસે હશે.
સ્મૃતિ-સંબંધ,	તે તારી પાસે પણ હશે.
ખતમ થઈ જશે બધું.	મારા જિસ્સામાં હશે
શું ફરક પડે મને ?	કે તારા પરસ્યાં હશે;
હું આઈ હોઉં કે ત્યાં;	તારું તે માનું
હું કાલીદાસ હોઉં કે	I. D. Card
પાખલો નેરુદાસ;	મારી પાસે પણ હશે.
માઈકલ ઓન્ઝેલો હોઉં	તારી પાસે પણ હશે.
કે પણી પન્નાવાલ ઘોષ;	તારો થોડોક ચહેરો
શું ફરક પડે મને ?	મારામાં હશે;
પાછો આવીશ.	ને મારા હાથ-પગ
ફરકવીશ ધજા.	તારામાં હશે.
સૂતેલો માણસ	તારી વ્યવહાર-બુદ્ધિ
ગમે ત્યારે ઉભો થાય છે;	મને લગ્ન-પ્રસંગે
ચાલવા લાગે છે;	કામ લાગણે;
બોલવા લાગે છે -	મારી કવિતા
ને ફેલાય છે ચારેબાજુ.	તને મુશાયરામાં કામ લાગણે.
એ શું તમે રોજરોજ	ચિંતા ના કર.
જોતા નથી ?	જે કઈ તારી પાસે હશે
	તે મારી પાસે પણ હશે.

## નવાં પ્રયાણ | પ્રવીજાસિંહ ચાવડા

ડી.કે.ને સમાચાર એમની પત્નીએ આપ્યા. ઓટલા પર બેસી છાયું વાંચતા હતા ત્યાં એ ચાનો ખાલી કપ લેવા આવી. સ્ત્રીની આ મર્યાદા હતી : સ્વામી ઘેર ઉપસ્થિત હોય ત્યારે તે એમનાથી દૂર રહી શકતી નહીં; કોઈ ને કોઈ બહાને એમની પાસે પહોંચી જતી અને શાક સમારવું કે ચોખા વીજાવા એ પ્રકારનું કામ લઈ સામે બેસી રહેતી. ડી.કે. ગંભીર પ્રકૃતિના અને અભ્યાસું માણસ; રાજકારણથી લઈ ધર્મકારણ સુધીના લેખો એમને જીજાવટથી વાંચવા જોઈએ. તેથી, સગાંસંબંધી અને પડોશીઓ વિશેની ક્ષુલ્લક વાતો પત્ની મીઠાશથી, વિવિધ હાવભાવ સાથે કરે તે એમના સુધી પહોંચતી નહીં. આ રીતે, પત્નીની એ પ્રવૃત્તિ નિર્દોષ હતી ! પતિના કાર્યમાં એનાથી વિક્ષેપ પડતો નહીં અને પત્ની દામ્પત્યની પ્રસન્નતા માઝાનો સંતોષ લઈ શકતી.

એ ચાલી ન ગઈ; કપરકાબીને રમાડતી સામે ઊભી રહી, ‘પેણું તમે જાણ્યું ?’

ડી.કે.એ માત્ર પ્રશ્નાર્થમાં ભવાં ઉંચાં કર્યા.

‘આપણને આજ સુધી ખબર જ ન પડી. બોલો, કેવું કહેવાય !’

‘શાન્દું કેવું ?’

‘કે’છે કે પેલી બીના તો અહીં અમદાવાદમાં જ છે.’

‘કઈ બીના... શાની બીના ?’

‘હુંસાકાકીની બીના, બીજી કર્દ વળી ! ભણીને વકીલ બની છે અને કોર્ટમાં પ્રોક્રિસ કરે છે, બોલો !’

કોના વિશે વાત થઈ રહી હતી તે સમજવામાં ડી.કે.ને વાર લાગી તેનું કારણ એ કે અન્ય લોકો માટે બીના તે એમને માટે બીનકી હતી.

છાપામાંથી નજર હટાવ્યા વગર એમણે કહ્યું, ‘હશે. આપણે એવી પંચાતમાં પડવું નહીં.’

‘નામ પણ બદલી નાખ્યું છે : બીના કશયપ ! પછી કોઈને ખબર કેવી રીતે પડે ? આ તો કોર્ટમાં કોઈ જોઈ ગયું. આ કશયપનું પૂંછડું ક્યાંથી લગાવ્યું હશે ?’

‘બીજું મેરેજ કર્યું હશે. કોઈ કશયપને પકડયો હશે. મેલ ને કડાકૂટ !’

બીનાનું પ્રકરણ ઘણું જૂનું હતું, અની પરણીને ડી.કે.ના ઘેર આવી એ પહેલાંનું, તેથી એણે એને જોઈ નહોતી; લોકો પાસેથી માત્ર એના વિશે સાંભળ્યું જ હતું. બીનાનાં લગ્ન છેક બનારસ થયાં હતાં. શાતિનાં થોડાં કુટુમ્બ પેઢીઓથી બનારસ વસતાં હતાં તેથી લગ્ન શાતિમાં જ થયાં ગણાય, પણ અજાણ્યો પ્રદેશ, ભાગ્ય જુદ્દી, સંસ્કારો જુદ્દા, એમાં શું બન્યું તેની સ્પષ્ટ ખબર પડી નહીં. ભાગી ગઈ, કાઢી મૂકી કે કોઈ ઉપાડી

ગયું, પિયરમાં મા-બાપ રહ્યાં નહોતાં અને કલંકિનીને શોધીને પાછી લાવવામાં ભાઈ-ભાભીને રસ નહોતો.

આજે તો કોઈ એને યાદ પણ કરતું નહોતું.

‘બચ્યારી !’

સ્ત્રીના નિશ્ચાસ સાથે ચર્ચા પૂરી થઈ. સામેથી હેંકારો મળ્યો નહીં તેથી થોડી વાર આધીપાછી થઈ એ રસોડામાં ચાલી ગઈ. વાંચતા હતા તે લેખ પૂરો કરી ડી. ડે. પણ ઊભા થયા અને પ્રાતઃકર્મનો શેષ ભાગ પતાયો.

બાથરૂમમાંથી નીકળતાં ચપટી વગાડી, ‘જલદી થાળી પીરસજે; મારે હાલ બહાર જવું પડે તેમ છે. એક અરજન્ટ કામ યાદ આવ્યું.’

કેવું કામ શાનું કામ એવો પ્રશ્ન સ્ત્રીએ કર્યો નહીં. ડી. ડે.ને બીજા પુરુષો જેવું નોકરી કે ધંધાનું બંધન નહોતું તે સાચું, પરંતુ એ હંમેશાં દોડધામમાં રહેતા.

ખાસસું મોડું થયું હતું કારણ કે ઓટલે બેસીને ચા પીધી અને છાપાનો અભ્યાસ કર્યો તે સમય સવારનો નહીં, બપોરનો હતો. આગલી રાતે ઘેર આવતાં લગભગ ત્રણ વાગી ગયા હતા તેથી ડી. ડે.ની સવાર બપોરે એક વાગ્યે પડી હતી. સામાન્ય રીતે પણ એમની દિનચર્ચા અનિયભિત રહેતી. ઘણી વાર સવારે વહેલા નીકળી જવું પડતું. એથી ઊલદું, કોઈ વાર આખો દિવસ ઉંઘ્યા કરતા અને સાંજના પાંચ પછી પ્રાતઃકર્મ પતાવી બહાર જતા.

બૂટ પર બ્રા ફેરવતાં એમણે કહ્યું, ‘રાત્રે કદાચ મોડું થાય. મારું ડેકાણું નહીં.’

આ વિધાન ઔપયારિક હતું. સ્ત્રીને ઉપયોગી થાય એવી કોઈ વિશેષ માહિતી એમાં નહોતી. ઘેરથી નીકળે પછી પરત આવવા બાબતે હંમેશાં અનિશ્ચિતતા રહેતી. કલાક – બે કલાકનું કહીને ગયા હોય અને ચાર-પાંચ દિવસે આવે. સ્ત્રી સમજતી હતી અને ગર્વ સાથે લોકોને કહેતી કે એમને હજાર કામ હોય. મોટા માણસો સાથે બેઠક ઉંઠ. રાજકારણી જેવા પોશાકવાળા માણસો ગાડીઓ લઈને આવતા અને એમને ઉપાડી જતા. એ બધા એમને ડી. ડી. કહેતા. ધીમે ધીમે એ જ નામ ચલાણમાં રહ્યું હતું; દિનકર, દિનુભાઈ ભુલાઈ ગયા હતા.

શરૂઆતમાં સ્ત્રીને પતિની કેટલીક પ્રવૃત્તિઓ સામે વાંધો હતો. એ કહેતી : બધું બરાબર, ભઈસા'બ, પણ તમે પેલું બંધ કરો. ‘જુગાર’ એવો શબ્દ હોઠ પર આવે તો શરીર અને મન અભડાઈ જાય એમ માનતી હશે તેથી કહેતી, ‘પેલું.’ ડી. ડે.ને એની પ્રત્યે સહાનુભૂતિ હતી. બાળવાર્તા કહેતા હોય એવી લઢણથી એમણે એને સમજાવ્યું હતું કે જાહેર જીવનમાં, મોટા માણસો સાથે વ્યવહાર હોય ત્યારે અમુક... કરવું પડતું હોય છે. વળી, આ સાચું અને પેલું ખોટું એવું નક્કી કોણે કર્યું ?

વગેરે.

વર्तमान समयमां पत्तीने કોઈ ફરિયાદ નહોતી. ડી. કે.ના આકાશી યાન સાથે એજે પોતાનું રમકું જોડી દીધું હતું. પરિણામે, પતિનું જીવનદર્શન ટપક પદ્ધતિએ બેનામાં પ્રવેશી અણુઅણુમાં પ્રસરી ગયું હતું. એમની ભાષા બોલતી અને એમના જેવા મુખભાવ કરતી.

એમના જ્ઞાનમાં તપતી. રસિકતામાં ભીજતી.

તે સાંજે છ વાગ્યે ડી. કે. ઓડવોકેટ બીના કશ્યપની ઓફિસમાં, એમની સામે બેઠા હતા.

હાડમારી ઓછી નહોતી પહોંચી. ઘણા કોઠા બેદવા પડ્યા હતા. ભડ, મીરઝાપુર, ધીકાંટા - કોઈ ક્યાં એક હતા ? વકીલો અને ગુમાસ્તાઓના જંગલમાં ખાસ્યું અથડાયા પછી માહિતી મળી કે બીના કશ્યપ જેમાં પ્રોક્લિસ કરતાં હતાં તે કોઈ તો નવા સંકુલમાં ખસેડવામાં આવી હતી. તાબડતોબ રિક્ષા પકડી એ સ્થળે પહોંચ્યા, પરંતુ વકીલસાહેબ એ પહેલાં નીકળી ગયા હતા. એક ગુમાસ્તાને જાત્યો અને એ ભલા માણસે બે-પાંચ જગ્યાએ પૂછ્યપરછ કરી રહી કાગળની કાપવી પર નામ-સરનામું અને ટેલિફોન નંબર લખી આપ્યાં.

આમ ઘણું કુટાંતું પડ્યાં. રિક્ષામાં પૈસાના ધૂમાડા થયા. એમની જગ્યાએ બીજો કોઈ માણસ હોય તો એટલેથી કામ મુલતવી રાખે. એવું વિચારે કે ચાલો, સરનામું તો હાથમાં આવી ગયું છે; કાલે મળાશે. એક હિવસમાં માણસ ક્યાં નાસી જવાનું છે ? પરંતુ ડી. કે. ખંતીલા માણસ હતા. આજનું કામ કાલ પર ઠેલવાની વૃત્તિ એમનામાં નહોતી. કોઈ પણ પરિસ્થિતિમાં નિરાશ ન થવું તે એમનો બીજો ગુણ. ઉલટાનું, વિઘ્નો આવે તેથી એમના સંકલ્પને બળ મળતું અને ધ્યેયસિદ્ધ માટેની ધગશા વધારે પ્રબળ બનતી.

અંતે, પાલકીની એક શાંત શેરીમાં ‘બીના કશ્યપ, ઓડવોકેટ’ એવું પાટિયું મળ્યું. અધિકારથી ઓફિસમાં પ્રવેશ કર્યો, ગુમાસ્તો કંઈક પૂછ્યવા ગયો તેને હાથના ઝાટકાથી ચુપ કરી દીધો, વકીલની ચેમ્બરનું બારણું થોડા ઢેંચ ઉઘાડ્યું અને છાયાથી લળીને પ્રવેશ માટે મંજૂરી મારી. ‘આવી શકું, મેડમ ?

પછી, ઉત્તરની રાહ જોયા વગર અંદર સરકી ગયા.

વકીલની સામે બે માણસો બેઠા હતા અને કોઈ કેસની ચર્ચા ચાલી રહી હતી. એમને વિક્ષેપ ન પડે એ રીતે ડી. કે. ભીત પાસેની એક ખુરશીમાં, શરીરને નાનું બનાવીને ગોઈવાઈ ગયા. ઓળખાણ પડી હોય એવું લાગ્યું નહીં, એટલે કે, બીનકી એમને ભૂલી ગઈ હતી. ઓ કે, ગુડ. કાળ નામના દેવતાનું પરાક્રમ !

ખરી ગમ્મત તે પછી થઈ. નિરાંતે જોવા-સાંભળવાની તક મળી ત્યારે સત્ય લાધ્યું કે શોધવું, ખોજ કરવી તે આપણે માનીએ એટલી સરળ પ્રક્રિયા નથી. એનું સ્વરૂપ

માણકાનું નહીં પરંતુ માળાનું છે. એક પૂરી થઈ ન થઈ ત્યાં બીજી શરૂ થાય છે.

સરનામું હથમાં આવ્યું અને જે-તે વ્યક્તિની સભુભ પહોંચ્યા તેથી એમ ન માની લેવાય કે શોધ પૂરી થઈ; અધિનું કામ તો હવે કરવાનું હતું. વિશાળ ખુરશીમાં ન સમાતી સ્ત્રીમાંથી એમની દૂબળીપાતળી બીનકીને બેંચી કાઢવાની હતી. ફૂલીને દડો બની ગયેલા ચહેરામાં બીજા, ઉદાસ ચહેરાની રેખાઓ વાંચવાની હતી. રંગ કરેલા ટૂંકા, બરછટ વાળ નરી આંખે દેખાતા હતા, પરંતુ એ તો છલ છે એમ માનવાનું હતું. દાણિને કેળવવામાં આવે, કેમેરાને ચોક્કસ એંગલમાં ગોડવવામાં આવે, તો લહેરાતા રેશાભી કેશ દેખાશે એવી શ્રદ્ધા રાખવાની હતી.

એમની ધીરજ ફૂલી, ચર્ચામાં વસ્ત વકીલની નજર થોડી થોડી વારે એમની તરફ આવવા લાગ્યી. આવા બે-ત્રણ લસરકા પછી હોઠ પર સ્થિત ફરકી ગયું, વકીલ ટણાર થયા. ચર્ચાને જડપથી આટોપી લઈ મુલાકાતીઓને રવાના કર્યા. નવા અસીલનો વારો આવ્યો.

પોતાની સામેની ખુરશી બતાવતાં વકીલે કહ્યું, ‘બોલો સાહેબ, આપને કેમ આવવું પડ્યું ?’

‘મારું કામ સહેજ જુદા પ્રકારનું છે.’

પછી જે સંવાદ થયો તે બંને પાત્રોને શોભા આપે એવો હતો.

‘પ્રથમ એક સ્પષ્ટતા કરો, મેડમ.’

‘ઘેસ ?’

ડી. કે. તો રમૂજના બાદશાહ ગણાતા.

‘એ કહો કે આપ વકીલ છો કે ડોક્ટર ?’

એમની બરાબરી કરે એવી ગંભીરતાથી વકીલે સામો પ્રશ્ન પૂછ્યો, ‘આપને કોનું કામ છે – વકીલનું કે ડોક્ટરનું ?’

‘માંદો માણસ કોની પાસે જાય ?’

‘તો હું ડોક્ટર છું.’

‘મારે તો હાઈ સ્પેશયાલિસ્ટ જોઈએ; મામલો હૃદયનો છે.’

‘બહાર બોર્ડમાં મોટા અક્ષરે લખ્યું છે – કાર્ડિયોલોજિસ્ટ; તે ન વંચાયું ?’

\*

‘પુરુષની જાત !’

‘સાચી વાત છે.’

‘તમે ખોટું ન લગાડતા, પણ –’

‘આઈ કેન અન્ડરસ્ટેન્ડ, બીના.’

આ સંવાદ ઉપરના માળે, બેઠકડુમમાં થઈ રહ્યો હતો. આસિસ્ટન્ટને જરૂરી

સ્વુચ્છનાઓ આપી વકીલ મહેમાનને ચેમ્બરના પાછલા બારણોથી પોતાના નિવાસસ્થાનમાં લઈ ગયાં હતાં. જીભમાં હતી એવી જ ચપળતા દેહમાં હતી. હમણાં આવી – એવું કહેતાં બેડરૂમમાં ચાલ્યાં ગયાં હતાં અને પંદરેક મિનિટમાં ચહેરાને પાઉડરની પાછળ ઢાંકી, ભીના કેશ અને ગુલાબી કોંટન ડ્રેસમાં પ્રગત થયાં હતાં.

વકીલની ચેમ્બર અને ત્યાંથી બેઠકરૂમ – આજની આ સિદ્ધિથી ડી. કે.ને સંતોષ હતો. એમણે તો એમ માન્યુ હતું કે પ્રથમ મુલાકાત ઔપચારિક રહેશે, પરિયય તાજે કરવા પૂરતી. તે પછી કોર્ટનાં અને બંગલે ઘણણ આંદો મારવા પડશે. બધી અનિષ્ટિતતાઓ. જુદું પરી ગયેલું માણસ આટલાં વર્ષે મળે તેનો શો ભરોસો ? ઓળખવાનો ઠનકાર કરે. અપમાન કરીને કાઢી પણ મૂકે. તું કોણ અને હું હું કોણ ?

તેમ છતાં, સાવધાનીની જરૂર હતી. ઉતાવળ કરવી નહીં. વિધાનોને બને તેટલાં સ્થિતિસ્થાપક બનાવવાં. ભાષાને તરતી રાખવી. કોઈ બાબતમાં અભિપ્રાય આપવો નહીં અને આપવો જ પડે તો તેનો આકાર વાદળ જેવો રાખવો.

આ જાતિ મુજબ, પુરુષની જાત વિશેના બીનકીના ઉદ્ગારને એમણે સમર્થન આપ્યું, ‘આઈ કેન અન્ડરસ્ટેન્ડ, તું જે અનુભવોમાંથી પસાર થઈ હશે –’

‘અનુભવોનું તો પૂછશો જ નહીં. મારા જેટલા અનુભવો હું નથી માનતી કે દુનિયાની બીજી કોઈ સ્ત્રીને થયા હોય.’

‘અને છતાં, તું એ બધામાંથી બહાર આવી ને ?’

‘બહાર આવીને કોઈની દયાવી નહીં, મિસ્ટર; મારી પોતાની તાકાત પર. અંધારા ખૂણપામાં પરી હતી ત્યાં પેલો રાસ્કલ મળ્યો –’

‘કોણ રાસ્કલ ?’

‘મહાન જાહુગાર કશ્યપ. એના જેવો જાહુગાર ઇન્દ્રિયામાં બીજો નહીં હોય. તે વખતે મને દુનિયાદારીનું ભાન નહીં. એણે મને ખૂબ ફેરવી, બોંબે લઈ ગયો અને ત્યાં મને છોડીને ભાગી ગયો. બસ, બોંબેમાં મને નવી લાઈફ મળી. આઈ કમ્પ્યુલિટેડ માય એજ્યુકેશન, મેડ ન્યૂ એન્ડ ઇન્ટરેસ્ટિંગ ફેન્ડ્રૂ. આજે જુઓ : ટુ તે આયમ એ સક્સેસફૂલ લોયર. થલતેજમાં આપણો મોટો બંગલો તૈયાર થઈ ગયો છે. દશોરા પર મૂવ થવાનું છે. શરૂઆતમાં એક સિનિયર સાથે કામ કરતી હતી, પણ એ બાસ્ટદને કિક મારીને કાઢી મૂક્યો. આજે મારી પોતાની સ્વતંત્ર ધીકૃતી પ્રોજેક્ટ્સ છે.’

ધીકૃતી પ્રોજેક્ટ્સ – એ શબ્દોમાં ડી. કે.ને નાણાંનો અવિરત પ્રવાહ દેખાયો. નાણાંના યોગ્ય ઉપયોગ માટેની કેટલીક યોજનાઓ એમની પાસે હતી.

‘મને એક્સ્ટ્રોઇટ કરતો હતો, પણ શું થાય ? મારે એની ગરજ હતી. અમદાવાદ જેવા શહેરમાં આટલી કોમ્પ્યુટિશન વચ્ચે પ્રોજેક્ટ્સ જમાવવા માટે કોઈની હેલ્પ લીધા વગર છૂટકો નહોતો. સો આઈ યુઝુડ હિમ.’

‘એક વાત કહું, બીના ? મારો નમ અમિત્રાય –’

‘ફરમાવો. તમારા લોકો પણ બીજું હોય છે પણ શું, ઠાલા શબ્દો સિવાય ?’

ડી. કે. પેટ ભરીને હસ્યા, ‘મારવાં હોય એટલાં જૂતાં માર આ માથા પર, પણ તારા છિટેચ્છુ તરીકે હું તો સાચું લાગે તે કહીશ જ. અનુભવો ગમે તેટલા ખરાબ થાય, પણ આપણામાં નેગેટિવિટી આવવી જોઈએ નહીં.’

‘રબિશ !’

‘મારી આ વાત તને આજે નહીં તો કાલે સમજારો. આપણો, બીના, દિવસો જાય તેમ મનુષ્ય તરીકે વધારે સારા બનવાનું છે.’

‘બુલશિટ !’

‘તો પછી હું એમ કહીશા’, ડી. કે.એ. ઊરો શાસ લઈને છોડ્યો, ‘કે આ બોલે છે તે મારી બીનકી નથી, કોઈ બીજું છે.’

‘એકોકેકટલી ! તમે જેની વાત કરો છો એ બીનકી તો ગુજરી ગઈ. છાપામાં બેસણાની જાહેરાત નહોતી જોઈ ? આ બેઠી છે તમારી સામે તે બીનકી નહીં, બીના કશ્યપ છે. નવો અવતાર !’

‘એ રીતે જોઈએ તો તારું આ નવું સ્વરૂપ અદ્ભુત છે. આયમ ગ્રાઉંડ ઓફ ચુ !’

‘મારે કોઈની કોમ્પિલેન્ટ્સ નથી જોઈતી.’

‘બીનકી બીનકી ! તું જબરી થઈ ગઈ છે !’

‘કારણ કે મેં રિઆલિટી જોઈ છે અને રિઆલિટી, મારા સાહેબ, ખૂબ વિકૃત, ખૂબ અગલી છે. તમે ભલે વાતો સારી સારી કરો, પણ અંદરથી તો મારી સાથે સંમત હશો જ. આટલાં વર્ષોમાં તમને પણ ઓછા અનુભવો, નહીં થયા હોય.’

આ શબ્દોની ડી. કે. પર ભારે અસર પડી. એમનું મન, હૃદય, ચિત્ત બધું બીનકીને સાનુક્કૂળ બની ગયું. ચહેરા પર ઉદાસી આવી અને કંઠ ઘેરો બન્યો, ‘ત્યારાથી શું છાનું રાખવાનું હોય, બીનકી ? ખૂબ કુટાયો, ઘણણું કષ્ટ પડ્યું. દુનિયાના ખેલ જોયા. મને એ સમજાતું નથી કે આ દેશની પ્રજાને થયું છે શું ? જ્યાં જાઓ ત્યાં જુદાણું, સ્વાર્થ—’

‘તો પછી !’

‘આ વાતાવરણમાં, બીનકી, જે માણસ સાચું છે, અંદરથી ચ્યોર, જેને કપટ શું તેની ખબર નથી અને માની લે છે કે સામેવાળાં પોતાના જેવાં જ છે, સીધાં અને સરળ —’

વાક્ય પૂરું કરવાની જરૂર પડી નહીં. એક તાદ્યુત્ય સધાર્યું હતું જેમાં ઓરડાની હવા, એનો પ્રકાશ, સામસામે બેઠેલાં બે માણસો, એમના ચિત્તમાં ઊંઠતાં આંદોલનો – બધું ઓગળીને સમરસ બની ગયું હતું.

બીનકી ચપટી વગાડતી ઊભી થઈ ગઈ, ‘ધિસ કોલ્સ ફોર અ સેલિબ્રેશન !’

કબાટ ઉઘડ્યું, એમાંથી સ્કોરની બોટલ નીકળી. જવાસ આવ્યા. બરફ અને સોડા હાજર થયાં. ટ્વૂબ લાઈટ બંધ થઈ અને ઓરડામાં નાના બલબનો આણો ગુલાબી પ્રકાશ પથરાઈ ગયો.

નિર્વિપ ભાવે ડી. કે. આ જોઈ રહ્યા. પ્રથમ બેઠકમાં જ થઈ રહેલી આ પ્રગતિને એમણે મનોમન આવકારી.

\*

‘તમે બદલાઈ ગયા છો. તરત ઓળખાયા નહીં.’

‘વજન બાસઠ કિલો છેલ્લે તેં જોયો ત્યારે હતું; એમાં સો ગ્રામનો પણ ફેર પડ્યો નથી.’

‘તે હશે, પણ –’

‘જો ભઈ, કાળ તો એનું કામ કરે જ છે. કશું સ્થિર છે આ દુનિયામાં?’

ઝિલોસોઝી પર ડી.કે.ની પકડ મજબૂત હતી. આ પ્રકારનાં વિધાનો તેઓ સહજતાથી, કોઈ પણ નિમિત્તે કરી શકતા. તીન પત્તી કે રમીના ટેબલ પર પણ આવા ઉદ્ગારો નીકળતા. વળી, એ માટે એમને મોટા તાત્ત્વિક પ્રશ્નોની જરૂર પડતી નહીં. નાનકડી, સળી જેવી ખાંટી ઉપર પણ એ ભારેમાં ભારે જીવનદર્શનનો ડગલો લટકાવી શકતા. મુદ્રાઓ ચિંતકની હતી. મસ્તકને તજ્જની ટેકવીને બેસી રહે. અથવા, અંગળાંનાં ટેરવાં સામસામે ગોઠવે. મોટે ભાગે તો શબ્દોની પણ જરૂર પડતી નહીં. કિંદક શોધતા હોય એમ છતના કે આકાશના એક ખૂલ્લા તરફ તાકી રહે, આંખો ધૂધળી બને, પછી ઉદાસ હાસ્ય ફૂટે.

બસ, આટલાથી શ્રોતાઓને ઘણું મળી જતું.

બીનકી એમને તપાસી રહી હતી. એ બોલી, ‘બોડી આમ તો એવું જ છે બટ... આઈ ડોન્ટ નો... સમયિંગ ડિફરન્ટ લાગે છે.’

‘ચોખ્યું બોલ ન ! અગલી લાગું છું ? ડોસો બની ગયો છું ?’

‘અરે હોય ! તમે તો વધારે હેન્ડસમ લાગો છો, હીરો જેવા.’

પોતાના રૂપની પ્રશંસા થઈ રહી હતી, છતાં એ વિષય લંબાય તે ડી.કે.ને પરંદ નહોતું. હડસેલો મારીને એમણે ચર્ચાના વિષયને સામેની બાજુ મોકલ્યો, ‘તું જરાકે નથી બદલાઈ, બીનકી.’

‘મુશ્કરી છોડો. વિસ બોડી –’

‘બોડી ઈજ એક્સ્ટર્નલ; એનું મહત્ત્વ નથી. અંદરથી તું એની એ છે.’

‘આટલી વારમાં અંદર ડોકિયુ કરી લીધું ?’

‘તું તારી આંખોમાં દેખાય છે, સ્વરમાં સંભળાય છે અને શરીરની વાત કરતી હોય તો, શરીર થોડું ભરાયું છે એ સાચું, પણ તેથી મન તો તું પહેલાં કરતાં દસ

ગણી વધારે રૂપાળી લાગે છે. ઓનેસ્ટલી ! બાકી, અંદરની તારી ઘોરિયી, જે રીતે આજે મને પોતાનો માની સ્વીકાર્યો, આટલાં વર્ષ પછી –

‘મારું ઠેકાણું નહીં હો !’ આંખો સાથે આખી કાયાને શરારતી ડોલન આપતાં બીનકીએ કદ્યું, ‘હું તો કિક મારીને કાઢી પણ મુકું. ડેન્ટ ટેક મી ફોર ગ્રાન્ટેડ !’

જલાસ ખાલી થયા હતા. બીનકીએ ચપળતાથી બીજો મોટો, ડબલ પેગ બનાવ્યો, ‘બધું છોડો અને કંઈક તમારી વાત કરો. શું કરો છો આજકાલ ? તમે કોલેજમાં લેક્ચરર હતા એટલી મને ખબર છે –’

‘બોંબેમાં બેઠે બેઠે એ કેવી રીતે જાડી લીધું ?

‘ઇન્ટરેસ્ટ હોય તો જાણવાની હજાર રીતો છે.’

કોલેજમાંથી ડી. કે.ને કેટલાંક અશોભનીય કારણોસર ડિસમિસ કરવામાં આવ્યા હતા. તે પછી એમને હાલનું મુક્ત સ્વરૂપ પ્રાપ્ત થયું હતું.

એમના જીવનચરિત્રને પુસ્તક તરીકે વિચારવામાં આવે તો કહેવું જોઈએ કે તેનું સ્વરૂપ પ્રવાહી હતું. એમાં જડતા નહોતી. જે તે સમયની જરૂરિયાત અને સાંભળનારની કક્ષા પ્રમાણે એમાં ફેરફાર થયા કરતા. વળી, એ પુસ્તક પાકું, બાઈન્ડ કરેલું નહોતું, તેથી થોડાં પાનાં કાઢી શકતાં અથવા ઉમેરી શકતાં. મૌલિકતાનો આગ્રહ નહોતો. જરૂર જગ્યાય તો અન્ય મહાપુરુષોનાં જીવનચરિત્રોમાંથી આખેઆખાં પ્રકરણો ફાડીને એમના ગ્રંથમાં યોગ્ય જગ્યાએ સરકાવી દેવામાં આવતાં.

રિક્ષામાં બેસીને ભ્રમણ કર્યું તે દરમિયાન આજે ઉપયોગમાં લેવાની આવૃત્તિનો કાચો ઢાંચો તૈયાર થઈ ગયો હતો, પણ ખુરશીમાં બેઠેલી સ્ત્રીને જોઈ તે ક્ષણે જ એને રદ કરવો પડ્યો હતો. નક્કી કર્યું હતું કે પાનાં અને પ્રકરણો તો શું, એક વિરામચિહ્ન પણ આ શક્તિ સમક્ષ પ્રગટ કરવું નહીં.

આનું શું ઠેકાણું ? આ તો પૂર્ણવિરામને ઘૂંટીને એમાંથી ઉદ્ગાર કે પ્રશ્નાર્થ બનાવે. કાર્ટૂનો દોરે.

જલાસ હોઠે અડાડતાં એમણે કહ્યું, ‘તારી પ્રચંડ વેદના સામે મારા તણખલા જેવા દુઃખનું શું મહત્ત્વ, બીનકી ? અને, આવી વાતો કરવી હશે તો તે માટે આપણી પાસે આખી જિંદગી પડી છે.’

આ દલીલ વિસ્કીના મોટા ઘૂંટડા સાથે બીનકીના ગળે ઊતરી ગઈ. થોડી વાર એ નીચું જોઈને વિચારતી બેસી રહી. પછી બબડી, ‘થું આર વેરી ઓનેસ્ટ, દિનું.’

આ મુદ્રો અચાનક કયાંથી આવ્યો, પોતાના કયા શબ્દોમાં પ્રમાણિકતા પ્રગટ થઈ તે સમજવા માટે ડી.કે.એ મગજ કર્યું નહીં; પ્રમાણિકતા પાછળની પોતાની વૈચારિક ભૂમિકા સ્થાપ્ત કરતાં એમણે કહ્યું, ‘જીવનમાં કેટલાક સિદ્ધાન્તો સ્વીકાર્યો છે, બીનકી. શક્ય હોય ત્યાં સુધી એમાં બાંધછોડ કરતો નથી.’

‘મને તમારી ઈર્ઝા આવે છે, દિનું હું તમારા જેવી ઘોરિટી નથી જાળવી શકી. ડગલે ને પગલે મારે કોમ્બો કરવો પડ્યો છે.’

સત્યનો એક નાનો હપ્તો આ જગતાએ છૂટો કરવાનું ડી.કે.ને સલામત લાગ્યું, ‘એક વાત સમજી લે, બીનકી. શું તું કે શું હું, સો ટકા ઘોરિટી તો ક્યાંય રહી નથી. કોમ્બોમાઈસ મારે પણ ઓછાં નથી કરવાં પડ્યાં. ક્યારેક નિરાંતે વાત કરીશ ત્યારે કદાચ તારો મારા વિશેનો અભિપ્રાય –’

‘આવું કેમ હશે ?’

‘શું ?’

‘તમારા જેવા માણસને પણ –’

‘જીવન આપણને તોડી નાખે છે. કળિયુગમાં તમસની તાકાત વધી ગઈ છે.’  
બીનકીએ આંખો લૂંઠી.

‘બીજી, વધારે મહત્વની વાત : અશુદ્ધ આવે તે સાચું, પણ બીજા લોકો અને આપણામાં ફેર એટલો કે આપણામાં બગાડ દેખાય તે ઉપરઉપરનો. ડીપ ડાઉન, આપણા અસ્તિત્વનું કેન્દ્ર, જેને અંતઃ તત્ત્વ કહીએ, તે શુદ્ધ, કબીરજીની ચુનરિયા જેવું.’

‘વાહ !’

‘પાપ બે પ્રકારનાં કથાં છે – સિન્સ ઓફ ધ ફલેશ એન્ડ સિન્સ ઓફ ધ સોલ; શરીરનાં પાપ અને આત્માનાં પાપ.’

એક શાસે આખો ગ્રલસ ખાલી કરી નીચે મૂક્યો ત્યારે બીનકીની આંખો ફરી ગઈ હતી, ‘ઔર જરા સી દે દે !’

ડી. કે.ને ફાળ પડી; આ ગાંડી હવે કયો ખેલ નાખશો ? શું તે મીનાકુમારીનો અભિનય કરશો ? સ્વરચિત ગજલો મારે માથે ફટકારશો ?

એમણે કહ્યું, ‘તારી વેદના હું સમજું છું, બીનકી.’

‘ધુ હેવ એવરીથિંગ, દિનું ! અને હું સાવ ખાલી થઈ ગઈ છું.’

ચાર પેગ પેટમાં ગયા હતા છતાં આ સ્ત્રી કહી રહી હતી, હું ખાલી થઈ ગઈ છું ! ડી. કે. એની સાથે સંમત થઈ શક્યા નહીં. વિધાનને જુદા સંદર્ભમાં લઈ જઈ એમણે એનું ખંડન કર્યું, ‘તું તો ગમે તે કહે, બીનકી; આઈ ડોન્ટ એગ્રી વિથ ધુ. તું તો છલોછલ ભરેલી છે.’

ભાસ્ય કર્યું : ‘તારી પાસે બધું જ છે. પૈસો છે, સ્ટેટસ છે. એમને ગૌણ ગણીએ, પણ બ્યૂટી, બ્રેઇન ! અને એ બધાં કરતાં પણ વધારે, જીવનરસથી ભર્યુભર્યુ હદ્ય. આ દોલત બીજાં કેટલાં પાસે હોય છે ?’

‘બધું હોય છીંતાં માણસ ખાલીપો અનુભવે એવું ન બને ?’

‘હું સમજું છું, બીનકી, કારણ કે તારી વાર્તા એ મારી વાર્તા પણ છે, ફેર એટલો

કે તું ફરિયાદ કરે છે અને હું નથી કરતો.''

'મારી સ્ટોરી કહું, દિનુ ? સાંભળવી છે ?'

ડિ.કે. પાસે આર્પદણી હતી; સાંભળ્યા પહેલાં એ તો બધું પામી જ ગયા હતા. આટલાં વર્ષના અજ્ઞાતવાસ દરમિયાન શું શું નહીં બન્યું હોય ? બીના કશ્યપ તો વ્યક્તિ નહીં, સંસ્થા હતી. સંસ્થાને અનેક શાખાઓ-પ્રશાખાઓ હોય, પ્રવૃત્તિઓનું વૈવિધ્ય હોય. પ્રવૃત્તિઓનું એટલું પુરુષોનું પણ વૈવિધ્ય. જજસાહેબો, કોટ ટાઈવાળા સરકારી બાબુઓ, બાઈનાં ધોતીઝલ્લાવાળા સુકલકડી હોસાઓ -

સાંભળ્યા વગર છૂટકો નહોતો. નકી કર્યું કે સતર્ક રહેવું. ભૂલથી પણ આઘાતની, અણગમાની રેખાઓ ચહેરા પર આવવા દેવી નહીં.

કથાકારને સ્વગત આવાહન કર્યું - હે વિકૃત શાહજાહી, તારી અરેબિયન નાઈટ્રસની એક હજાર અને એક વર્તારીઓ કહે. આફુર શેતરંજી ઉપર ચડીને કોની કોની સાથે કેવી કેવી સફરો જેડી, કેવા કેવા જીનને બાટલામાં પૂર્યા, ચાલીસ નહીં ચાલીસ હજાર ચોરોને માત કરી સોનામહોરોનો બજાનો કેવી રીતે પ્રાપ્ત કર્યો -

મોદી હેડકી સાથે શહરજાહીએ પોતાની કથનીનો પ્રારંભ કર્યો, 'પુરુષની જાત !'

અહીં કંઈક અસાધારણ બન્યું : બે જ શબ્દો બોતીને બીનકી ચુપ થઈ ગઈ. ડિ.કે. ધીરજથી બેસી રહ્યા પરંતુ કથા આગળ ચાલી નહીં. ધીમે ધીમે સ્યાષ થયું કે પોતાની સમગ્ર કથાને બીનકીએ એક ઉદ્ગારમાં સમાવી દીધી હતી. બેઠકની શરૂઆતમાં બોલાયા હતા એ જ શબ્દો અંતમાં બોલાયા અને એક વર્તુળ પૂરું થયું.

પછી એ હીબકે ચડી.

ડિ.કે.ને પોતાની દયા આવી; કથા સાંભળવામાંથી બચ્યા તો બીજું, વધારે અધરું કર્તવ્ય આવી પડ્યું ! ખાલી જ્વાસ, આછો ગુલાબી પ્રકાશ, મધ્યરાતનો સમય અને સામે બેસીને આંસુ સારતી સ્ત્રી : અનેક ફિલ્મોના સાર જેવા એ દશ્યમાં પુરુષને માટે તટસ્થ રહેવાની છૂટ નહોતી.

અને અમુક ચોક્કસ પાઈ ભજવવાનો હતો.

ગીતાના સંદેશમાં ડિ.કે.એ થોડો સુધારો કર્યો હતો. ફળને દણ્ણિ સમક્ષ રાખી જરૂર પડે તે બધું કરવું, અંગત ગમા-અણગમાને વર્ચ્યે લાવવા નહીં. કશાનો છોછ રાખવો નહીં.

એમણે જ્વાસ હેઠે મૂક્યો, ધીમેથી ઊભા થયા અને બીનકીની પાસે જઈને બેઠા. એની આંખો વૂછી. વાળ સરખા કર્યા.

બાથમાં લીધી.

આમ, પુરુષ અને સ્ત્રીના જીવનમાં એક નવું પ્રકરણ શરૂ થયું.

\*

અગાઉનું પ્રકરણ, જેની તરફ બે પાત્રોની વાતચીતમાં અસ્યાષ ઈશારા થયા, તે આ પ્રમાણે હતું :

કેશવરામ પોતે બહુ ભણ્યા નહોતા, પરંતુ નવા જમાનામાં શિક્ષણનું મહત્વ સમજતા; કષ્ટ વેઠીને એમણે પુત્ર દિનકરને કોલેજ કરવા વડોદરા મોકલ્યો હતો. વડોદરા નિવાસની દિનકર પર બાધ કોઈ અસર ન પડી, વસ્ત્રો સાદાં જ રહ્યાં, પણ નાવીન્ય એની રીતભાતમાં અને ભાષામાં, ખાસ કરીને વિચારોમાં આવ્યું. વેકેશનમાં આવે ત્યારે પેટી ભરીને પુસ્તકો લેતો આવે. આખો દિવસ મેરી પર ભરાઈને વાંચ્યા કરે અને સાંજ પડ્યે નઢી તરફ ચાલવા જાય. ગામના યુવાનોને એનું આકર્ષણ રહેતું. દિનકરનું વ્યક્તિત્વ પહેલેથી ધીરગંભીર, એમાંથી વડોદરા જઈને થોડો અતડો અને રુક્ષ બની ગયો હતો. તેથી શેરીની છોકરીઓ એનાથી બીતી; એકલી જવાની હિંમત ન હોય, તેથી ત્રણ-ચાર બેગી થઈને જતી.

છોકરીઓમાં બીના સૌથી વધારે ભીડુ હતી. બહેનપણીઓની સાથે જાય ખરી, પણ દાદર પર સંતાઈને ઊભી રહે અને વાતો સાંભળ્યા કરે. અલબત્ત, કોલેજિયન પાસેથી છોકરીઓને સ્ટિટકાર જ મળતો. કયાં સુધી આમ ગભરતી-શરમાતી રહેશો? દુનિયા કયાંની કયાં ગઈ છે તેનું ભાન છે? અને પેતી ત્યાં લપાય છે તે કોણ છે – હંસાકાડીની બીના?

બહેનપણીઓ ડસ્ટીને લાવે ત્યારે એ રડું રડું થઈ જતી.

દિનકરની વાતોમાં ઘણું વૈવિધ્ય હતું, શ્રી અરવિંદ રમણ મહર્ષ યોલ્સ્ટોય રસ્કિન, પરંતુ છોકરીઓને અમુક વિષયોમાં વધારે રસો હતો. હિંમત કરીને પૂછતી, ‘તે હું દિનુભાઈ, બરોડામાં તમે તો રોજ પિકચરો જોતા હશે. રાજકૂર, દેવાનંદ –’

એમને સાંભળવી હોય રોમાન્સની રંગીન વાતો, પરંતુ નિષ્ઠુર ગુરુજી તો ફ્રિન્ઝોમાંથી શેત ઉપદેશ તારવીને આપતા : રાજકૂરની ફ્રિન્ઝોનો મેસેજ એનો આદર્શવાદ, તરફોડાયેલા વર્ગો પ્રત્યેની હમદર્દી, ફીરીનું ગૌરવ.

દિવાળીના એક વેકેશનમાં એક નાનો બનાવ બન્યો. માવહું થયું હતું તેથી ટાઢ ખૂબ હતી. શેરી વચ્ચે તાપણું કરવામાં આવ્યું અને કોઈએ દિનકરને ટહુકો કરીને બોલાવ્યો, ‘એ.. મેડિએથી હેઠા ઊતરો, ભાણેશરી.’

તે રાત્રે તાપણામાંથી અન્યોને જે મળ્યું તે, દિનકરને એક નવો ઉજાસ મળ્યો. નૃત્ય કરતા ભડકાના ઉગ્ર તેજમાં એણે એક અલૌકિક સ્ત્રીને જોઈ. બધાંથી જુદી, બધાંથી ઊંચી. તાપમાં તપીને લાલ બની ગયેલો ચહેરો. પાછળ અનંત સુધી અંધકાર અને એના મસ્તકની આજુભાજુ ઊડતા તણખા, મસ્તકમાંથી પ્રગટ થતા હોય તેવા. ક્યારેય નહીં કલ્પેલું એવું સનાતન સ્વીતવનું દર્શન દિનકરને થયું. બીનાનું તે મૂળભૂત સ્વરૂપ; ઢંકાઈ રહેલું તે પળમાં પ્રગટ થયું.

બીજાને પણ અભિન પાસેથી કંઈક નવું મળ્યું હશે. એની હિમત વધી. બે કુટુમ્બો વચ્ચે ઘરોબો હતો, તેથી માની રજા લઈને એ દિનકર પાસે અંગેજ શીખવા જવા લાગી.

આમ, કેશવરામની મેડી પર અંગેજના વર્ગો શરૂ થયા, પણ એમનું સ્વરૂપ થોડું અપ્રણાલીગત હતું. શિક્ષક બે-પાંચ વાક્યો બોલાવે અથવા લખાવે, વર્ધનું પાસ્ટ પાર્ટિસિપલ કરાવે, પછી એના અનુસંધાનમાં ધરપત આપે, ‘જો બીનકી, તારે કશાની બીક રાખવી નહીં.’

છોકરીને હવે દિનુંની બીક રહી નહોતી; ક્ષોભ અને ઉતેજન સાથે બીક જેવું જે હતું તે તો કશાક અજ્ઞાત કારણે.

ધ બોય વરશિપ ધ ગર્વ. ધ ગર્વ વોઝ અને ઓન્જલ : ટ્રાન્સલેશન કરવાનું આપી છોકરીની આંખો અને કેશ સામે જોતાં એ કહેતો, ‘તને, બીનકી, ઈંધરે બધું જ આઘ્યું છે.’

વર્ગના અંતે બંને સંતોષ થતો : એક ને અંગેજ ભણવ્યાનો અને બીજાને અંગેજ શીખ્યાનો.

દિનુંનો ફરવા જવાનો સમય લંબાયો; વહેલો નીકળી પડે અને ખૂબ રખડીને મોડો ઘેર આવે. નિદ્રા અને કૃધા તો ગાયબ થઈ જ ગયાં હતાં. પોતે કોઈ આધ્યાત્મિક સ્થિર્દિની સાવ લગોલગ પહોંચ્યો હોય, એક પાતળું આવરણ ખસ્યું અને સાક્ષાત્ દર્શનિ ! – એવી અવસ્થા હતી. ફૂલ્સકેપ કાગળો ભરીને લખતો અને ફાડતો. આજ સુધી જીવન અને સાહિત્યનો અભ્યાસ કર્યો હતો; હવે પરીક્ષા આપવાની ઘડી આવી હતી. ખૂબ મહેનતને અંતે સુરેખ પત્ર તૈયાર થયો. એની ભાષા ગુજરાતી હતી, પરંતુ અંગેજના ગૃહકાર્ય તરીકે શિખ્યાને આપવાનો ખ્યાલ હતો.

બીજા દિવસના શિક્ષણકાર્ય દરમિયાન નખ ખૂબ ચચાયા, પણ અઢાર પાનાંની થોકડી જિસ્સામાંથી ન નીકળી તે ન જ નીકળી; સાંજે ફરવા ગયો ત્યારે એની જીણીજીણી કરચો કરી હવાને પદ્ધરાવી.

સામે પક્ષે બીનકી પણ એનું કામ નિષ્ઠાપૂર્વક કરી રહી હતી. ગૃહકાર્યમાં આવું આવું લખતી ! ‘રિસ્પેક્ટેડ સર’ – એમ શરૂ કરે પણ એ સંબોધન એને ઠીક લાગે નહીં. અંગેજ છોડીને એક વાર રાજ્યોભાષાનો આશરો લીધો, ‘આર્યપુત્ર ! મેરી નૈયા કે –’

ખૂબ રડી.

દિનુંએ જોયું કે શિખ્યાનું ધ્યાન ભણવામાં નહોતું. નીચું જોઈને આંખો લુલ્હા કરતી.

એક વાર પૂછ્યું, ‘શું થયું ? કેમ રડે છે ?’

બોલી નહીં, રડ્યે ગઈ. એને કંઈ ભાષામાં સાંત્વન આપવું તે યુવાન શિક્ષકને

સૂર્યાં નહીં.

સ્વસ્થ થતાં બીનકીએ કહ્યું, ‘આજી રાત માથું દૂખતું હતું. તોથ નથી આવી.’

આ ફરિયાદ માટે શિક્ષક પાસે બે વૈકલ્પિક ઉપચાર હતા. માથું ખોળામાં લઈને દાબી હેઠું, અથવા –

ઓણો બીજો ઉપચાર સૂર્યબ્યો : સૂંઠ અને મરીનો ઉકાળો, એમાં મૂઢો ભરી તુલસીનાં પાન, સવાર-સાંજ એમ દિવસમાં બે વાર પીવો.

લાલ આંખો, વિખરાયેલા કેશા - કન્યા જવા માટે ત૊ભી થઈ ત્યારે દિનુએ એક બંધ પરબીડિયું એની સામે ધર્યું. લખ્યું છે, તારે માટે. વાંચજે નિરાંતે. કોઈને બતાવતી નહીં.

ઘેર જઈ, મેડીએ ચરી, ચોપડીની વચ્ચે સંતારીને બીનકીએ વાંચ્યું. છંદ શિખરિણી હતો. વિચારો ઉન્નત હતા. અનેક સાહિત્યિક ગુણો ધરાવતા એ કાવ્યમાં બાળને ઉદ્ઘર્બગામી બનવાનો ઉપદેશ આપવામાં આવ્યો હતો.

એ પત્ર પહેલો અને છેલ્લો. જે કંઈ ઉર્મિઓ અને લાગણીઓ હશે એમને એટલી અભિવ્યક્તિ મળી.

તે પછીના વેકેશનમાં દિનું ઘેર આવ્યો ત્યારે તો બીનકી પરણીને ખૂબ દૂર ચાલી ગઈ હતી. જીવનમાં રહી નહોતી. એ વગડામાં ભટક્યે ગયો અને ઘાસમાં, નરીના પાણીમાં, વાદળોમાં એક ચહેરાની રેખાઓ શોધવા મથતો રહ્યો.



## સારા દિ' | રામ મોરી

ગીતાવહુએ ચાની તપેલીમાં કંંકરા નાયા અને પણી અંદર હાથ નાખી કંંકરા ઘસી તળિયું સાફ કરવા લાગી. કંંકરા તીનની તપેલીનાં તળિયે ઘસાઈને વિચિત્ર અવાજ કરતા હતા. તુપસેલા પેટના લીધે ઉભડક બેસવામાં થોડી તકલીફ પડતી હતી તે વારે વારે એ પગ બદલાવ્યા કરતી હતી પણ એનું પેટ બે પગ વચ્ચે થઈને વધુ પડતું નભી ગયું હોય એવું અને લાગ્યા કરતું. ગીતાવહુને થાક લાગ્યો. મોઢા ઉપર આવી ગયેલી કોરી લટને વધારે જોશથી એણે પાછળ ધકેલી દીધી. અત્યારે જેઠાણી હરે મોટા ફળિયામાં ઈ ભાણા ધોતી હતી. ઓશરીમાં એની સાસુ અને વર જગદીશ બધાડાટી બોલાવતા હતા. ઈ લોકોના બાધવાના મોટા મોટા અવાજથી ગીતાવહુને સહેજ સહેજ રોવા જેવું થૈ જતું હતું પણ એની સામે અત્યારે નાનાં જેઠાણી બબડાટ કરતાં કરતાં થાળી વાટકા પછાડતાં હતાં. ગીતાવહુએ ફરી હળવેકથી ઓશરીમાં નજર કરી.

“તે એમાં રાંદું શેની પાડે છે તું, તળાજથી ટીવું લઈને આયવો છો ? હંદિયાને ઊભા ગળે મીહું દે એવડો થ્યો પણ સુધર્યો નથ. દિ-રાત મલકમાં ટણકવું ને ગળસવા

યાજે ખોટા તૃપ્તિયાની જેમ વેર પાછો. આ તારા મોટા ભાવું પાહેથી કંક તો શીખ્ય.... તાર બાપુ આ દિ' દેખાડવા હાટું મને મૂકીને ઉપર વિયા જ્વાતા ? બળતરા મારી મા ખોડિયાર ભવ આખાની મારે બળતરા....' એ માળની સાતેક ઓરડા ને લાંબી ઓશરીની સાગરીસમ ને લીમડાને ફારી બંધાયેલા મેડીવાળા એ ઘરમાં ખાટ્લે ગોમુખીમાં માળ ફેરવતાં ઉમરે ઓઝપાયેલાં માડી રાતના નવેક વાગે કકળાટ કરતાં હતાં. તેની સામે એનો ચોવીસક વર્ષનો પાંચમા નંબરનો દીકરો જગદીશ તીખા લેતો હતો. ગીતાવહુએ સરી જતા સાડલાને વધુ ખેંચીને વૃંધાંઠો લાંબો ખેંચ્યો. સાડીની ફૂલપાંદડીની આછી ટેમેરી ભાત વચ્ચેથી એણો જેઠાણીના જ્વાલ બહાર ઓશરીમાં જઘડતાં સાસુ ને વર તરફ જોઈ લીધું. એ સહેજ ત્રાંસી થવા ગઈ કે ભીનો પગ ચયપલમાંથી ખસી ગયો.... થોડું સંતુલન ગુમાવ્યું અને એ બેસી પડી. ઉપસેલા પેટને થોડો હડ્દોલો લાગ્યો. એ સાસુ ને વરની માથાકૂટથી અજાણ રહેવા માગતી હોય એમ ફટફટ ચાની તપેલીમાં રેતીના વધારે કંકરા નાખ્યા અને તળિયે ચોટેલી બળેલી ભૂકીને મેંશને ઘસી ઘસીને દૂર કરવા મથી પડી. એણો એક એક અછાતી નજર એની હારે વાસણ ધોતી નાની જેઠાણી તરફ કરી તો નાની જેઠાણીનું ધ્યાન ઓસરીમાં ચાલતા મા-દીકરાના જઘડામાં હતું. જેઠાણીએ નિસાસો નાખ્યો.

“હું દુવારક્યાવાળા, હું થાહે જગદીશભાઈનું ? લગન પણી તો સુધરી જાહે એમ લાગતુંતું પણ એમ કંઈ બળીનેય શીંધરી વળ શેની મેલે ?” ગીતાવહુએ દાંત તળે હોઈ દબાય્યો. પેટમાં થોડો થોડો દુઆવો થતો હતો. જેમ જેમ દિવસો થતા હતા એમ એમ જડપથી ચાલવામાં, ઉભડક બેસવામાં, કામ કરવામાં તકલીફ પડતી હતી. પાડોશી દેવુમાએ તો કીધેલું કે,

“ગીતાવોવ, આ યાણો ‘દોહદ’નો કેવાય, જે મન થાય ઈ ખાઈ લેવું, બાળેકની તાસીર હારી બને ને માને તપલીખય ઓછી પડે, બેયના ડિલ ભર્યા ભર્યા રે, નહિતર તો વેલ સુકાય એમ સુકાઈ જાહે બધું.” નવા જમાનાની ગીતાવહુ જમાનો જરવેલી દેવુમાડીને ખુલ્લા મોઢે સાંભળી રહેલી. ‘દોહદ’ એટલે જે ખાવાનું મન થાય ઈ ગર્ભવતી બાઈએ પેટ ભરીને ખાઈ લેવું એટલું ઈ યાણો ઈ સમજેલી.

“એય ગીતાવોવ.... આ લાડ ગવરનરને વાળું દઈ ધો, થાકીન આયવા છે. ગળસાવી ધો.” ડોશીનાં એક એક વેણ ઊના તવેથાના ડામ જેવા લાગતાં હતાં. એણો હાથ ધોયા અને ટેમેરી કલરની બંધણીથી હાથ લૂછતી લૂછતી જળનીને ઊભી થવા ગઈ કે જેઠાણીના ઘોડિયામાં સૂતાં લાલિયાએ જાગીને રોવાનું ચાલુ કર્યું. જેઠાણી વાસણ મૂકીને હડ્ફ દઈને ઊભી થઈ.

“ગીતા, મારે લાલિયાનું પેટ ભરાવવાનું છે. ભાણા તું જ ધોઈ નાખ્ય.” જેઠાણી સાડલાના છેડાને સરખો કરતી પાટલી બદલતાં બોલી.

“પણ ભાબી, તમાર દિયરને વાળુ....” ગીતાવહુએ ઓશરીમાં બારસાખે ઊભા ઊભા મોબાઈલમાં ગેઇટ રમતા જગદીશ તરફ જોયું.

“સહેજ મોડું થાય તો ઈને કાંઈ ખોટુંમોણું નહીં થઈ હાય, તમાર જેઠ તો અડધીરાતે છેક ધાન ભેણા થાય છે તોય કોઈ દાડો હરફ ઉચ્ચાર્યો છે એણે કે મેં ? ભાણ્યા મોટા તે નો જોયા હોય વળી વાળુવાળા....” જેઠાડી બબડતી એના ઓયડામ તરફ પોલકું ઢીલું કરતાં જતી રહી. ગીતાએ ફ્યાફ્ટ પાણી ભેગાં કરી નાખ્યા પછી ખાટલી એને કોરે ગોઠવી અને નેપકિનથી હાથ લૂણીને તરત રસોડામાંથી પાટલો ને દૂધનું બોઘડું ને બધું ઓશરીમાં ગોઠબું. જગદીશો મોબાઈલ સાઈડમાં મૂક્યો અને રીમોટ લઈ રી. વી. ચાલુ કર્યું ને મેંચના સ્કોર જોવા લાગ્યો. રસોડાના બારસાખને ટેકો દઈ ઘૂમટો તાણેલી ગીતા જગદીશને જમતો જોઈ રહી.

“આ ચા ઠરી ગઈ છે... ઊની કર્ય” જગદીશો કીટલીને અરીને કીટલીને પાછી ઠેલવી. ગીતાએ ચૂપચાપ કીટલી લીધી. એનું ધ્યાન ઓટલે મુકાયેલી જગદીશની થેલી તરફ ગયું. હળવેકથી ઉપાડી અને રસોડામાં લાટી. રસોડાના પીળા ગલોપના અજવાસમાં એ થેલી ફંઝોસતી રહી. એણે જોયેલું કે મોટા જેઠ તાલુકેથી રોજ રાત્રે પોલીસની નોકરી પૂરી કરીને આવતા ત્યારે જેઠાડીના સારા દિવસોમાં કંકને કંક થેલીમાં નાખીને લાવતા જ. અડધી રાતે આવેલા જેઠને અને એની થેલીને જોઈ મેરીએથી ગીતાવહુ કલ્પના કર્યા કરતી કે આજ શું હશે ? આશગરમ ? પાવભાજી ? ભેળ ? સમોસા ? પાતરા કે પેંડા ? વારતેવારે હટાણું કરવા ગયેલા બીજા બે જેઠ પણ આવું ને આવું મોડેથી લાવતાં અને ગીતા એ બધી કૂલેલી થેલી અને ફૂલેલા પેટના મરમને મમળાવતી જગદીશની થેલીને ફંઝોસતી રહી. લીલા ને લાલ દા, ત્રણ જાડા સ્ટંપ, એની માથે મૂકવાની ચકલ્યું ને તળિયે બેત્રાણ મેલાં ક્ષેત્રાં ચોટેલાં મોજાં. એની આંખે આંખું પાડી બાંઝી ગયું. ધાતીમાં અંદરથી જાણે કશુંક તપતું હતું, એકખારે બધું અંદર ધક્કે ચકલ્યું.

“એલી ચા ઉની કરવામાં કેટલી વાર ?” નવ્યાણુએ આઉટ થયેલાં ખેલાડીની દાડ જગદીશો વાટકો પછાડીને પૂરી કરી.

“મલક આખાને ઘેર દીકરા છે પણ કોઈના દિ’ ફર્યા નથ. આ કાળી રાતેય શીહું શેની પાડે છે ? ઘરમાં તારા ગળસવા સિવાયય બીજાં કામ હોય કે નહીં ?” ડોશીએ બબડાટ ચાલુ રાખ્યો, માળાને આંખે અડાડી અને ખીંટીએ ટીંગાડી પછી ઘોડિયાની દોરી હલાવી એણે હળવો હિંચકો શરૂ કર્યો.

“તો બીજાં કામ હોય તો આ કયાં એકલી વોવ છે ? નાનીમોટી પાંચ બાયું છે તેલામાં. તોય વાર લાગે ?” જગદીશ થોડો કુંગરાશો.

“એ નશીબદ્ધારના દીકરા પે’લા બે રૂપિયા કમાઈ ઘરમાં દેતો થા, પછી વહીવટ કર ઘર આખાનો. નાની બેય વોવ આખો દાડો કપાહ વીજાતી’તી દાડિયાની હારોહાર,

તે થાકીને વેંશ થઈને વાળુય લૂસલૂસ કરીને ખાટલા ભેગી થઈ રહ્યુંસ. ને બીજી નાની વોવ તો નયનવાયનો છોકરા જજ્યો છે તે આખો દિ' ઈ લાલિયાના ગૂમૂત્રરમાંથી ને એને પપલાવવામાંથી ઊંચી નથ આવતી ને સૌથી મોટીને તો કાંચ કેવાતું નથ, કેમ કે એનો ભાયડો તો પાછો પોલીસ બન્યો છે ને ઈને તો છાશવારે નોખા થાવાના ઓરતા ચડ્યા કરે છે. બાકી રહી તે આ તારી વોવ... બસ પાંચ પાંચ છે તોય મેરીને હખ નથી....” ગીતાવહુ ફટાફટ ઊની ચા દઈને રસોડામાં જતી રહી. જગદીશ મુંગા મોઢે ચા-દૃધ-રોટો અપટવા મંડ્યો. નવા જમાનાના ઊભા રસોડાના પ્લોટફોર્મ પર ટેકો દઈને ગીતાએ જાળિયામાંથી નવે બેઠેલી કાળી મીંડડી તરફ નજર કરી. પેટમાં કંઈ કેટલીય નહીં ઉકેલાયેલી ગુંચ ઊભરાતી હતી. ગાલ અંદરથી ખેંચાતા હતા; દૂંઠી હેઠે બંજવાળય બહુ જ આવતી હતી. અંદરથી તો જાણો એક કોરી આગ ભડક્યા કરતી હતી. એણે ફરી જગદીશની થેલી સામે જોયું ને પછી અભરાયે ગોઠવાયેલાં રવાના લોટ ભરેલા ડભા તરફ જોયું. એ વિચારવા લાગી શીરો કરીને ખાઈ લઈ કે ટોપરું ભભરાવીને સુખડી કરી નાખું? મોઢામાં બેય દાઢ પાછેથી પાણી ઊભરાવાં લાગ્યાં. જીબ ભીની થતી હતી ને એના નાકમાં સુખડી ને શીરાની સુવાસ ઊભરાતી હતી. અંદર પેટમાંય થોડી હલનચલન થતી હતી. દિ' આથમ્યાથી ગળ્યું ખાવાની તલપ વધતી ગઈ હતી. ઊપસેલા પેટ ઉપર હાથ મૂકીને એણે તવી ગેંસ પર ચડાવી ને ટોપરું ઉતાર્યું.

“એલા જગલા, કાલ્ય દેવલીમાં તમી બધા મેચુંવાળા શું બાખડ્યાતા?” ચોકડીમાં હાથપગ ધોતાં જેઠનો વજનદાર અવાજ આયવો એટલે ગીતાવહુ રસોડાની બહાર નીકળી અને કોરે મુકાયેલા જેઠના ખાલી ટિફિનને લઈ ફળિયામાં ધોવા ગઈ. જગદીશ મુંગા મોઢે ટી. વી.માં બેટિંગ જોતો હતો.

“હાહરા, ગઠા થા પણી તો કાંક સુધરો, ચોકીએ રિપોર્ટ લખાવવા આયવતા ઈ બધા, મારપીટનો કેસ દાખલ થયો છે. એમાં તારું નામય ઈ લોકોએ લખાયુંતું. ઈ તો ભલું પુશ કે મારા સંબંધો ન્યાં હારા છે તે મોટાસાહેલે તારું નામ કાઢી નાખ્યું. નકર જિંદગી આખી જત ભાયુના આબરૂની....” ડોશી ફર્ફરતા જીવે મોટાની વાતું સાંભળતાં રહ્યાં.

“એય જગા.... આ મોટ ભાઈ હું કે છ... જો જવાબ તો ભાડય...” જગદીશો પાણી પીધ્યું અને જવાબ દીધા વિનાં ધડ ધડ મેડીનાં પગથિયાં ચડી ગયો.

“દેલહાઘરીનાવને કાંક કયો તો ગોઠતું નથ લે.... ભાયું છવી કંઈ દુશ્મન થોડા છવી ? આ કાલ્ય હવારે છોકરા થાહે. બધી જગ્યાએ આવા તોર કરશો તો એનાં બૈરી છોકરાં હું સીજાનના દાને ટ્રોફિયું ખાહે ?” જેઠ બબડતાં બબડતાં મેડીએ એનાં ઓયડામાં જતા રહ્યા. ડોશી પણ ન સમજાય એવા નિસારા નાખતાં રહ્યાં.

ટિફિન ધોતી ગીતાની આંખ્યું દડકડ વરસી પડી. ગળ્યું ખાવાની તલપ મનથી

તો મરી ગઈ પણ પેટ કાંઈ સમજે ? અંદર આંતરડાં તો જાણે વળ ખાતાં હતાં ને ડિવની એકોએક રગ બેંચાતી હતી. પોતાનો રોવાનો અવાજ એણે સારીના છેડાથી દબાવી દીધો. ને વાસણ ગોઠવી ને રસોડામાં આવી ત્યાં કાળી મીંડડી જાળિયે ટેકડો દઈ ઉઘાડા નળિયેથી ભાગી ગઈ. જેઠાણી દેખે એ પહેલાં ગીતા ફિટા ફિટા ફિટા ટોપું બેગું કરવા લગી. એણે જલદી જલદી બધું સાફ કરી નાખ્યું. આખી તેલી ને મેરીના પીલા ગલોપ ઓલવાવા મંડગા. રસોડામાં એ એકલી ઊભી ઊભી અભરાઈને તાકતી હતી.

“ગીતાવોવ.... હજુ હું કરો છવો ન્યાં ? ને શેના આ ડબા ખૂલે છે ? જટ ખાટલા બેળા થાવ, કાલ્ય તમારે કપાહ વીણવા જાવાનું છે, એક દાઢિયો ઓછો છે.” કાથીના વાણના ટ... ટ... ટ... સાથે ડોશીનો પડખા બદલતો અવાજ આયવો કે ફિટ ગીતાએ રસોડાની લાઈટ બંધ કરી. સાંકળ દીધો. નાઈટલોઝના આછા લાલ અજવાસમાં ડોશીએ નેજવું કરી આખ્યું જીણી કરીને ગીતાવહુ તરફ નજર કરી. પાલવમાં કાંઈક ભર્યું હોય એવું ડોશીને લાગ્યું પણ એ શું છે એ વિચારે ને જુઓ એ પહેલાં તો ગીતાવહુ મેડી ચરી ગયાં. ગીતા રૂમમાં આવી, સ્ટોપર મારી. જાંબલી નાઈટલોઝના અજવાસમાં જગદીશ બરમૂડો પહેરીને ઘોરતો હતો. ગીતાએ કમરમાં ટાઈટ કરી ખોસેલી સાડી હળવી કરી, ઘાઘરીના કસ્કાસીને બાંધીલા નાડાની ગાંઠ સહેજ ઢીલી કરી અને શેરી માથે આડી પડી. પછી એણે જગદીશ સામે નજર કરી અને એ સૂઈ ગયો છે એવી ખાતરી કરી લીધા પણી હળવેકથી પલ્યુની ગાંઠ છોડી અને ગોદંડું ઓઢીને પાલવમાં બાંધી રાખીને લાવી હતી એ મોરસના દાણા ચંગળવા લાગી. ગળ્યો પ્રવાહ એના પેટમાં જતો હતો ને ખારો પ્રવાહ ઓશીકાની ખોઈમાં. એ મોરસ ચંગળતાં ચંગળતાં તો એણે આખી રાત ચંગળી નાખી. બહાર બારણો ભળભાંખરે જેઠાણીની થાપ પડી કે,

“ગીતા... જાગો, વાશીદું કરવાનું છે !” ત્યારે એ ઊભી થઈ. લાઈટ કરી અને ઓછાહમાથે પડેલા ને હેઠે પડેલા મોરસના એક એક દાઢાને વીણી લીધા ને સીધી પહોંચી ગઈ વાડામાં વાશીદું કરવા. ધોળા ડિની વહેલી સવારે આખી મેરીમાં છોકરાંઓની રોકકળ હોય, નોકરીના ને હીરાઘસુના ટિફિન ભરાય ને ફિટા ફિટા ગેસ પર ચા ઉપર ચા મુકાય ને ચોકડીમાં વાસણ ઊભરાતાં જાય. એ બધું પરવારી બેય જેઠાણી ને દાડિયાની હારે ગીતાવહુ પહોંચી ગઈ સીધી વાડીયે. ત્રણ ત્રણ હાથનો કપાસ. માણસ તો દેખાય જ નહીં. આખી સીમ તવડીથી રૂથી અને માણસથી. શેડે ઊભા ઊભા દાડિયાએ અને વહુઓએ બુશર્ટ ચડાવ્યા અને સલાખા લઈને રૂ વીણવાનું શરૂ કર્યું. કૂવાકંઠે ઊગેલી આંબલીની ડાળો કૂડીમાંથી થઈને કૂવા તરફ ઢેલી હતી. પાક્કલ આંબલીઓ ડાળોમાં લહેરાતી હતી. એના વજનથી આંબલીની ડાળો વધારે ઝોલાં ખાતી હતી. હજુ તો ખેતરની એક જ ઊથથ માંડ વળ્યા હુશે પણ ગીતાનો જીવ તો આંબલીની ડાળો પર ચોટેલો હતો. મોઢામાં પાણી અને ખટાશ ઊભરાતાં હતાં અને જીભમાં

તમતમાટ થતો હતો. એ હંફટી હતી અને આંબલીને જોઈ કપાસનાં પાન અને જીડવા ચોળી નાખતી હતી. બંને પગમાં ક્રીરીયું ચરી હોય એમ લાગતું હતું. ઘડી ઘડીમાં પેટનું વજન વધઘટ વધઘટ થયા કરતું હતું જાણે.

“ભાભી, હું જરા જઈ આવું...” હાથની ટયલી આંગળી બતાડતાં એણે જેઠાણીને કહ્યું ને જેઠાણીએ હક્કારમાં માથું હલાયું અને એ ગઈ ગોળી કાઢ્યે.

“આ હિવસોમાં તરસ ને એકી વધી જાય ને કાં ઘડી જાય... મનેય માર ઘુઘલો પેટમાં હતો ત્યારે આવું થાતું.” પાછળથી જેઠાણીનો અવાજ સંભળાયો ન સંભળાયો એ તો ક્યાંય સુધી દોડતી રહી. ખાસ્સી વાર થઈ એટલે જેઠાણીને ચિંતા થઈ.

“એ ગીતા.... ગીતા.... હોય.... એ ગીતા....”

“આ આયવા જોવોને...” દાડિયે આવેલી પંદરેક વર્ષની છોકરીએ ગીતાવહુને ફ્લાશ્ટ આવતાં જોઈ ને બોલી. પછી તો ગીતા આખા હિવસમાં છ-સાત વાર હળવી ભારે થઈ આવી. કપાસની ડાળો થોડી આઘીપાણી કરીને દાડિયે આવેલી એ પેલી છોકરીએ ગીતાવહુ તરફ નજર કરી. એ છોકરી અને ગીતાવહુની નજર એક થઈ. પેલી થોડુંક હસી, ગીતાને થોડી ફણ પડી. પેલી મરક મરક હસતાં બોલી,

“ગીતાભાભી, ડાબે પડજે તમાર બલાઉજમાંથી આંબલી દેખાય છે - હરખી સંતાડો.” ગીતાને એ ટાણે ભોં ભારે થઈ ગઈ. કંઈકેટલાય તમાચા જાણે ગાલ પર પડ્યા. એ નીચે બેસી ગઈ અને આંબલી ફેંકી દીધી, પછી મોઢા પર હાથ ઢઈ ધ્રુસકે ધ્રુસકે રડી પડી. જેઠાણીઓ તો કપાસ વીજાતાં વીજાતાં આગળ નીકળી ગઈ હતી. એણે ગીતાવહુનો રડતો અવાજ સાંભળ્યો એટલે બોલ્યા,

“ગીતા... પેટમાં બવ દુખતું હોય તો જા શેઢે જઈને જરીક આડી પડ્ય. દિ’ આથમવા જ આયવો છે, જા.” ગીતાવહુ તો જાણે આ જ સાંભળવા માંગતી હોય એમ એ શેઢે ભાગી. પાછળ જેઠાણીનો અવાજ આવતો હતો,

“જેણો ધણી કંંય નો કમાઈ ઈ બાઈને તો જેગા ધરમાં આવું જ હોય... વરની કોઈ કમાડી નહીં ત્યારે જ બાઈને આમ ડબલ મેનત કરવી પડ્યે ને... આ તો ઓલા જેવી વાત...” ગીતા ફૂંકીયે ગઈ અને ખોબે ખોબે પાણીની છાલક મોઢા પર મારવા લાગી. પછી થાળે બેસીને એ ક્યાંય સુધી હીબકાં ભરતી રહી.

દિ’ આથમ્યો ને બધા ધેર આયવા. મેડીના રસોડામાં રોટલા ટીપાતા હતા. છોકરાંઓ ફળિયામાં દોડાદોડી કરતાં હતાં. તોશી માળા ફેરવતાં હતાં ને છોકરાને ઘોડિયામાં હીંચકો નાખતાં હતાં. એક જેઠાણી ઉંબરે બેહીને એના લાલિયાને ધવરાવતી હતી. ચોકડીમાં બેસીને ગીતાવહુએ હાથપગ ધોયા. મોટી જેઠાણી દેવમંદિરમાં બેઠા બેઠા ધીમાં પલાળી રૂની વાટ બનાવતા હતા. ગીતાએ જોયું કે રસોડું ચાલુ છે, ભેંસો દોવાઈ ગઈ છે ને ચોકડી ખાલી છે. એને ઉપર એના રૂમમાં આરામ કરવા જવાનું મન થયું

પણ પગ ઉપડા નહીં ગોઈણથી બંને પગમાં થોડી થોડી તરોડ થતી હતી. આંખે થોડું ધેન પણ ચક્કાં હતું ને ગળું સુકાતું હતું. પાણિયારે જઈ લોટો ભરી પાણી પીધું પછી મોટી જેઠાણી જ્યાં હતાં ત્યાં દેવમંહિરમાં એ આવી અને હળવેથી બોલી,

“લાવો મોટાં ભાબી, હું વાટણું તૈયાર કરી નાખું.” મોટાં જેઠાણી હા કે ના કહે એ પહેલાં તો એનો નાનો છોકરો રોતો રોતો દેવમંહિરમાં આયવો.

“બા, મને કાકાના અરજણે માર્યું....” મોટાં ભાબી ધીનો વાટકો અને વાટણું એક બાજુ ખસેડીને ઊભાં થયાં. છોકરાનાં આંખું પાલવથી લૂધીને સીધા ફળિયામાં ગયાં. ને પોતાના જ છોકરાનું બાવંડું પદ્ધતાં ને ધમકાવતાં બોલ્યાં,

“તે તાર બાપે બંગારિયું ક્યાં પે'રી છે ? સામું આંટી ઢેતો હો તો. બધાના માર ખાવા થોડા આયાં રે'વી સવી ? આવવા દે તાર બાપને આજ પોલીસની નોકરી પૂરી કરીને. આજ તો તડ ને ફડ, આ લેગો રોટલો હવે તો મને આકરો પડે છે. બધી ખબર છે મને કે કોની કોની ચડામણી છે હું ? આંખ્યું આડા કાન બવ કર્યા પણ હવે નહીં.... બોકાં બર્યાં ન્યાં ભમરાળાઓએ ખાહડાં માર્યાં સે તે વળી....” એ રડતાં છોકરાનું બાવંડું ઝાલીને મેડીનો દાઢરો ચડી ગયા. ગીતાએ વાટય ધીમાં બોળી. ડોશીનો બબડાટ હજું પણ સંભળાતો હતો, મંહિરની આલર વાગતી હતી, ઓશરારીમાંથી ટી. વી.નો અવાજ સંભળાતો હતો, રસોડામાંથી રોટલાનાં ટ્યાકાનો અવાજ આવતો હતો. ગીતાએ ધી ભરેલા વાટકા સામે જોયું અને નસું ખેંચાતા માથા પર હાથ દબાવ્યો. ગળું બળતું હતું ને પેટમાં લોચના વધતી જતી હતી. આખા ડિલે જાણે આછી બળતરા. એઝે મન મક્કમ કર્યું. મંહિરમાં બેઠેલાં લાલજીની મૂર્તિ સામે નજર કરી. એ હસતી હતી. મંહિરની પાછળ મુકાયેલી બાંનીએ લટકતા અરસીમાં ગીતાને એનું મોહું દેખાતું હતું. રૂમમાં પીળો ગલોપ બળતો હતો. ઉંબરે ઊભેલી કાળી મીંદડી ધીના વાટકાને ટાંપીને બેઠી હોય એમ પૂંછડી પટપટાવતી આમ તેમ નજર કરી ગીતાના જતા રહેવાની રાહ જોતી હતી. ગીતાએ એક નજર ફળિયા તરફ કરી, લાલજીની મૂર્તિ તરફ કરી, પાછળ ઊભેલી હોઠ પર જીભ ફેરવતી મીંદડી તરફ કરી. અને સાડીનો છેડો વધારે ખેંચી માથું ઢાંકતાં એઝે ધીનો વાટકો ઊંચો કર્યો. એની અંદર કંઈકેટલીય આંબલીઓ હિલોળા લેતી હતી, હોપરું વેરાયું હતું ને મોરસના દાણા ચમકવા લાગ્યા. એ ધીને, લાલજીને, મીંદડીની જીભને અને અરીસામાં પોતાને જોતી રહી.

## દસ્તિકોણ અને અભિપ્રાય | નિર્ભિશ ઠાકર

મનુષ્યો બે પ્રકારના હોય છે : સામાન્ય અને વિશિષ્ટ. સામાન્ય મનુષ્ય પ્રમાણમાં સરળ અને સુખી હોય છે. આમ તો મને મનુષ્યમાં કાંઈ વિશિષ્ટ જેવું લાગતું નથી, એટલે બીજા પ્રકાર માટે ‘વિશિષ્ટ સાબિત થવા અહર્નિશ પ્રયત્નશીલ રહેતા મનુષ્ય’ એમ લખવું જોઈએ. ખરેખર તો એ પ્રકાર વિશિષ્ટતાની નજીક જતો છે, છતાં હું પ્રકાર-નામમાં લંબાણ ટાળવા ‘વિશિષ્ટ’ લખું, તો તમે એને વિશિષ્ટ ન ગણતા પ્લીઝ !

જો મનુષ્યનો બીજો પ્રકાર અસ્તિત્વમાં ન હોત, તો મનુષ્યજ્ઞત વધુ સુખી હોત, એ મારો સ્પષ્ટ અભિપ્રાય છે કારણ કે બીજાઓ કરતાં મારો દસ્તિકોણ અલગ છે ! (લેખકનો દસ્તિકોણ સામાન્ય હોય કાંઈ ?) બીજા પ્રકારના મનુષ્યોને વિશિષ્ટ સાબિત થવા અલગ પ્રકારના દસ્તિકોણ અને અભિપ્રાયો રાખવા પડે છે, સમજ્યા ? વિશિષ્ટ (?) મનુષ્યનો ‘અભિપ્રાય’ અંગેનો અભિપ્રાય પણ વિશિષ્ટ (વિશિષ્ટ !) અને આગવો (કોઈને ગળે ન ઉત્તરે તેવો....!) હોય છે. આ પ્રકારની મનોવૃત્તિ જો હું ખુદ ન ધરાવતો હોત, તો એને અવશ્ય ‘માનસિક રોગ’ જ કહેત, પણ હું જો સામાન્ય વિચારસરણી ધરાવતો હોઉં તો તમે આ લેખ વાંચો ખરા ?

સામાન્ય મનુષ્યો સાદા અને સંતોષી જીવ હોય છે, એટલે કશું સાબિત કરવામાં એ રસ નથી ધરાવતા. અભિપ્રાયો આપવાથીયે તેઓ બને ત્યાં સુધી દૂર રહે છે, એટલે ‘અલગ દસ્તિકોણ’ના તૂતને એ પાળતા નથી. જેમનાં પેટ ખાલી છે, એમને બિનજરી બોજ આવકારવા પોષાતા નથી. જેમનાં પેટ ભરેલાં છે, એમને જ અવનવાં તિકડમ્ય સૂઝે છે ! ભૂખ્યા પેટનો રોટલી પ્રત્યેનો અભિગમ સાદો - સમજાય એવો અને એકમાત્ર જ હોય. ભરેલા પેટને તાત્કાલિક રોટલીની જરૂર ન હોય, એટલે અવનવા અભિગમોની શક્યતા રહે. સાદા મનુષ્યને પેટ ભરવાની ચિંતા અને વિશિષ્ટ મનુષ્યને પચાવવાની ચિંતા, આમ ચિંતાના પ્રકારોથે અલગ જ રહે !

સામાન્ય માણસને એક કોરો કાગળ દેખાડી એ અંગે અભિપ્રાય માગો, તો પહેલાં તો.... એ બાપડો ભડકે. પછી બહુ આગાહ કરો, તો આવું કાંઈક કહે, ‘સાહેબ એ કોરું કાગળિયું છે, એથી વધારે અમને ગમ ના પડે ! એમાં ભજિયાં બંધાય તોયે કામનું, બાકી તો તમે કહો એ જ ઠીક !’

પણ જો કહેવાતા વિશિષ્ટ મનુષ્યને એ અંગે પૂછો તો જવાબ કદાચ આવો મળે, ‘આમાં બે વત્તા બે... બરાબર ચાર - જેવું નથી. અત્યંત જટિલ બાબત હોઈ, આમાં કોઈ ઉત્તાવળિયા અભિપ્રાયને અવકાશ નથી. એ ઊંડો વિચાર માગો છે, માટે દીર્ઘ ચિંતન

આવશ્યક છે. (ભરેલા પેટ પાસે સમય ઘણો હોય !) આમાં પ્રથમ પ્રશ્ન તો એ જન્મે છે કે એ કોરો કાગળ છે કોનો ? કોઈ કવિનો ? કોઈની પ્રિયતમાનો ? કોનો ? ચર્મચ્યુ વડે દેખાડો શૂન્યવકાશ (શૂન્યવકાશ દેખાય કે અનુભવાય, એ પાછો નવો પ્રશ્ન !) શું ખાલી જ હોય છે ? (અત્યા અમને શું પૂછું છે, અભિપ્રાય તો તારે આપવાનો છે !) ધારો કે એ કોરો કાગળ કોઈ કવિનો હોય, તો એની સાથે જોડાયેલી પ્રક્રિયા શું જટિલ નહીં હોય ? અરે કવિના ચિદાકશમાં આકાર લઈ ચૂકેલી કવિતા તો કવિ જ્યાં એ કાગળ પર દસ્તિ માંડે કે તરત બદલાયેલા માધ્યમમાં ધબકતી થઈ જાય છે. પછી કવિ માટે એ કાગળ ખાલી નથી હોતો, ક્યારેય નહીં ! પછી તમે પૂછશો કે કવિ કાગળ પર કવિતા શા માટે લખે છે ? (ઓ બાપલા, અમે આ બધું નથી પૂછતા ! તું જ અમારા વતી પૂછ્યે જાય છે, આનો ક્યાંય અંત ખરો ?) કવિ લખે છે માત્ર ભાવક માટે ! જેથી કાગળમાં રચાઈ ચૂકેલી કવિતા ભાવકને દેખાઈ શકે ! તમે એ પણ નોંધી લો કે... (તું અમને છોડ ભાઈ, એ કોરો કાગળ તને નોંધવા માટે જ આપ્યો છે !) કાગળ પર લખાયેલી બે પંક્તિની વર્ણે જે જગ્યા ખાલી દેખાતી હોય છે, એમાં અને ધારો કે એ કોરો કાગળ કોઈની પ્રિયતમાનો હોય, તો... (અરે નથી ધારવું યાર, ભોગ લાગ્યા અમારા કે તારો અભિપ્રાય માંગ્યો !)

સામાન્ય માણસ જો કોરા કાગળ વિશેનો ઉપરોક્ત અભિપ્રાય જાણે તો ચક્કર ખાઈ જાય કે કોરા કાગળમાં આટલું બધું હોય !! ને કશું ગળોય ન ઊતરે !

મોય ભાગનાં પશુપંખીઓ સામાન્ય માણસ જેવાં સાઢાં હોય છે, એટલે પ્રમાણમાં સુખી. પણ કૂતરાં વિશિષ્ટ વ્યક્તિ જેવાં હોય છે ! (વિશિષ્ટ વ્યક્તિઓ કૂતરાં જેવા હોય છે, એમ કહેવાનું મારું તાત્પર્ય નથી ! એમ કહેવું શોભનીય પણ નથી!) એ કારણે કૂતરાંઓને પોતાનો વિશિષ્ટ અભિપ્રાય વ્યક્ત કરવા ગણું ફાટી જાય, ત્યાં લગી ભસવું પડે. જોકે કૂતરાંના ઉપદ્રવથી ત્રારે એમને સાણસામાં લેવા ગાડી બોલાવી શકાય છે, એટલું સારું છે. કૂતરાના કાન ઊંચા થાય કે તરત એનો દસ્તિકોણ બદલાયો, એમ તમે માની શકો. કૂતરાં જ્યારે તીવ્ર અભિપ્રાય આપે છે, ત્યારે પ્રાપ્ત કરનારે ચૌદ ઇન્જેક્શન પણ લેવાં પડે છે. વિશિષ્ટ મનુષ્યોને એમની વિરુદ્ધ જતા અનેક અભિપ્રાયો મળવા લાગે છે, ત્યારે એ તીવ્ર પ્રતિક્રિયા આપતાં કહે છે, ‘કૂતરાં તો ભસ્યા કરે, મને કોઈ ફરક પડતો નથી !’ બાય ધ વે, ‘શાનત્વ’ને ‘મનુષ્યત્વ’ સાથે પુરતનકાળથી અનિવાર્ય સંબંધ રહ્યા છે. અતે કૂતરાંઓ વિશે લખવાનો ઉપક્રમ નથી જ, એ સ્પષ્ટ કરવું ઘટે.

સામાન્ય મનુષ્યોને તો આશ્ર્ય જ થાય કે અભિપ્રાય તો ઠીક, પણ આ ‘દસ્તિકોણ’ કઈ બલા છે ? થાય છે શું કે વિશિષ્ટ મનુષ્યોને કશું સીધું-સરળ માન્ય નથી હોતું. સરળ બાબતને એ ગુંચયીને કલાત્મક ન બનાવે, એવું કદ્દી બન્યું નથી. આમ તો કોઈ

ગેરસમજ ન થાય અને આ વિશ્વના વ્યવહારો સરળપણે ચાલે, એ માટે દરેક બાબતનો એક જ સ્પષ્ટ અર્થ થાય, એ હિતાવહ છે. પણ કવિ સમા કોઈ વિશિષ્ટ મનુષ્ય સાથે તમે કોઈ કવિતાની ચર્ચા કરશો, તો એ તરત જ થઈ રહેલી ગેરસમજને દૂર કરવા (અને નવી ગેરસમજ ઉભી કરવા !) એ થોડાક બેંચાઈને કહેશે, ‘એવું નથી, એવું નથી મિત્ર ! ગેરસમજ થઈ રહી છે કારણ કે તમે કવિતાના શબ્દાર્થને પકડ્યો છે !’ શબ્દ વડે રચાયેલી કવિતાનો ‘શબ્દાર્થ’ પકડવાનોએ તમને હક નહીં. ‘દસ્તિકોણ’ એ એક એવું કાલ્યનિક (બાબડજંતર સમું) ફુલક છે, જેના પર લઈ જઈ તમે ‘ગેરસમજ’ની આડ લઈ સામાવણાને ખોટો સાબિત કરી શકો છો ! સરળ શબ્દોમાં કહું તો સામાવણાને માનસિક રીતે ખાડામાં ઉતારવો હોય, તો તમારી પાસે ‘આગવો દસ્તિકોણ’ છે – એવું સતત એને લાગવા હો ! (શારીરિક રીતે સામાવણાને ખાડામાં ઉતારવા કોઈ દસ્તિકોણ-દસ્તિકોણની આવશ્યકતા હોતી નથી. એ માટે સીધો ઘક્કો જ મારી દેવો પર્યાપ્ત હોય છે !)

હા... તો કવિમહાશયની વાત હવે સમજાય એ રીતે પૂરી કરીએ ! પછી એ દસ્તિકોણનું મહત્વ વાદ કરાવતાં કહેશે, ‘કવિતાને જરા અલગ રીતે જોવાની હોય છે, કારણ કે એ કવિતા છે, જોડકણું નથી ! જોડકણામાં શબ્દાર્થ જ અભિપ્રેત હોય છે, પણ કવિતા એ અલગ સ્વરૂપ છે. સૂક્ષ્મતા ભાડી, પ્રતીકાત્મકતા ભાડી, ગૂઢતા ભાડી, ચમલ્યતિ ભાડી.... ભાવકને બેંચી જતું એક વિશિષ્ટ સ્વરૂપ ! (હુકાનમાં ગ્રાહકોને અને કવિતામાં ભાવકોને બેંચવા પડે, એમ ???) અહીં એક એક શબ્દને પોતાનો ‘વ્યંગ્યાર્થ’ હોય છે અને એટલે જ કવિતા ભાવકે ભાવકે જુદો અર્થ આપે છે ! (આ તો સારું છે કે સામાન્ય વ્યવહારોમાં ટેબલ ‘ખુરશી’નો કે ખુરશી ‘મરદી’નો અર્થ નથી આપતાં, નહીં તો દુનિયા ચાલે કઈ રીતે ?) કવિતા જો શબ્દાર્થ પ્રગટ કરવા લાગે તો ‘કાબ્યત્વ’ ગુમાવી સાંચ વિધાનો (સિસ્પ્રલ સ્ટેટમેન્ટ !)નો જથ્થો બની જાય. મારો દસ્તિકોણ સમજાયો તમને ? આ હિસાબે કવિઓ ‘શબ્દકોશ’ એ માટે જ રાખતા હશે કે ભૂલથી કોઈ શબ્દ એના મૂળ અર્થમાં ન વપરાઈ જાય ! પ્રિય વાચકમિત્ર, હવે ‘દસ્તિકોણ’ એ કોઈ કલાત્મક-બાબડજંતર હોય એવું અનુભવાય છે ? જો હજ એવું ન અનુભવાતું હોય તો કોઈ મૂર્ધન્ય કવિને મળો ! મને તો એટલું જ હાલ સમજાય છે કે ‘દસ્તિકોણ’ એટલે ખામીયુક્ત દસ્તિનો કોણ અથવા દસ્તિનો ખામીયુક્ત કોણ ! એટલે તો તમે ત્રિકોણ, ચતુર્ભોજ કે પંચકોણને સમજી શકશો, પણ ‘દસ્તિકોણ’ને સાચા અર્થમાં ક્યારેય સમજી નહીં શકો ! એટલિસ્ટ, મારું તો ગજું નથી કે આ બાબતને હું પૂરેપૂરી સમજાવી શકું ! (આ અંગે તમે કોઈ સ્પષ્ટ અભિપ્રાય પર આવી શકો, તો મને અવશ્ય લખી મોકલશો.)

અભિપ્રાય જ્યારે માંગવામાં આવે, ત્યારે જ આપો, તો એનું મહત્વ છે ખરું. રસોઈમાં ઉદારતાથી મીઠું ઠપકારવા ટેવાયેલી પણી જ્યારે પતિને પ્રેમથી પૂછે કે : ...

કહું છું સંભળો છો, આજે દાળ કેવી બની છે ?” ત્યારે બે પ્રકારના અભિપ્રાય અપાવા શક્ય બને છે. જો પતિ માનતો હોય કે ગૃહશાંતિ કરતાં દાળ વધુ અગત્યની છે, તો કહી શકે કે દાળમાં મીઠું વધુ પડયું છે. જો એ એમ માનતો હોય કે દાળ કરતાં ગૃહશાંતિ જ વધુ અગત્યની છે, તો એણે એવો અભિપ્રાય આપવો જોઈએ કે રસોઈમાં મીડાના પ્રમાણમાં દાળ જરાક ઓછી પરી લાગે છે, બાકી રસોઈ તો તારી જ હોય ! રસોઈમાં ખટાશ હોવા છતાં સંબંધોમાં મધુરતા આવી શકે અને રસોઈમાં મધુરતા હોવા છતાં સંબંધોમાં ખટાશ આવી શકે. અભિપ્રાયનો સદ્ગુપ્યોગ થાય છે કે દુરુપ્યોગ, એના પર બધો આધાર છે.

વિશિષ્ટ વ્યક્તિઓ વણમાર્ગયા અભિપ્રાયો આપી, પોતાની વિશેષતા સિદ્ધ કરવા તલપપાડ બને છે. પછી એની પાછળ પોતાનો કયો દસ્તિકોણ રહ્યો છે, તે પણ અસ્પ કરી... એકદરે બધું અસ્પણ કરી મેદે છે ! એમના કોઈ પણ અભિપ્રાયના આરંભે ‘ના, એ માન્યતા સંદર્ભે ખોટી છે. મારી દસ્તિ જોઈએ તો....’ એવું અવશ્ય આવે છે. બે વિશિષ્ટ વ્યક્તિઓના એક જ બાબત પરના અભિપ્રાયો સામસામા છેડાના જ હોય છે, એટલે અભિપ્રાય માગનારની દશા સૂરી વચ્ચે સોપારી જેવી થતી હોય છે. સમતોલન ગુમાવી બેસનાર વિમાનમાં જો બે વિશેષજ્ઞ બેઠા હોય તો એ બચી શકતું નથી. ઘણી વાર તો વિમાન સાથે પોતે નાચ થઈ જાય, એ પહેલાં તેઓ કોઈ અંતિમ નિર્ણય પર આવી શકતા નથી. એકનો દસ્તિકોણ વિમાન પૃથ્વીથી કેટલે ઉંચે ઉડે છે એના પર આધારિત હોય છે, જ્યારે બીજો કહેશે વિમાનની બહારના હવાના દબાજાને જાણ્યા વિના કોઈ અભિપ્રાય આપવાની ઉત્તાવળ કરવી ઈષ નથી. કોઈ ઉત્તાવળિયો પાયલટ પોતાના મર્યાદિત જ્ઞાન કે અજ્ઞાન વડે વિમાનને બચાવી લે, તો વાત અલગ. બાકી વિશેષજ્ઞોના અભિપ્રાય, મેં અગાઉ કદ્યું તેમ, વિમાનને બચાવી શકતા નથી. આવા વિશેષજ્ઞોથી ગળે આવી જઈ કોઈએ કહેવત પણ બનાવી છે કે લે બૂધું ને કર સીધું !

ઘણી વાર વિશિષ્ટ માનવો અને ધર્મગ્રંથો દ્વારા અભિપ્રાય રૂપે પ્રશ્ન પુષ્ટાતા હોય છે. સામાન્ય માણસને તો એ જોઈ અહોભાવ થઈ આવે કે આ પ્રશ્ન વડે મારો અભિપ્રાય મળાઈ રહ્યો છે ! હકીકતમાં તો એ પ્રશ્નમાં જ અભિપ્રાય સમાયેલો હોય છે, એનાં થોડાંક ઉદાહરણો જુઓ....

- સ્વીમાં તમે કદ્દી સુંદરતા અને વજાદારીને એક સાથે જોઈ ?
- તરબૂચ પર છરી પડે કે છરી પર તરબૂચ પડે, તો કપાવાનું કોણે ?
- જબ રાત હૈ એસી મતવાલી, તો સુબહ કા આલમ ક્યા હોગા ?
- હર શાખ પે ઉલ્લુ બૈઠે હૈને, અજામે-ગુલિસાં ક્યા હોગા ?
- આ દુનિયામાં તમે શું સાથે લઈને આવેલા અને શું સાથે લઈ જવાના ?
- વહોટ ઈજ ધેર ઈન અ નેઈમ ? (નામમાં શું છે ?)

બિલકુલ આ જ પ્રકારના મુડમાં મેં પણ મારા એક ઈન્ટરવ્યૂમાં એક મહાન પ્રેરક અભિપ્રાય આપેલો કે કોઈ તમને પ્રેર્યા કરે અને તમે પ્રેરયા કરો, એટલા મૂર્ખ બનવું તમને શાવશે ?

આમ તો એવું મનાતું આવ્યું છે કે દસ્તિકોણને કારણે જ કોઈ ચોક્કસ પ્રકારનો (અલગ !) અભિપ્રાય જન્મ લેતો હોય છે, પણ મને આ બાબતે પહેલેથી જ ભારે શંકા રહેલી છે. હું જન્મ્યો ત્યારથી આજ લગ્ની મને બે બાબતો ક્યારેય સમજાઈ નથી. એક તો હું પોતે અને બીજી બાબત તે દસ્તિકોણ ! હકીકતાં તો વિશિષ્ટ માનવોના અભિપ્રાયનો અભ્યાસ કરી નકરી કરાય છે કે એમનો દસ્તિકોણ કયા પ્રકારનો હતો ! દસ્તિકોણની ચિંતા નથી રાખી, એટલે જ હું આ લેખ લખી શક્યો છું. આ લેખ વાંચી જો તમે કોઈ ચોક્કસ અભિપ્રાય પર આવી શકો તો એ પરથી શોધજો કે મારો દસ્તિકોણ કયા પ્રકારનો હતો ! જો ખરેખર તમે મારા દસ્તિકોણ સુધી પહોંચો, તો મને અવશ્ય જણાવજો. મારે એ બાબતને સમજવી છે.



## પ્રથમ ગ્રાસો શર્કરા | અરુણા જાડેજા

કોઝી મેટ્રસનાં આયોજક અરુણાબહેન મહેતાએ આ પહેલાં આ કાર્યક્રમ માટે મને આમંત્રણ આપેલું, પણ ચોક્કસ કારણસર મેં એ આમંત્રણ નકારેલું અને હેવે જ્યારે એ સ્વીકાર્યું ત્યારે જુઓને કેનું થઈ રહ્યું ! પ્રથમ ગ્રાસો...!

તા. ૮-૩-૧૫નો આ કાર્યક્રમ પહેલી વાર સ્વાઈન ફિલ્યુના લીધે મુલતવી રખાયો, તા. ૨૮-૩-૧૫નો બીજી વાર ફાઈનલ કિકેટ મેચના લીધે, તા. ૫-૪-૧૫નો ત્રીજી વાર નિયત કવિ-સંમેલનના લીધે અને પછી તા. ૧૨-૪-૧૫ના રોજ આ ચોથો કાર્યક્રમ યોજાયો. થયું કે હેવે બધું સમેસૂતરે પાર પડશે પણ સાંજના ચાર વાગતા તો આ કાર્યક્રમ પાંચમી વાર પણ આગળ લંબાશે કે શું એવી ધાર્સ્તી પેઠી !

ગુજરાતી સાહિત્ય પરિષદમાં યોજાયેલા આ કાર્યક્રમનો સમય હતો સાંજના ૫.૩૦ વાગ્યાનો. હું અને કાર્યક્રમના આયોજક અરુણાબહેન મહેતા પોણા પાંચે તાંયાં પહોંચવાનાં હતાં તેથી હું અને સુરતથી આવેલાં મારાં ભાઈબાબી ઘરેથી સાંજના ૪.૧૫ વાગે નીકળ્યાં તો ખરાં, પણ ઘરેથી નીકળતાં જ આકાશ ગુસ્સે ભરાઈને એકદમ અમારી સામે એટલે આખા અમદાવાદ સામે ઘસી આવ્યું, એ ઘેરાયેલાં કાળાં વાદળાંમાં હું પેલી અંગ્રેજીવાળી સિલ્વર લાઇન શોધવા લાગી. પણ આંખ કામ ન કરે એવાં એ અંધારાં વાદળાં. અમારી ગાડી આગળ વધતી હતી અને હું ‘આ બૈલ માર મુરેની જેમ આગળ વધતી ગઈ. બહારથી તો ‘મુને અંધારાં બોલાવે’ એવું વાતાવરણ, પણ મનમાં તો એવી આશ કે ‘મુને અજવાળાં (પેલી સિલ્વર લાઇન...) બોલાવે.’ ગાડી આગળ વધતી હતી પણ અતિ

વેગે વચ્ચે જીવનવનની જેમ હોડતાં વાઈપર્સ પણ સાવ નકામાં બની રહે એવો ધૂમમસિયો વરસાદ. હિંદુ ફિલ્મનાં રહસ્યમય ચિત્રપત્રો ‘વો ક્રોન થી’, ‘બીસ સાલ બાદ’નાં – આવાં જરૂરે ચાલતાં વાઈપર્સ અને સામે કંઈ જ ન ઢેખાય એવાં – દશથોને પણ ટક્કર મારે એવું અમારી સામે ઘોધમાર વરસાદી દુંધળાપણું, ઘડીક તો ગભરાઈને તાવ ચરી જાય એવું. ગાડીને છાપરે હડતાલિયાઓ મોટા કંકરા માર્યે જાય તેવો કરાનો તડ-તડાક, તડ-તડાક ડેટોક મારો. કાચબાચ બધું ગયું સમજો.

મારે બાઈભાભીને રિવરફન્ન બતાવવો હતો એટલે ગાડી આશ્રમરોડથી ન લેતાં ત્યાંથી લીધી તો રિવરફન્નને બદલે ફીવરફન્ન ! ‘પારાવાર મુશ્કેલી’ એ બે શબ્દો બિચારા છોભીલા પડે એવાં સાંભેલાધાર જાપટાં વેઠતાં પરિષદે પહોંચ્યાં તો ખરાં. મારા પહેલાં આયોજક બહેનશ્રીની ગાડી પહોંચી ગયેલી. પણ ગાડીના કાચમાંથીએ સામસામે એકબીજાને ન જોઈ શકનારા લાચાર અને ગાડીમાં બેઠાં રહીને જ એકબીજાને મોબાઇલથી ડિલસોજુ આપતાં રહ્યાં. પરિષદનો જાંપો પણ જાણે અમારી સામે હડતાળમાં આડો ઉત્તર્યો હોય તેમ જાંપામાં મોટું પીપડું આંદું થઈને પડેલું.

સાંજે સાડા ચારથી સવા પાંચ સુધી પોણો કલાક સુધી ચાલેલું વરસાદ-વાવાડોડાનું મારી વિરુદ્ધમાં ચાલેલું આંદોલન. થયું કે કુદરત જ મારી વિરુદ્ધમાં છે, ઉપરવાળો પણ મારા માટે એવું જ ઈચ્છતો હતો.... કે અરુણા, લખાણ-ભખાણ ઠીક છે બાકી ‘સાહિત્યજગતમાં વક્તવ્ય’ એ આપણું કામ નહીં; આપણો તો આપણો અધ્યાત્મ માર્ગ ભલો, દૂસરો ન કોઈ. જવા દો. ચલ ખુશરો ઘર અપને. હવે આજનો કાર્યક્રમ ના થાય તો ફરી પાંચમી વાર પંચકમાં મારે કોઈ બીજો વાર તો નથી રાખવો, ભગવાનનો કંઈ ખાસ સંકેત લાગે છે.”

પણ ઉપરવાળાએ વરસાદની ઘારની સાથે જ મારી વિચારધારાને અટકાવી દીધી.

ઓઝો આ રંક પર મહેર કરી, વરસાદે ખમ્મા કરી. આવનારા શ્રોતાઓને આવકારવા બે હાથ જોડીને ઓશિયાળાં થઈને હું અને આયોજક બહેનશ્રી જાંપો ઊભાં રહ્યાં. મારાં વડીલો, મુરબ્બીઓ, સગાંસંબંધીઓ, વાલેશરીઓ અને જાણ્યા-અજાણ્યા વાચકો એક પછી એક પલળતાં-પલળતાં, કપડાં અને જાતને સાચવતાં આવી રહ્યાં હતાં. તેમાંય વયે ૭૦-૭૫-૮૦ની આસપાસના વડીલોને પાણીમાંથી માંડ માંડ મારગ કાપતાં જોઈને મને ધરતી મારગ આપે તો સમાઈ જાઉ એવો અપરાધભાવ થઈ રહ્યો. એ અપરાધભાવને ઉતારવા હું એ વડીલોને હાથ દઈને પરિષદમાં અંદર લાવવા મથી રહી, મોટાભાગના પગની તકલીફવાળા, લાકડીને ટેકે આવનારા પણ ખરા, સાડીને દૂંટણ સુધી ઊંચી લઈને સંકોચાતાં-મુંજુતાં આવી રહેલાં વડીલ બહેનો.

કાર્યક્રમ અરધો કલાક મોડો શરૂ થયો, ૬.૦૦ વાગે. ૧૦૦ની સંખ્યાવાળો હોલ ભરાઈ ગયેલો, વધારાની ખુરશીઓમાં બેઠેલા આઠ જણાં. એટલે આમ તો અમદાવાદના

સાહિત્યજગતના વક્તવ્યના કાર્યક્રમમાં મારા જેવા નવાસવા વક્તવ્યના વક્તવ્યમાં આટલી સંખ્યા એ પ્રભુકૃપા સ્તો. પણ આટલી સંખ્યામાંથે શ્રોતાઓ ક્યાંક્યાંથી – ગાંધીનગર-અડાલજ, રાણીપ-ઘાટલોડિયા, નવરંગપુરા, નારણપુરા, ઉસ્માનપુરા, સેટેલાઈટ, પાલડી કે ઠેઠ બોપલ ગામથી મને – હામ દેવા. મોયા ભાગના રિક્ષામાં, બાડીના ગાડીમાં આવેલા. હું પોતે ગાડીમાં આવી એટલે ગાડીવાળાની બૂરી હાલત તો સારી પેઢ જાણું, રિક્ષામાં આવનારાની તો એથીયે બદટર. આજના મારા આ બધા શ્રોતાઓ બાહોશ તરવૈયાની જેમ બાહોશ દ્રાઈવરો અને બાહોશ પોસેન્જરો તરીકે તરીતરીને પરિષ્ઠ પહોંચ્યા, કહી શકાય કે બાહોશ શ્રોતા તરીકે એ બધા તરી ગયા. મારો પ્રેમ પણ તરી ગયો. એ બધા મારે ખાતર તરીને આવી પહોંચ્યાં, પ્રિયતમાને મળવા સાપને દોરડે ચઢી ગયેલા તુલસીદાસજીની જેમ.

વડીલ મુરજ્બીઓનો જ નામોલ્લેખમાં બોરીસાગરસાહેબ, બોપલથી (પાડીમાં) લાંબા થઈને આવેલા વિજય પંડ્યાસાહેબ, મનસુખ સંલ્વાસાહેબ, મારા અધ્યાપક ચીનુભાઈ મોરીસાહેબ, ૪૦-૪૫ વર્ષ પહેલાં મને કોવેજમાં ભજાવતાં સંસ્કૃતનાં અધ્યાપિકાશ્રી, અર્થશાસ્ત્રનાં અધ્યાપક શ્રી મનોરમાબહેન અને અરવિંદભાઈ મહેતાસાહેબ મારાં આશ્ર્ય વર્ચે આવી પહોંચ્યાં, સેણી ભડાયુભાઈ અને ઠિલાબહેન પણ.

તો એંસી વટાવી ચૂકેલાં ભારતીબહેન દવે, પંચોતેરે પહોંચી રહેલાં મારાં અધ્યાપિકા બહેનશ્રી ઠિલાબહેન નાયક વગેરે પણ. દૂરદૂરથી એટલે ગાંધીનગરથી આવી પહોંચેલાં હર્ષદ-બિંદુ ભણ. ચાંદબેડાથી કંકેશ ઓઝા-ભારતીબહેન, ઠેઠ એસ. જી. હાઈવેથી કિરીટ દૂધાત, સાવલીથી અચાનક આવી ચઢેલાં જ્યાદેવ શુક્લ અને પ્રતીક્ષાબહેન, સુનીતા ચૌધરી, રસીલા કડિયા વગેરે. એ ઉપરાંત તો સો-ની સંખ્યામાં બાકી રહેલાં બીજાં મારાં બધાં જ સન્માનનીય ચાહકો.

કાર્યક્રમની શરૂઆતમાં જ મેં કહું :

અજ્ઞાતવાસમાંથી નીકળીને મારું આ સાહિત્યજગતનું પહેલવહેલું વક્તવ્ય અને પેલા ‘દામિની’ ચિત્રપત્રવાળી થઈ રહી, ‘દામિની’ ચિત્રપત્રમાં હીરો સની દેઓલનો એક મશાહૂર ડાયલોગ છે : “તારીખ પે તારીખ, તારીખ પે તારીખ.” ત્રણ-ત્રણ વાર મુલાતવી રખાયેલા મારા આ કાર્યક્રમ માટે મેં આયોજક અરુણાબહેન મહેતાને બે દિવસ પહેલાં પૂછેલું, “મારા આ કાર્યક્રમનો નંબર કેટલામો છે ?” તો એમણે કહું, સત્તર. સાંનું છે ‘તેર’નો આંકડો નથી. સત્તરનો આંકડો તો વટવાળો, આમ ‘ત’ પર ‘ત’, સાડી સત્તર ! વજનદાર ! એટલે સત્તરનો આંકડો પણ વાંકમાં આવતો નથી. તો શું હશે ? થાય છે કે મારા અને આયોજકમાં રહેલું નામ-સામ્ય હશે ! “તો અરુણાબહેન, તમે હવે પણ કોઈ બીજી અરુણાને નહીં બોલાવતા.” પછી મેં અરુણાબહેનને એમ પણ પૂછેલું, “મારા

પહેલાંના તમામ સોળ કાર્યક્રમમાં આમ ત્રણ ત્રણ વાર તારીખ બદલવી પડે છે ખરી ?” તો જવાબ મળ્યો. “ના”. તો બીજું શું હશે ? એટલે મેં અરુણાભહેનને ફરી પૂછું, “મારા પહેલાંના આ સોળ વક્તાઓમાં મારા જેવો કોક નવો નિશાળિયો, પહેલવહેલી વાર આવતો હોય એવું હતું ?” તો એનોય જવાબ “ના” હતો. “તો અરુણાભહેન, હવેથી તમે મારા જેવા નવાસવાને નહીં બોલાવતા; તમારો એ જ ચીનુભાઈસાહેબ મોઢી, બિંદુભહેન ભણ જેવા જૂના જોગીઓને બોલાવવાનો શિરસ્તો ચાલુ રાખજો. નકારું આવું સાહસ ફરી ના કરશો.”

અને પછી શરૂ થઈ “મારી ડેઝ્નિયત” (શબ્દસર - જૂન, ૨૦૧૫).

\*

લગભગ કલાકેક આ કાર્યક્રમ ચાલ્યો, સાંજના સાત સુધી. એ પછી હું બે હાથ જોડીને તો ના પાડતી રહી કે હવે આપ બધાં ઘરે પદ્ધારો. પણ આયોજક બહેને પ્રશ્નોત્તરી રાખી અને શ્રોતાઓએ સહર્ષ મંજૂર પણ રાખી. એ દરમિયાન પણ હું એમને કહેતી જ રહી, “હવે તમે બધાં નીકળો, તમને મોંકું થય છે, તમે સૌ થાક્યાં-કંટાણ્યાં હશો.” જોકે એ અરધોક કલાક ચાલી, કોક-કોક શ્રોતાએ આ કાર્યક્રમનો બીજો ભાગ રાખવા કર્યું, ત્યારે તો તેમને ત્યાંથી ફુટાવવા કે ધક્કો મારીને બહાર મોકલતી હોઉં તેમ ‘હા’, ‘હા’ કરીને વચન આપ્યું અને પછી મેં પરાણો શ્રોતાઓને ઊભા થઈને રજા આપી. મારા માટે કેટકેટલી કુદરતી તકલીફો વેઠીને આવેલા, મારી સામે બેઠેલા, અરધાપરધા કે આખેઆખા પલંગેલા અને તેથી ‘એસી’ને લીધી થથરતા મારા શ્રોતાઓને જોઈને આખાયે કાર્યક્રમમાં અપરાધભાવ મારો સ્થાયીભાવ બની રહ્યો.

\*

રાતે ઘરે જતાં જ બધાના ઝૈન શરૂ થયા અને એમની શરૂ થઈ આજ-સાંજની કરમકહાણી :

ચીનુભાઈસાહેબ એમની ગાડીને પાણીમાં ખેંચી લાવે એવા બાહોશ ડ્રાઇવરની રાહ જોતા હતા. નારણપુરાથી આવતાં ઈલાબહેન નાયકના રિક્ષાવાળાએ બહેનને સ્ટેરિયમ પાસે ઉત્તારી પાડતાં તો બહેન એને પોરસાવતાં કર્યું કે જો આગળ પેલો સ્કૂટરવાળો બે નાનાં છોકરાંને લઈ જાય છે ને તું આમ હિંમત હારે છે ? નાંખ રિક્ષા પાણીમાં અને બહેન પરિષ્ઠ પહોંચ્યાં. તો મનસુખભાઈ સલ્લાની રિક્ષા બે વાર બંધ પડતાં માંડ એ બાટા શોરુમ સુધી પહોંચ્યા અને પછી પરિષ્ઠ સુધી પાણી કાપતા પહોંચ્યા. ભજાયુ વચ્છરાજાની તો ગાડી ઠેઠ ક્યાંથે મૂકીને અક્ષરશઃ પાણીમાં તરતા આવેલા. સુધા મૂર્તિના પુસ્તકોનાં લોકપ્રિય અનુવાદક સોનલ મોઢી તો એરોડ્રામથી સીધાં આવ્યાં, કહો ને વાદળામાં થઈને આવ્યાં મારા માટે. હું એમને ત્યારે પહેલવહેલી વાર જ મળી.

મારાં એક પાડોશી ચંદલેખાબહેનની ગારીનાં વાઈપર્સ જ બંધ થઈ ગયેલાં તોયે એમના દીકરાએ એમને પરિષ્ઠ પહોંચાડ્યાં. મારાં બીજાં પાડોશી બહેન કિણ્ણાબહેન અને એમનાં વહુએ બે વાર રિક્ષા બદલી, તેય રિક્ષાવાળાને કેટકેટલા કાલાવાલા કર્યા પછી. બોરીસાગરસાહેબનાં પુત્રવધૂ રૈનાએ સાહેબને કહી જોયું પણ ખરું “પણ પાછાં જઈએ ?” તો સાહેબ કહે, “અરુણાબહેન પરિષ્ઠ ના પહોંચે પણ આપડો તો પહોંચવાનું જ.” અન્ય સૌ મિત્રોએ પણ ‘કરેંગે યા મરેંગે !’ના ભાવથી જ પાણીમાં ઝંપલાવ્યું હતું.

અને જે મિત્રો નહોતા આવી શક્યા એ બધા કાઈ પાણીમાં બેસી નહોતા ગયા પણ પાણીએ એમને ઘરે બેસાડી રાખ્યા હતા, એમના પગ જકડીને. કોકે મને કહું કે શિવરંજની સુધી તો કોકે કહું કે અંબાવાડી સુધી તેઓ પહોંચ્યા અને રિક્ષાવાળાએ ના પાડી તો કોકની ગાડી અદિયલ ટકુ બની રહી, તેમાંથી સ્કૂટરવાળા તો સાવ દ્યામણા. મોટે ભાગે બધાં ગરનાળાં ભરાઈ જવાથી કોઈ પણ રીતે આવવું અશક્ય હતું. અનિલાબહેન દલાદે કહું કે ચાર વાગે કપડાં પણ તૈયાર કરી રાખેલાં જે એ આજે પણ મારા બીજા વક્તવ્યની રાહ જોતાં એમનેમ પડી રહ્યાં છે. બીજે દિવસે પણ મેઈલ્સ, મેસેજ્સ અને ફોન તો ક્ષમાભાવે ચાલુ જ હતાં, હું સામે કહેતી રહી કે સારું થયું. મારા અપરાધભાવની માત્રા જે ઘટી તે સાચી. બાકી જો આ બધા મિત્રો આવ્યા હોત તો એ બધાને ઊભા રહેવું પડત, સેજની પાંગતે બેસવું પડજું હોત. મારો અપરાધભાવ બમણો થાત. તોયે આ જે મિત્રો સદેહ ભલે ને હાજર રહી ન શક્યા પણ એમની હાજરી હું આખાયે વક્તવ્ય દરમિયાન સતત અનુભવતી રહી હતી, એટલું તો ચોક્કસ.

અને અહીં એવું પણ બન્યું કે મારા પ્રિય શ્રોતાઓમાં જે ઘરેથી થોડા વહેલા નીકળી ગયા તે પરિષ્ઠ પહોંચ્યી ગયા પણ જે સહેજ મોડા નીકળ્યા એમને માત્ર મૂકેલા વરસાદે ઘરે પાછા ધકેલ્યા કે ઘરમાંથી સમૂળા નીકળવા જ ન દીધા. હાજર-ગેરહાજર એ બધા શ્રોતાઓની અંતરતમ શુભેચ્છાઓએ જ મારા પહેલા વક્તવ્યને સામે પાર પહોંચાડ્યાં.

## સાભાર નોંધ

### (કવિતા)

(૨૩૫) કવિતાની કેરીએ કંકુપગલાં : સંપા. ડૉ. કલ્યના દવે, ૨૦૧૪, અશોક પ્રકાશન મંદિર, અમદાવાદ, પૃ. ૧૩+૧૧૦, રૂ. ૨૦૦/- (૨૩૬) ૧૦૮, રમેશ પારેખ : સંપા. શોભિત દેસાઈ, ૨૦૧૪, અશોક પ્રકાશન મંદિર, અમદાવાદ, ૧૨+૧૬૩ રૂ. ૨૦૦/- (૨૩૭) પ્રીતરંગુજન : ગુજરાતિ બરવાળિયા ગુંજન, બીજી ૨૦૧૪, નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ, પૃ. ૨૮૦, રૂ. ૨૭૫/-

# ભારતીય સાહિત્ય

---

બે કાવ્યો (બંગાળી) | સુનીલ ગંગોપાધ્યાય; અનુ. રમણીક સોમેશ્વર

## (૧) કેવળ કવિતા માટે

કેવળ કવિતા માટે લીધો છે મેં જન્મ  
કેવળ એને જ માટે આ બધા નાના-મોટા  
અટપટા ખેલ  
એને જ માટે કેવળ આ એકલ શિયાળુ સંઝો.  
ક્રિતિજ્ઞને પાર કરતો આવી પહોંચ્યો છું હું  
કેવળ એક કાવ્ય માટે, પલકારોય માર્યા વિના  
કેવળ પળભરની શાંતિ માટે.

કેવળ કવિતા માટે જ તો તું છે મારી પત્ની  
કેવળ એને માટે જ આ બધા રક્તપાત  
આ બધી ટેકરીઓ ચૂમે છે વાટળોના ચરણ.

ભલે રવ્યાં અઠળક વેદના-વિષાદ  
છતાં લાંબું ને લાંબું જવવાનું  
થયા કરે છે હવે મન.

કેવળ કવિતાને માટે જ  
ઈચ્છયું છે મેં અમરત્વ.

## (૨) ઘર-અંગણાની ચકલીઓ

માનવસંસકૃતિઓને વીધતી  
કયાં ચાલી ગઈ આ –  
ઘર-અંગણાની ચકલીઓ !  
  
ઈથરનાં મોજાં  
અને બધી જ વેદનાઓને  
પોતાના નાનકડા હૈયામાં ભરીને  
કરી રહી છે એ તો અલવિદા.

હિમગ્રાણી કદરાઓને વળોઈને  
બજીચાદિત ભૂમિની પેલે પાર  
આપણા શૈશવની બધી જ ચકલીઓ  
ઉરી ચાલી આ -  
અંધકારના અન્નત અવકાશમાં.

[સીતાકાન્ત મહાપાત્રના અંગેજ અનુવાદને આધારે]  
(સંદર્ભ : 'Indian Literature' Nov.-Dec. : 2012)



## પોરોકાકાની યાદ | પીટર બિક્સલ, અનુવાદ : રમણ સોની

પોરોકાકા વિશે હું એટલું જ જાણું છું કે એ મારા દાદાજીના કાકા હતા. તે કેવા હતા ને ક્યાં રહેતા હતા ને શું કરતા હતા એ હું જાણતો નથી. બસ, મને એમનું નામ અબર છે - પોરોકાકા. ને આવું કોઈનું નામ હોઈ શકે એવું સાંભળ્યું નથી.

દાદાજીની વાતો આ રીતે શરૂ થાય - 'જ્યારે પોરોકાકા જીવતા હતા ત્યારની વાત છે.' કે પછી - 'જ્યારે હું પોરોકાકાને મળવા ગયેલો....' કે પછી, 'પોરોકાકાએ મને એક જૂનું વાર્ષિક બેટ આપેલું.'

પણ દાદાજીએ પોરોકાકાની પોતાની કહેવાય એવી કોઈ વાત કદી ન કરેલી. પોરોકાકા આ દુનિયામાં હતા તે વખતની, પોરોકાકાને મળવા જવાનું થતું એની, પોરોકાકાએ પેલું વાજું આપેલું એની જ વાતો કાયમ એ કરે.

'તે આ પોરોકાકા હતા કોણ ?' એવું અમે જો એમને પૂછીએ તો દાદાજી કહેતા, 'એક બાહોશ માણસ !'

દાદીમાને તો આવું કોઈ જ નામ યાદ આવતું નહોતું અને પિતાજી તો આ 'પોરોકાકા' એવું સાંભળતાં જ હસવા લાગે ! અને પિતાજી હોસે એટલે દાદાજી ગુરુસે થઈ જાય ને ત્યારે દાદીમા કહે, 'અરે, હા, હા, પેલા પો.... રોકાકા.' એટલે વળી દાદાજી શાંત પડે.

ઘણા દિવસો સુધી મારા મનમાં એ વિચાર ચાલેલો કે પોરોકાકા જંગલખાતાના ઉપરી હશે, કેમ કે જ્યારે હું કહેતો કે, 'હું તો જંગલખાતાનો ઉપરી બનીશ' ત્યારે ત્યારે દાદાજી કહેતા, 'વાહ, આ વાત પોરોકાકાને બહુ ગમી હોત !'

પણ ઘણા વખત પછી જ્યારે મને એન્જિન-ડ્રાઇવર બનવાનો વિચાર આવ્યો ત્યારે વળી દાદાજીએ એ જ કહ્યું કે 'વાહ, આ વાત પોરોકાકાને બહુ જ ગમી હોત !' ને વળી જ્યારે મેં કહ્યું કે, 'મારે તો હેઠે કંઈ બનતું જ નથી' ત્યારે પણ દાદાએ કહ્યું કે,

‘ખરું, પોરોકાકાને આ ગમ્યું હોત !’

મને લાગે છે કે દાદાજી ટેલિફોન પાસે જાય, ટેલિફોન લઈને નંબર જોડે અને બોલે, ‘હેલો, પોરોકાકા, શું ચાલે છે ?... ના, ના, પોરોકાકા... હા, હા, જરૂર પોરોકાકા...’ અને અમે જોતાં કે એમણે તો ટેલિફોનની કળ આંગળીથી દબાવી રાખી છે – એટલે કે કોઈકની સાથે વાત કરવાનો એ ખાલી દેખાવ કરી રહ્યા છે !

દાદીમાને પણ આ બધી જ ખબર હતી. પણ એ કાયમ એમ જ કહે, ‘હવે આ વાતો કરવાનું બંધ કરો ને, ટેલિફોનનો ખરચો કેટલો બધો આવે છે !’ અને દાદાજી ટેલિફોન પર કહે, ‘તો પોરોકાકા, ટેલિફોન મૂર્ઝ છું હવે !’ ને અમને બધાંને કહે – ‘પોરા કાકા બધાંને યાદ પાઠવે છે.’

અને પહેલાં દાદાજી કાયમ એમ જ કહેતા કે, ‘જ્યારે પોરોકાકા જીવતા હતા ને, ત્યારે...’ ને હવે કાયમ એમ છે કે ‘આપણે એક વાર પોરોકાકાને મળવા જવું જોઈએ.’

કોઈક વાર વળી દાદાજી કહે, ‘પોરોકાકા એક દિવસ આપણાને મળવા આવવાના જ, જરૂર આવવાના.’ ને એમ કહીને પલાંઠી પર એક થપાટ લગાવે. પણ આ કંઈ મગજમાં ઊતરે એવી વાત નથી એવો તરત એમને ખ્યાલ આવી ગયો હશે ને એટલે, થોડાક દિવસ એમના આ પોરોકાકાની વાત એમણે કાઢી જ નહીં.

ને અમને જરાક હાશ થઈ.

પણ વળી થોડાક દિવસમાં દાદાજીએ ફરી શરૂ કર્યું –

- પોરોકાકાનો ઝૈન આવેલો...
- પોરોકાકા કાયમ એમ કહેતા કે...
- બસ, પોરોકાકા પણ આમ જ માને છે...
- પેલા ભાઈએ જો, અસલ પોરોકાકાના જેવો જ ટોપો પહેર્યો છે....
- પોરોકાકાને ચાલવા જવાનું બહુ ગમે...
- પોરોકાકા છે ને, ગમે તેવી ટાઢ વેઠી શકે....
- પોરોકાકાને પ્રાણીઓ બહુ વહાલાં...

બહુ વહાલાં પોરોકાકાને ચાલવા જવાનું ગમે તેટલી ટાઢ વેઠી શકે પ્રાણીઓ વહાલાં પોરોકાકાને ચાલવું ગમે તેટલી....

મા રા પો રો કા કા !

અને અમે, એમનાં પોતરાં, દાદાજીની પાસે જઈએ ત્યારે, ‘બોલો, સાત ગુજરા બે બરાબર કેટલા ?’ કે ‘કહો જોઈએ, આઈલેન્ડનું પાટનગર કયું ?’ એવું કશું પૂછવાને બદલે એવું પૂછે – ’ બોલો, ‘પો રો’ કેમ લખાય ?

પછી કહે, ‘પ’ને કાનોમાત્ર ‘પો’ પછી ‘ળ’ નહીં ‘ર’ – ‘ર’ને કાનોમાત્ર ‘રો’. એમાં કેટલા ‘ઓ’ ? બંને ‘ઓ’.

ક્યારેક લહેકાથી લંબાવે : ‘પુરુષ ઓ રૂપુરુષો.’ વળી ઓર લંબાવે : ‘પોઓઓઓઓ  
રોઓઓઓઓ....’

અમારું તો માણું ભમી જાય.

દાદાજીને આ ઓ ઓ-વાળા શબ્દો બોલવાની એવી તો મજા પડે ! એમના  
રૂમમાંથી એ શબ્દો સંભળાયા કરે. એ બોલો -

- પોરોકાકા રોજ રોજ ઓલો ઓરડો ખોલે.

- પોરોકાકા પોતે પોશીડોશીની પોળમાં પોતાની બોલી બોલે.

- પો રો કા કા નો ફો ટો મો ટે

એમ કરતાં કરતાં વળી શબ્દોમાં ધણા વધારે ઓ ઓ થઈ જાય ! :

- પોરો કોકો ઓપોણોને મોલોવા ઓવોશે

- પોરો કોકો ખોબો જ બોહોશ મોણોસ.

અમે વળી આ સાંભળીને અમારા રૂમમાં બીજી ગમત કરીએ. વારાફરતી  
બોલીએ -

પારા કાકા આવ્યા હતા ?

પોરો કોકો ઓવ્યો હોતો ?

પૌરી કૈકૈ ઓવ્યો હોતૌ ?

પુરુ કુરુ અન્યું હતું ?

પ-ર-ક-ક-અ-વ-હ-ત

પરકકાવહત

પણ દાદાજીનું આ ઓઓઓઓઓ સાંભળીને લોકોને અચરજ થાય - ખરેખરની  
ચિંતા પણ થાય દાદા વિશે.

અને હવે દાદાજીએ ફેરવી તોળ્યું !

એ કહે, ‘હું તો આવા કોઈ પોરોબોરોકાકાને જાગતો જ નથી.’

અને કહે - ‘આ તો ભઈ, તુ...મે શરૂ કર્યુ બધું.’ કહે કે, ‘તુમે બધાંએ જ તો  
વળી પૂછેલું મને, કે ‘આ પોરોકાકાનું શું છે?’

હવે, એમને અમે શું કહીએ ?

પણ એમણે આ ‘પોરો’ પકડી લીધેલું. ટપાલી આવ્યો, એને કહે, ‘કેમ છે  
પોરોભાઈ !’

મને કહે, ‘કેમ છે ભાઈ પોરો ?’

પછી તો આ શબ્દ એમને વળગી જ પડ્યો - ક્યારેક કહે, ‘મારા વહાલા પોરો !’,  
ક્યારેક વળી તાડકે, ‘જહન્નમમાં જાય પોરો.’ વાતવાતમાં બોલે, ‘પોરોના સમ’.

‘મને ભૂખ લાગી છે’ એમ કહેવાને બદલે એ કહે ‘મને પોરો લાગી છે’ પછી

તો ‘હું’ કે ‘મને’ પણ ન બોલે. કહે ‘પોરોને પોરો લાગ્યી છે.’

છાયું વાચે ત્યારેય શરૂ કરે : ‘પોરો અને પોરો’ અને પછી સ્થાનિક સમાચારો, એમાંના અક્સમાતના સમાચારો ને મારામારીના સમાચારો આ રીતે વાંચે –

ગયા પોરોએ પોરો કલાકે પોરોની નજીક એક પોરો થયો – જેમાં બે પોરોએ તેમનો પોરો ગુમાવ્યો. એક પોરો ટ્રેનમાં પોરોથી પોરો તરફ જતો હતો ને એક નાનકડો પોરો પોરો આગળ પોરોમાંથી પોરો થયો. અને પોરોનો પોરો, પોરો અને એનો પોરો, પોરો ને પોરાની વચ્ચે જીવલેણ પોરો થયા અને પોરો ઉપર જ પોરો પોરો મરી ગયા.

દાદીમાએ આ સાંભળીને કાનમાં આંગળીઓ ખોસી ઢીધી અને ચીસ પાડી : બસ કરો..., આ મારાથી વેઠાતું નથી, આ તમારો પોરો પોરો મારો જીવ લઈને રહેશે ! પણ દાદાજી કંઈ અટકે ?

એમણે જીવનભર આ ધૂન ચલાવી – ને દાદાજી ઘણું લાંબું જીવ્યા. અને મને દાદાજી બહુ જ ગમતા. અને વાતેવાતમાં એ પોરો શબ્દ જ વાપર્યે જતા, ને તે છતાં અમારી બંનેની વાત બરાબર ચાલતી – મને બધું સમજાઈ જતું. ઘરમાં હું સૌથી નાનો, દાદાજી સૌથી મોટા. મને એમના ઢીંચ્યણ પર બેસાડે અને એ મને પોરો પોરોની પોરો કહે, એટલે કે પોરોકાકાની વાર્તા કહે. મને વાર્તામાં ખૂબ જ મજા પડે. પણ મારાથી મોટેરાં અને દાદાથી નાનેરાં, એ કોઈને એમાં કંઈ કહેતાં કંઈ સમજાય નહીં. ને દાદાજી મને લાડ કરે એ એમને કોઈને ન ગમે !

અને જ્યારે દાદાજીનું અવસાન થયું, ત્યારે હું ધૂસકે ધૂસકે રડેલો.

મેં ઘરનાં સૌ વડીલોને કંધું કે દાદાજીની કબર પર દાદાજીનું મૂળ નામ નહીં પણ પોરો પોરો કોતરાવો, કેમ કે એ એમની અંતિમ ઈચ્છા હતી. પણ હું ઘણું રડ્યો છતાં મારી એ વાત કોઈએ કાને ધરી નહીં.

પરંતુ માફ કરજો –

– આ આખી વાત ઉપજાવેલી છે. મારા દાદાજી ન તો ગયાંબાજ હતા, ન તો એ બહુ લાંબું જીવેલા.

હું ઘણો નાનો હતો ત્યારે એ ગુજરી ગયેલા. મને એટલું જ યાદ છે કે એક વાર એમણે કહેલું – ‘જ્યારે પોરોકાકા જીવતા ત્યારે –’ અને મારાં દાદીમાએ આંખો કાઢેલી – ‘ખબરદાર જો તમારા પોરોકાકાની વાત કરી છે તો’. અને દાદાજી ચૂપ થઈ ગયેલા, ઢીલા પડી ગયેલા અને પછી પોરો બોલવા બદલ માફી માગેલી....

અને એક વાર મને બહુ જ ગુસ્સો આવી ગયેલો, મને બરાબર યાદ છે કે મેં જોરથી બૂમ મારેલી – ‘જો મારે એવા કોઈ પોરોકાકા હોત ને, તો હું બસ એમની જ વાતો કર્યા કરત્યા.’

અને જો મારા દાદાજીએ એ વખતે ચૂપ થઈ ગયા વગર પોરોકાકાની વાતો કર્યે

જ રાખી હોતને, તો એ ચોક્કસ ઘણું લાંબું છિવ્યા હોત, અને દાદાજીએ ને મેં ઘણી મજાઓ કરી હોત.\*

\* મૂળ વાર્તા : *Jodok Sends His Love* by Peter Bichsel.

(નોંધ : મૂળના 'Jodok'નું 'પોરો' કર્યું છે, કેમ કે મૂળ વાર્તામાં લેખકે 'જોડોક' શબ્દમાંના ઓ ઓ પર કેટલીક વર્ણ-રમતો કરેલી છે, જેમ કે, *uncle Jodok will visit us*ને બદલે *oncol Jodok wol vosot os...* વગેરે, વગેરે. એથી એવી વર્ણ-રમતો માટે ગુજરાતી સામાન્તરતાઓ ને ઉમેરણ મૂકવાં પડ્યાં છે, અને એ માટે પાત્રનામ બદલવું પડ્યું છે. એટલા પૂરતું આને રૂપોતર કહી શકાય. એ સિવાય બધી વાક્યશાસનું અનુવાદ કર્યો છે. - ૨૦)

## સાભાર નોંધ

### (નવલિકા)

(૧૩૨) નિબેદો : નવીન નિપાઠી 'અલ્ય', ૨૦૧૪, ડી/પ, અરિહંતનગર, ભુજ-૩૭૦૦૦૧, પૃ. ૧૩+૫૧, ૫૦/- (૧૩૩) રીઆલિટી શો : નવનીત જાની, ૨૦૧૪, લટૂર પ્રકાશન, ભાવનગર, પૃ. ૮૧૮૦, રૂ. ૨૦૦/- (૧૩૪) સંબંધોનું આકાશ : ડૉ. ચન્દ્રકાન્ત મહેતા, ૨૦૧૪, રનાએ પ્રકાશન, અમદાવાદ, પૃ. ૮૧૮૫, રૂ. ૧૮૦/- (૧૩૫) સંબંધોનું મેઘધનુષ્ય : ડૉ. ચન્દ્રકાન્ત મહેતા (૨૦૧૪), રનાએ પ્રકાશન, અમદાવાદ, પૃ. ૮૧૮૭, રૂ. ૧૮૦/- (૧૩૬) જિંદગી રંગબેરંગી : ચન્દ્રકાન્ત મહેતા, ૨૦૧૪, રનાએ પ્રકાશન, અમદાવાદ, પૃ. ૮૧૮૩, રૂ. ૧૮૦/- (૧૩૭) રજા ખજૂરીની ધાયામાં : મોહનલાલ પટેલ ૨૦૧૪, રનાએ પ્રકાશન, અમદાવાદ, પૃ. ૧૨+૨૧૧, રૂ. ૧૮૫/- (૧૩૮) ગાંધીનો દીકરો થા મા : કનુ આચાર્ય, ૨૦૧૪, રનાએ પ્રકાશન, અમદાવાદ, પૃ. ૧૪+૧૩૦, રૂ. ૧૨૫/- (૧૩૯) આસક્તિ : અર્જુનસિંહ ડે. રાઉલજી, ૨૦૧૪, પ્રકાશન, અમદાવાદ, પૃ. ૧૩૬, રૂ. ૧૦૦/- (૧૪૦) સુકેશી : વિહુલરાય શ્રીમાળી, ૨૦૧૪, 'સ્નેહમંદિર', ૬૨, ન્યૂ રજ સોસાયટી, વેજલપુર, અમદાવાદ, પૃ. ૧૨+૨૦૪, રૂ. ૧૭૫/- (૧૪૧) આઈ ઓમ શ્યોર : નીલમ દોશી, ૨૦૧૪, ગૂર્જર ગ્રંથરલ કાર્યાલય, અમદાવાદ, પૃ. ૧૦+૧૬૬, રૂ. ૧૨૫/- (૧૪૨) કાળી પરજ : ઈલા આરબ મહેતા, ૨૦૧૪, ગૂર્જર ગ્રંથરલ કાર્યાલય, અમદાવાદ, પૃ. ૧૨+૨૧૬, રૂ. ૧૫૦/- (૧૪૩) ઈતિ વાર્તા : ડૉ. સતીશ પટેલ, ૨૦૧૪, પ્રવીષ પ્રકાશન પ્રા. લિ., રાજકોટ, પૃ. ૧૭૫, રૂ. ૧૮૦/- (૧૪૪) બે ઈ-મેઈલ અને સરગવો ૨૦૧૩, ડિવાઈન પણ્ણિકેશન, અમદાવાદ, પૃ. ૧૪+૨૦૨, રૂ. ૧૩૫/- (૧૪૫) વાત વાતમાં : ચંદ્રહાસ નિવેદી, ૨૦૧૪, 'સુહાસ' ૬૪, જૈનનગર, અમદાવાદ-૭, પૃ. ૮૦ રૂ. ૬૦/- (૧૪૬) તૃતી વાર્તાઓ : પવનકુમાર જૈન ૨૦૧૫, દિવ્યા જૈન, બી/૨, ગ્રાઉન્ડ ફ્લોર, પ્રેમનગર-૨, બોરિવલી (પશ્ચિમ), મુંબઈ-૮૨, પૃ. ૧૨૮, રૂ. ૧૫૦/- (૧૪૬/૧) સરનામું બદલવાયું છે : વિજય શાસ્ત્રી ૨૦૧૫, ગૂર્જર ગ્રંથરલ કાર્યાલય, અમદાવાદ, પૃ. ૧૦+૧૧૦, રૂ. ૧૦૦/-

તિનોંદ જોશી

## ઘાસ અને હું

જ્યાં સુધી પહોંચે નજર  
 ત્યાં સુધી બસ, ઘાસનો વિસ્તાર છે;  
 ને પછી આકાશ કેરી  
 નીલરંગી કિરિજ કેરી ઘાર છે.  
 પૃથ્વીના આનંદના સ્પંડન સમાં  
 તરણાં હવે છે વારવાર;  
 ના ખબર કે શા સંબંધી  
 સર્વ સંગે એહ મારો ઘાર છે.  
 એ હવે છે આવતાં ધીમો પવન,  
 થાય છે એવું જ મારા ચિત્તમાંહીયે ચલન.  
 જોઉ છું વહેલી સવારે એમને,  
 ને ખુશીથી મહેક મહેક છે મને.  
 ઝકળેથી એ બધાંયે શોભતાં,  
 જોઈ આંસુ હર્ષ કરાં આંખમાં આવી જતાં !  
 થાય છે મારી નજર જાડો હરકા,  
 ને રહે છે ટેકતી એ ઘાસમાં;  
 ના છણે છે એક પળ એનાં ચરણ.  
 સ્પર્શઠો એને નહીં  
 ને નજાકત તોય એની  
 અનુભવું છું મન મહીં !  
 ને બાપોરે હેમ શા તડકા તણું  
 ને હરિત એવા ઘાસનું થાયે મિલન :  
 આભનું, ધરતી તણું, એ બેઉ માંહી,  
 લાગતું કે, મન મળ્યું;  
 જોઈને એ કયાંકથી મુજ દિલ મહીં  
 આનંદ કરું મધ્ય ગળ્યું !

સાંજવેળા તેજ, છાયા, ઘાસ, સૌ  
 સાથે મળીને ખેલતાં :  
 સાદ પાડી ચિત્તને મારાય, સંગે લઈ જતાં !  
 એમના એ ખેલને જોઈ રહું,  
 ને હર્ષપુલકિત થઈ જઉ.  
 પુલકને એ જોઈને લાગે મને  
 કે ઘાસ જુદે રંગ મારે અંગ  
 નાનું રૂપ લઈ વાપી રહ્યું !  
 કેવી અહો આ મન તણી છે સાધના !  
 (વા નેહની એને કહું આરાધના ?)  
 કે જોઉ જેને બા'ર  
 તેને અંગમાં ને અંતરે હું અનુભવું !  
 રે સ્વાનમાંથે ઘાસનું એ ચહુંદિશે;  
 સુખદ એવું જોઉ છું હું ફરકવું.

– પ્રહુલાદ પારેખ

મનુષ્ય પ્રકૃતિનું સંતાન છે. કુદરતનાં સર્વ તત્ત્વો સાથે મનુષ્યનો અનુબંધ પ્રાકૃતિક રીતે જ છે. પણ સમાજ અને સંસ્કૃતિ જેવા સભ્યતાના માળખામાં ગોઠવાઈ જવાને કારણે કુદરતને અનુભવવાના પ્રસંગો જીવનમાં બહુ ઓછા બને છે. પંખીનો ટહુકો ટેપરેકોર્ડર પરથી સાંભળીને વસંત ઋતુને કદી પામી ન શકાય. બુદ્ધિના વિકાસને કારણે મનુષ્યે સગવડો જરૂર મેળવી છે, પણ સ્વાભાવિકતા ગુમાવી દીધી છે. કણવ ઋષિના આશ્રમમાં રહી ઊછરેલી શર્કુતલા માટે વૃક્ષો કેવળ લાકડું નથી. એ એના કુંભીજનો છે. પ્રકૃતિ સાથેનું આવું તાદીત્ય ઘણી વાર એટલું તો તીવ્ર હોય છે કે મનુષ્ય અને પ્રકૃતિ એકાકાર થઈ ગયાં હોય તેવું ભાસે છે. અહીં આ કાવ્યમાં કવિ ખુદ જાણે ઘાસ હોવાનો અનુભવ કરવા લાગ્યા હોય તેવી પ્રતીતિ પ્રગટ થઈ છે.

પ્રહુલાદ પારેખ આમ તો ત્રીસીના સમયગાળાના કવિ છે. ગાંધીયુગમાં રાષ્ટ્રીય આંદોલનની ગુંજ વચ્ચે એમજો શુદ્ધ સૌંદર્યાત્મક કાવ્યો આપીને ગુજરાતી કવિતાને ન્યાલ કરી દીધી છે. પોણી સદી પસાર થઈ ગયા પછી હજુ આજે પણ એમનાં કાવ્યોમાં તાજપ વર્તાય છે. આજની સૌંદર્યનિષ્ઠ કવિતાનાં મૂળ કોઈને પ્રહુલાદ પારેખની કવિતામાં દેખાય તો તે ખોટું નથી. કાવ્યના પ્રારંભે જ દૂર સુધી, ક્ષિતિજની ધાર સુધી દેખાતા ઘાસને કવિ પોતાની આંખોના ડેમેરામાં ઝડપી લે છે, તેવી વાત થઈ છે. ‘જ્યાં સુધી’ અને ‘ત્યાં સુધી’ એવા બે શબ્દગુચ્છ આપોઆપ એ સૂચાવે છે કે એ મર્યાદા બહારના વિસ્તારમાં પણ ઘાસ સિવાય કશું નહીં હોય. આંદે દેખાય તે સાચું, પણ તે સિવાયનું પણ સાચું તેનો સ્વાભાવિક સંદર્ભ અહીં ઊંઘે છે. આ ઘાસનું ફરકવું અકારણ નથી.

એ કેઈ હવાની લહરના સ્પર્શથી ફરકે છે તેવું નથી. એ તો જાણો પૃથ્વીના આનંદના સંદનનું પરિશામ છે. પૃથ્વીના આનંદથી રોમાંચિત થતા ઘાસની કલ્યાના જ કેટલી નવીન છે ! બહારનાં નહીં પણ અંદરનાં કોઈ કારણો ઘાસને ફરકાવી રહ્યાં છે. કવિ એ જાણતા નથી કે પોતાને પણ આ ઘાસ સાથે આટલો સ્નેહ ડેમ થઈ ગયો છે.

ઘાસનું હલનચલન અવલોકતા કવિને એટલું તો તરત અનુભવાય છે કે ઘાસની સાથોસાથ જ પોતાના ચિત્તમાં પણ કેઈક ફરકી રહ્યું છે. એ પણ ઘાસ જેવું જ મૂઢું, કુમળું અને તાજું હશે. કવિને તેનાથી આનંદ થાય છે. ઘાસમાં રહેલાં ઝાકળબિંદુઓ જોઈ કવિની આંખો પણ હર્ષશ્રુથી છલકાઈ ઉઠે છે. એ જ ક્ષણે કવિની નજર જાણે કે હરણ બની ગઈ હોય તેમ ડેક લગાવે છે. હવે નજર નજર નથી પણ જાણે હરણ છે અને તે ઘાસના આ વિસ્તીર્ણ પટ પર ઢેકતી જઈ રહી છે. નજરને કવિએ અહીં કેવી મૂર્તિમંત બનાવી દીધી ! લગ્ને ખસ્યા વગર, કેવળ નજરને જ જવા દઈ કવિ ઘાસના આ વિસ્તારને સ્પર્શ અનુભવી રહે છે.

ઘાસ પર ઢેક લેતી આગળ વધતી કવિની નજરને અચાનક જ્યાલ આવે છે કે બપોરી વેળાનો સોનેરી તડકો અને ઘાસ જ મળી રહ્યાં છે, આ તો આકાશ અને ધરતીનું મિલન છે. સ્વથી સર્વ, સ્થાનિકથી સાર્વભૌમ એવો વિસ્તાર બુદ્ધિથી નહીં પણ હદ્યથી જ પામી શકાય. એટલે જ કવિ અહીં આનંદનું મધ્ય ટપક્યાની અનુભૂતિ સાથે આ આખી વાતને જોડે છે.

સવારનાં ઝાકળબિંદુથી પ્રારંભાઈ ડેમ શી બપોરને વીંધતો સમય સાંજ વેળાએ પહોંચે ત્યાં સુધીની રમ્ય લીલાનો કવિ ઘાસની સંગે અનુભવ લેતા રહે છે. સાંજે તો આ ઘટનાનો જાણે પરમ ઉત્કર્ષ સધાય છે. ‘તેજ, છાયા, ઘાસ સૌ સાથે મળીને ખેલતા’ એમ કહી કવિ પ્રકૃતિના આ રમ્ય આવિષ્ણારોના મંજુલ નર્તનનો નિર્દેશ કરે છે. વળી એ એકલા જ આ નર્તન કરે છે એ પૂરતું નહીં લાગતાં જાણે કવિને પણ એમની સંગે નોતરે છે. ભાવવિભોર કવિને લાગે છે કે આ ઘાસ કેવળ બહાર નથી, પોતાની અંદર પણ જાણે વ્યાપી રહ્યું છે. કાયા ઘાસમય બનતી જતી હોય, એકાકાર થતી જતી હોય તેવું અનુભવતા કવિ પોતાનું અસ્તિત્વ જાણે ઘાસમાં ઓગળી રહ્યા હોય તેવું થઈ રહ્યું છે.

પ્રકૃતિનાં બે તત્ત્વો ઘાસ અને કવિ બંને ભલે અલગ હોય તે છતાં અહીં જાણે એમનું અન્યોન્ય ઓગળી જવું સિદ્ધ થાય છે. કવિ પોતે જાણે ઘાસની માફક ફરકવા લાગે છે. પોતે હવે જે કેઈ બહાર જુઓ છે તે હવે જાણે એમની અંદર પ્રસરી ગયું હોય તેમ લાગે છે. કવિ ઉશનસૂના એક સોનેટ ‘અશ્વત્થભાવ’માં કવિ પોતે જાણે પીપળાનું વૃક્ષ બની જતા હોય તેવું આવેખન કરે છે. જ્યાનત પાઠકના એક કાવ્ય ‘વગડાનો શાસ’માં પણ કેઈક આવી જ વાત છે. પોતે જાણે કોઈ વગડાઉ ચીજ હોય તેમ પોતાનો પરિચય

આપે છે :

ખાડોના હાર મારા પિંડમાં ને  
નાડીમાં નાનેરી નહીંઓનાં નીર,  
છત્પીમાં બુલબુલનો માળો ને  
અંગળીમાં આહિવાસીનું તીણું તીર.  
સૂરજનો રંગ મારાં પાંડાં પીયે ને  
પિયે માટીની ગંધ મારાં મૂળ,  
અર્ધું તે અંગ મારું પિલા પતંગિયાં  
ને અર્ધું તે તમરાનું કુળ.

પ્રકૃતિના તત્ત્વ તરીકેનું આ રૂપાંતર ફરી પેલી આઢિમ એવી હ્યાતીની ઓળખ આપે છે. કવિ તો ત્યાં સુધી કહે છે કે આ મનની સાધનાથી મેળવેલી સિદ્ધિ નથી; એ તો ‘નેહની આરાધના’ છે. જે દેખાયું તે અંદર આવીને એવું તો વિસ્તરી ગયું કે હવે સ્વભન્માં પણ કવિને ચોમેરથી ઘાસનો ફરકાટ જ અનુભવાય છે. આ અનુભવ સુખદ છે. સુખદ છે તેનું કારણ એ છે કે તે નૈસર્જિક છે.

શુદ્ધ કાવ્યકળાને કશી પણ હેતુવિક્ષિતા વિના આમ આવેખતા આ કવિનું મોખરે મૂકી શકાય તેવું આ કાવ્ય છે. હિરિગીત છંદની પંક્તિઓના નાનામોટા વિસ્તારમાં આપણાને ઘાસ પરની તેજધાયાની રમ્ય કીડા અનુભવાય છે. ‘જ્યાં સુધી પહોંચે નજર’ એમ કહીને કવિએ કાવ્યની શરૂઆત કરી, પણ છેવટે એમની નજર બહારથી પોતાની અંદર આવીને વિસ્તરી ગઈ એ સત્ય આપણાને પણ આવી આત્મખોજ તરફ ધક્કેલે છે તેવું નિરાંતે આ કાવ્ય ફરી ફરીને વાંચી જનારને જરૂર લાગશે.

## સાભાર નોંધ

### (કવિતા)

(૨૩૮) શબ્દની સુવિત : બાબુલાલ એમ. વાણીજારા, ૨૦૧૫, ‘આશીર્વદ’ ખોટ નં. ૬૨૩/૧, સેક્ટર-૭/બી, ગાંધીનગર-૨૮૨૦૦૭, પૃ. ૨૨ + ૮૮, રૂ. ૧૫૦/- (૨૩૯) સ્પર્શ (દાર્શનિક કાવ્યો) સંપાદ : અજિત સરૈયા, ૨૦૧૩, શુભમ પ્રકાશન, મુંબઈ, પૃ. ૮૪૭ રૂ. ૮૦/- (૨૪૦) સંવેદનશિલ્પ : નિતા પ્રવીષ ત્રિવેદી, ૨૦૧૪, રી/૫૫, ગુલાબવાટિકા સોસાયટી, જૂના પાદરા રોડ, વડોદરા-૨૮૦૦૨૦, પૃ. ૭૪૮, રૂ. ૫૫/- - (૨૪૧) સંવેદનાનો સાદ : મહેન્દ્ર પુરોહિત, ૨૦૧૪, ‘નિરાંત’, ખોટ નં. ૨૮૭, સેક્ટર-૨૦, ગાંધીનગર, પૃ. ૧૩૪૮૨, રૂ. ૧૨૫/-

### નિબંધની ઝાંખી પડતી જતી છબી | કિશોરસિંહ સોલેંકી

ગુજરાતી વાચકજગતમાં આજકાલ નવલક્ષ્ય કરતાંય નિબંધ વધારે વંચાય છે. પ્રકાશકો નિબંધો ઢગલાંબંધ પ્રકાશિત કરી રહ્યા છે. આથી આપણાને એમ લાગે કે નિબંધની મોસમ છલકે છે કે શું? પણ હીકટમાં જોઈએ તો ખબર પડે છે કે, એમાં ધોરણસરના, સુવાચ્ય અને સુખપાઠય નિબંધો તો ઘણા જ ઓછા છે. અને એમાંય ઉત્તમ લખિતનિબંધો તો એથીય ઓછા છે. ૨૦૧૨-૧૩માં પણ નિબંધની આ જ સ્થિતિ છે. લખિતનિબંધ તથા હાસ્ય અને પ્રવાસ સમેતના નિબંધોને લક્ષ્યમાં લઈએ તો આપણાને પચાસથી પણ વધારે સંચયો મળે છે. પણ જેણી ઉમળકાથી વાત કરીએ, જેમાં ભાવ-વિચાર, વસ્તુ અને ભાષાનું રસાળ સંયોજન હોય એવા સંચયો તો બે આંકડા સુધી માંડ પહોંચી શકાય એટલા છે.

નિબંધ પાસે આપણી અપેક્ષા આમ જોવા જઈએ તો જિવાતા જીવનનું વર્ણન અને પર્યાવરણ પરિવેશના આદેખનથી વિશેષ નથી. નિબંધ એક એવું સ્વરૂપ છે જે ભાવક અને લેખકને એકસાથે કરી લે છે. ભાવકને લેખક માંડીને પોતાના ભાવલોકની વારતા કહે છે. બહુ નિરાંતે પોતાના જીવનના અનુભવો તથા આસપાસનો પરિસર લેખક વર્ણવે છે. એ વર્ણનમાં, એ વિચાર અને ઊર્જામાં સર્જકનું વ્યક્તિત્વ ભાવકને સ્પર્શો અને પ્રસન્ન કરે એ રીતે આદેખાય છે. એમાં એટલી જ શરત છે કે, એ સહજ લાગવું જોઈએ. ભાષા અકૃતક અને વિચારોર્ભ એકસરખી રીતે પ્રવાહિત થવા જોઈએ. સર્જક એક જ નિબંધમાં એક કરતાં વધારે વસ્તુસ્થિતિ કે ભાવોર્ભની વાતો કરતો હોય ત્યારે પણ અનું એક જ કેન્દ્ર હોવું જોઈએ જ્યાં એ વળી વળીને પાછો આવે છે અને દૂર જાય છે. આપણા મોટા નિબંધકારોએ ઉચિત રીતે જ કહ્યું છે કે, લખિતનિબંધ એ ફૂલ અને પતંગિયાની જુગલબંદી છે. જેમ પતંગિયાં કે ભૂમર એક ફૂલ પરથી બીજા ફૂલ પર ઊડીને જાય છે, ગીજા-ચોથા ફૂલ પર જઈને વળી પહેલા-બીજા ફૂલ પર પાછાં આવે છે, આમ ઉડ્યનનાં અર્ધવર્તુળો કે વર્તુળો રચાતાં રહે છે. નિબંધકારની પણ આવી જ ખૂબી છે.

લખિતનિબંધ એ સૌથી વધારે આત્મલક્ષી છે. એમાં સર્જકનું અંતરલોક પ્રગત થાય છે. સર્જકનું અનુભવસમૃદ્ધ જગત, અનાં રસરુચિ, અની આસપાસનો પરિસર અને બધાને વળી-ગુંથી લેતી પોતીકી ભાષા નિબંધને બરાબર ખીલવી શકે છે. આ ભૂમિકાએથી જોતાં આપણાને ૨૦૧૨માં પ્રવીણ દરજાનો ‘અથ કિમ્’ અને ૨૦૧૩માં ‘હજી યાદ છે’ – એવા બે સંચયો મળે છે. ‘અથ કિમ્’ સંચયમાં પ્રકૃતિ અને પરિસરને વર્ણવતા ચાર-પાંચ પાનામાં સમાઈ જતા લખિતનિબંધો છે. નિબંધના અભ્યાસી એવા નિબંધકારે

અત્યાર સુધીમાં બારથીય વધારે લવિતનિબંધસંગ્રહો આપ્યા છે એટલે ઘણી વાર એમ પણ લાગે છે કે નિબંધ હોઠીના કારણે લખાય છે. એમાં ભાવલોકની તાજપ અને પરિસરનું પ્રભાવક આવેખન કરતી ભાષા ઓછી વાર દેખાય છે. જેમ કે, રાધાકૃષ્ણ વિશેના કે યુવાનોને સાંકળતા નિબંધો પૂરા ઉઘડતા નથી; એની સામે પ્રકૃતિ અને પરિસરના નિબંધો આપણને થોડી વાર રોકી રામે છે. ઘણા બધા નબળા નિબંધો છાપાની કોલમની દેણ લાગે છે. દા. ત., ‘તું ક્યાં છે ?’ (પૃ. ૮૪), ‘મોગરાનું ફૂલ’ (પૃ. ૧૨૪), ‘સિંગેચર’ (પૃ. ૧૨૮), ‘સ્પેસ’ (પૃ. ૮૨) જેવા નિબંધો નર્યા કૃતક લાગે છે. જ્યારે ‘ધરા પોડશી’ (પૃ. ૬૬) જેવા નિબંધો ભાવ-ભાષાની સંવાદિતાથી સ્પર્શી રહે છે. પ્રવીષ દરજના નિબંધો વિશે એક નોંધ કરવાનું મન થાય છે : આ ગાળાના એમના નિબંધોમાં વસ્તુ, વિચાર અને ભાષા ત્રણેયનો લય ક્યાંક ક્યાંક ખોડગાતો અનુભવાય છે. આ નિબંધો છાપાની કોલમ માટે લખાયા છે એવું લાગ્યા વિના રહેતું નથી કેમ કે એમાં ગોઠવણ પકડાઈ જાય છે. લેખકે વિચાર કે ભાષાને ખેંચી-તાણીને ગોડવ્યાં હોય એવું ક્યાંક લાગે છે. પણ્ણિમના સાહિત્યવિચારના સંદર્ભો આપવાનો મોહ ખૂબો છે તથા અંગેજ ભાષાના શબ્દ-પ્રયોગો નિબંધમાં આગંતુક લાગે છે. ‘નથમાં મોર’ જેવા કોઈક કોઈક નિબંધનું ગંધ ધ્યાન ખેંચે છે. જેમ કે, ‘એ વાત છે શ્રાવણના મોરની. હું જાણું છું પ્રિય ! કે મોર’ શબ્દ કાને પડતાં તમારો ચહેરો એકદમ રતુંબડો થઈ જશે. તમે પણ ખુલ્લું મેદાન બનીને ઘાસની જેમ વિસ્તરી રહેશો, ડોલી રહેશો. આંખ સામે જ્યાં જ્યાં, જ્યારે જ્યારે બેચાર મોર આવીને કળા કરતા કે ટહુકતા જોઉં-સાંભળુંં છું ત્યારે મનોમન તમોને નિમંત્રી રહું છું – દોડી આવો, ઉત્તરાવ કરો, ઝાટાડ આવો, હાથમાં પાંચમપલ્લી આવે તો એ પહેરી લો, વિચિત્રા કે કંજીવરમું આવે તો તેને પરિધાનિત કરો, મહેશરી કે ચંદરી હાથ સમો તો તે ઓછી લો, અરે, ગઢવાલ આવી મળે તો તેને વાંટી લો – પણ આવો – વિના વિલંબે ! ખબર છે ? પેલી ગોપીઓ રજમાં મોર નિહાળીને એવી જ દોડાદોડી કરી મૂકતી. જે આવ્યું તે પહેરી-ઓછીને એ ભાગી જ સમજો ! મોર અને મનમોર બંનેનું કુળ એક જ કદાચ હશે. બંનેનું નમવું ગમે છે, ચંચળ ચંચળ થઈ રહેવું ગમે છે. બંનેને કમભંગ ગમે છે. બંને આનંદ – ઉચ્છ્વાસ હોય છે ત્યારે મહાર જ છેઠે છે. કહું છું પ્રિયે ! તમે દોડી આવો.’

‘હજી યાદ છે’ સંચયમાં પ્રવીષ દરજાએ ‘કૂવો’, ‘અરીસો’, ‘હંલ્લી’, ‘કુલેડું’, ‘ાંપો’, ‘આડો’, ‘નાવણિયું’, ‘વળગણી’, ‘પાણિયારું’, ‘ઊમરો’ અને ‘વાઢી’ જેવા નિબંધો લખ્યા છે. આ નિબંધો વસ્તુના ઉપરછલ્લા આવેખનથી આગળ વધતા નથી એમાં સર્જક સહજપણે વિહરતો-પમાતો નથી. આવા નિબંધોનો આંતરલય રચાતો નથી. પ્રવીષ દરજના ઘણા નિબંધોમાં ગંધની શુષ્ણતા તથા શબ્દાળુતા સંભળાય છે. દા. ત., ‘સાંભળ્યા કરો (પૃ. ૪૩)’ જેવો નિબંધ કેટલો બધો કૃતક લાગે છે તે વાંચતા તરત જ પકડાશે.

ઉમાશંકર જોશીએ જેને નોખો-અનોખો નિબંધ કહીને ‘પેડારિયાં’, ‘સંસ્કૃતિ’માં છાઓ હતો, સુમનભાઈ શાહે ‘હોળી’ ‘ધુળીની’ સરાહના કરીને વધાવ્યા હતા અને કુલીનચંદ યાજીકે ‘સુગંધનો સ્વાદ’ કહીને નવાજ્યા હતા એવા ગુજરાતી સાહિત્યમાં ઉત્તર ગુજરાતની તળભૂમિના નિબંધોની શરૂઆત ‘ભીની માટીની મહેક’ - (કિશોરસિંહ સોલંકી)થી થઈ. એની સાથોસાથ પંચમહાત્મિયો પરિવેશ લઈને આવતાં ‘ભૂસાતાં ગ્રામચિત્રો’ અને ‘વૃક્ષાલોક’ના સીધા અનુકરણમાં લખાયા હોવાની ખાતરી ભગીરથ બ્રહ્મભણના નિબંધોમાં જોવા મળે છે. એમના આ નિબંધોમાં કૃતકતા હોવા સાથે તર્કદૂષિતતા છે. પરિવેશ અને ઝાતુઓનું અજ્ઞાન પણ એમાં વારે વારે દેખાય છે. નિબંધકાર પાસે હોવી જોઈતી ઉર્મિશીલતા, પ્રકૃતિ અને પરિવેશને જોવા - જીલવાની સંવેદનસભર સૂક્ષ્મ દર્શિ તથા સહજ કલ્યાણયુક્ત ભાષા એમના નિબંધોમાં કશેય દેખાતી નથી. ‘પદાર્થપર્વ’ના આ નિબંધો અનું ઉદાહરણ છે. ‘કબર ઉપર’, ‘ઘર’, ‘સાવરણી’, ‘ગોખલાની ગરિમા’ અને ‘પાણિયારું’ જેવા નિબંધો આછિલકાઈ, બનાવત અને સ્થળ માહિતીથી બદબદે છે. કેટલાક પ્રકારની સ્થળીતા અને પરિચય આપવાની ઘેલણ એમના ‘અભાવનું ઐશર્વં’ સંચયમાં પણ જોવા મળે છે. નિબંધમાં ‘બ્યતીત રાગ’ તાજીગીરી ભાષા અને સૂક્ષ્મતા તથા નૂતન દર્શિયી આદેખાય તો એને વખોડવાનું કોઈ કારણ નથી. પણ ભગીરથ બ્રહ્મભણના આ નિબંધોમાં આપણે ત્યાં લખાઈ ગયેલા નિબંધોનું ક્યાંક પાઠક્રે પુનરાવર્તન છે. નિબંધકાર તરીકે ભગીરથની પોતાની કોઈ સંવેદનલકીર કે ભાષાશક્તિ દેખાતી નથી. અનુભવની સમૃદ્ધિનો અભાવ એમને વારેવારે નહે છે. શીમળો-કેસૂડો ક્યારે ફૂલે ચેડે એની માહિતી નથી. મહુડાને એ ફેબ્રુઆરીમાં ખીલવે છે. આ બધું સાચું નથી. એમની પાસે નિરીક્ષણના અનુભવનો અભાવ દેખાય છે.

બળવંત જાનીના નવ અંગત નિબંધોનો સંચય ‘નવનિધિ’ ધ્યાનપાત્ર છે ખરો. એમાં દાદા-દાઢી-પિતા-ઘર વગેરેનાં ચિત્રો સાથે ગાય અને ઘોડી એવાં પ્રાણીઓ તથા ગામ-ઘરના અસબાબનું આદેખન ભાવભર્યું લાગે છે. આ નિબંધોમાં ભાવ અને ભાષા એકબીજામાં રસાઈને પ્રગતાં હોવાથી ભાવકને રોકી રાખે છે. જોકે બલવંત જાનીને વિગતપ્રાચ્યુર્માં રસ છે. ક્યારેક એમના નિબંધોમાં આવી વિગતોનો ખડકલો કે લંબાણ કઠે છે. નિબંધની સહજતા, સ્વભાવોક્તિભર્યા વર્ણનો અને ભાષાની તાજપ આ નિબંધોમાં એકસરખાં અનુભવાતાં નથી. એક રીતે કહીએ તો આ નિબંધોને સર્જનાત્મક બનાવનારા ઘટકોની માવજત પૂરી ખાંખતથી થઈ શકી નથી. લેખકનો લવિતનિબંધ પ્રવેશ થવાનો હજુ જાણો બાકી છે.

દ્વિનેશ પટેલિયા વિજ્યનગર પાસે આવેલા પોળોના પણડોમાં એમનું ગામ-વતન-ઘર ધરાવે છે. એમણે પોળના પાદરમાં એવો એક નિબંધસંચય આચ્છો છે. એક રીતે કહીએ તો આ નિબંધો પોળોના પણડોમાં આવેલાં મંદિરો, નગરના ભગ્ન અવશોષો,

નદી-પહાડો, વાવ-કૂવા અને એના ઈતિહાસનો પરિચય આપે છે. અહીં પણ ખચાખચ ભરેલી વિગતો લખાજાને માહિતીકક્ષાએ રોકી રાખે છે. નિબંધમાં હોવું જોઈનું મોકળાશબર્યું ઉડ્યન, વસ્તુ અને પરિવેશનું રમ્ય-ગર્મ્ય આવેખન અહીં ગેરહાજર છે. પ્રવાસીઓને એક ગાઈડ તરીકે ઉપયોગી થાય એવું આ પચાસ પાનાંનું પુસ્તક પરિષ્ઠદે બી. કે. મજમુદાર ટ્રસ્ટ પ્રકાશનશ્રેષ્ઠી અંતર્ગત પ્રકાશિત કર્યું છે. અહીં ગાંધીની પ્રવાહિતા તથા ચાર્ચુતા સર્દતર ગેરહાજર છે. નિબંધ અને દસ્તાવેજી લખાજા જુદાં હોય છે.

‘ગોઠડી’ નામના સંચયમાં તુષાર વાસે પ્રકૃતિ અને સાંપ્રત જીવનને વજી વેતા નિબંધો આપ્યા છે. એમનામાં નિબંધ માટેનો પ્રેમાદર પૂરેપૂરો વર્તયા છે. કેટલાક નિબંધોમાં વ્યક્તિ કે પ્રકૃતિમાં ચિત્રો સ્પષ્ટ રીતે ઊપર્યાં છે. ક્યાંક ઝતુવર્ણન કે આસપાસનાં પરિસરનું આવેખન સારી રીતે થયાંનું અનુભવાય છે, ‘વસ્તાને વધાવીએ’ નિબંધનો આરંભ જુઓ : ‘શિશિરે વસ્તાને ખો આપી દીધી છે. ચોપાસ પુષ્પસૂદિ ખીલી ઉઠી છે. આજુઆજુનો પરિવેશ મધ્યમઘવા માંડગો છે. પુષ્પોની ઝોરમથી આપી કાચા વાસંતી બની જાય છે. થોડી જ કષણોમાં સુગંધ રોગરામાં વ્યાપી જાય છે. મારી ભીતરે વસ્તા કોળી ઉઠે છે. રસ્તા પર ચાલ્યો જાઉં છું તો ભાતભાતનાં પુષ્પો પોતાની નાજુક શી ગરદન નમાવી મને એમની પાસે આવવાનું હંગિત કરતાં લાગે છે. જે ડાળ પર પુષ્પો ખીલ્યાં હોય છે એનો હરખ માતો નથી. પુત્ર પરણતો હોય ત્યારે માને જેવો હરખ થતો હોય તેવો હરખ અત્યારે શાખાઓનો છે, મૈ ! ડાળ પર શોભતાં પુષ્પો જાણે કોઈ અજ્ઞાત કવિની કાવ્યપંક્તિ’. પણ સાંદ્રત પ્રસન્ન કરી દે એવો નિબંધ એમની પાસેથી મળવો હજી બાકી છે. ગુલાબ દેઢિયાના ‘ઓસરીમાં તડકો’ના નિબંધો થોડાક સ્પંદનો અને થોડાક પ્રસંગોને આવેખે છે. લેખકને ઘણું ઘણું કહી દેવું છે. પણ એવું નિબંધન થતું નથી. એટલે ભાવ-ઉર્મિનું સહજ અને સ્પર્શર્ય ભાષામાં આવેખન થતું નથી એટલે આપણને માહિતી મળે છે ખરી. ક્યાંક સંવેદનનો સ્પર્શ થાય છે ખરો પણ ભાવકને રોકી રાખે એવો. બધી રીતે નિબંધ કહેવાય એવો નિબંધ મળતો નથી. રાઘવજી માધ્યદના ‘ગુલમહોર’ સંચયમાં જેટલા લઘુનિબંધો છે, એ બધામાં કોઈ ઘટના-અનુભવ-પ્રસંગ કે સ્થિતિનું વર્ણન જોવા મળે છે. અહીં પણ વસ્તુ-વિષય અને ભાષાને સંયોજને પરિણામ લાવવાની મથામજ ઓળી છે. ‘ને તું ના આવો’ (ધર્મશ ભણના) સંચયમાં તર લેખો છે. આ લઘુદેખો વિષયને અડે છે ખરા, પણ એને ચારેઆજુથી ઓળખી અને રજૂ કરતા નથી. વસ્તુ કે વિગત વિશે, વ્યક્તિ કે સ્થિતિ વિશે જે તત્કાળ સૂઝે તે લખીને આ લખાજાને તરતાં મૂકી દીધાં છે. વિચાર-સંવેદન કે જીવનસંદર્ભે આ લખાજો કશો પ્રકાશ પાડતાં નથી. નિબંધ માટેની સંવેદના અને ભાષા બંનેનો અહીં અભાવ છે એટલું જ; પણ એનું કોઈ વિશેષ પરિમાજ કે સર્જકભાષાનો અનુભવ એમાંથી પ્રગતાં નથી. ‘વિચારોની રખડપણીમાં’ હરેશ ધોળકિયાએ જીવન-સમાજ અને શિક્ષણને લગતા વિચાર-પ્રધાન લેખો

મૂક્યા છે. એમના આ લેખો માહિતી આપે છે. વિચારોની યાદીઓ કરી આપે છે. આ લેખો એકેટભિક છે. ‘સુવર્ણવૃક્ષનાં ખરતાં પાન’ સંચયમાં ડૉ. હંસા પ્રદીપે ભારતીય સંસ્કૃતિ વિશે પરિચયાત્મક લેખો આયા છે. તો ‘સત્ય એકબીજાનું’ સંચયમાં કાજલ ઓઝા-વૈદે વિચાર-ઘટના-પ્રસંગો આપીને વાચકોને સમજજ્ઞ આપવા માટે સંવેદિત કરવાનો પ્રયત્ન કર્યો છે. ‘આ દૂરનું આકાશ’ સંચયમાં હરિવદ્ધન મહેતા એમનાં આવેખનોને હળવા નિબંધ તરીકે ઓળખાવે છે. પણ આમાં અગધાપદ્ય બધું ભેણસેળ છે. બીજાની પંક્તિઓ તથા અશ્રિષ્ટ ભાવો-વિચારો પણ એમજો એમાં આલેખ્યા છે. કન્યેયાલાલ ભરુના ‘મોરપીઠના રંગ’માં પ્રસંગો અને વિચારોને આવેખતા તર લેખો આયા છે. વિચારપ્રધાન નિબંધો લેખે પણ આ લખાણો ધ્યાનપાત્ર બનતાં નથી. એ જ રીતે ‘સમજજ્ઞનો સેતુ’માં બિપીન પંડ્યાએ બોધાત્મક શૈલીમાં કેટલાક લેખો આયા છે. લોપા ઘરોડના ‘પ્રેમની પરિભાષા’ સંચયમાં કુટુંબજીવનના ભાવોને સ્થૂળતાથી વર્ણવ્યા છે. અનિલ ચાવડાએ ‘મીનિંગફુલ જર્ના’માં કેટલીક સંજ્ઞાઓ જે માનવજીવન સાથે ઓતપ્રોત છે તે કવિના દસ્તિકોણથી આવેખવાનો પ્રયત્ન કર્યો છે. એમની વાત અલંકારો-રૂપકો અને કાવ્યાભાષી ગંધમાં અટવાઈ ગઈ છે. એમાંથી ભાવકને શબ્દપ્રલાપો સિવાય જાતી ઉપલબ્ધ થતી નથી.

અરુણાબહેન જાડેજાએ ‘લખવેયાગીરી’માં રસોઈકળા અને વિવિધ વાનગીઓ વિશેના રસપ્રદ લેખો કર્યા છે. વિષયવસ્તુ અને ભાષા બંને રીતે આ લેખો આસ્વાધ્ય છે. વાનગીઓની વાત રેસીપીની રીતે ન કરતાં તેને બનાવવાની પદ્ધતિ તથા એના અનેક ગુણધર્મો અને પ્રાદેશિક વિશેષતા સમેત વર્ણનો કરવાથી વાત વધુ વ્યાપક બને છે. વળી, લેખિકાની જે તે વિષયને રજૂ કરવાની રીત પણ એક નવું પરિમાણ આપનારી બની રહે છે. ‘છાશલીલા’નો આરંભ જુઓ : ‘વૈશાખનો મધ્યાહ્ન અને અનિન વરસાવતું આકાશ. એવો જ સામો પડધો પાડી રહેલી તપ્ત ધરતી. અકળાયેલો બળ્યોજ્યો એક જીવાત્મા પરસેવે રેબળેબ થતો ઘરે પહોંચે છે. બારણું ખોલતાં જ સામે પડેલી પાટ પર એ ઢળી પડે છે. ઢળેલી નજર પડે છે એક દોષી પર. ધમધમાટ કરતી વરાળ આવરીબાવરી બનીને ઊરી જાય છે. એ ઠંડીગાર દોષીમાં છે, ધગધગતું આસમાન અને ભેગો ચાંદો પણ ખરો. ત્યાં જ એક બ્હાલસોયું સ્વજન આવીને સામું ખાલો ધરે છે. એ જ અસ્વસ્થતા સાથે એ ખાલો હાથ લે છે. ટાઢાબોળ ખાલાને હાથ અડાડતાં જ એનાં અંગો અંગમાં શીતળતાની એક લહેરખી ફરી વળે છે. એ ખાલો મોઢે માંડે છે. ઘૂંઠડો ભરે છે. જાંઝો, અમૃતનો ઘૂંઠડો ભર્યો ! એ ખાલામાં હતી છાશ. જેને જોઈને અમૃતેય દેવોની પાછળ દૂમ દબાવીને બેસી ગયું છે. એ તો આપણી છાશ, અમૃતથી પણ અદકેરી.’

પ્રવાસ-નિબંધ અને પ્રવાસકથા એ બે જુદી વસ્તુઓ છે. ભોળાભાઈ પટેલના ‘વિદ્ધિશા’ના નિબંધો પ્રવાસનિબંધો હોવા સાથે ભાષાસંદર્ભ લલિતનિબંધો પણ બની રહે છે. આવા ‘વિદ્ધિશા’ના કુળગોત્રના પ્રવાસનિબંધોનો કોઈ સંચય પણ આ બે વર્ષ દરમિયાન

આસ ધ્યાન બેંચતો નથી. પ્રવાસનિબંધમાં પ્રવાસનું સ્થળ, એનો ઈતિહાસ, વ્યતીત અને સાંપ્રત એ ત્રણેયની સાથે પ્રવાસ લેખકનું એ ક્ષાળોનું સંવેદન અને એનું વ્યક્તિત્વ આલેખનમાં રસાઈને આવે ત્યારે એ નિબંધને પ્રવાસનિબંધ કહી શકાય. આપણને છૂટક પ્રવાસનિબંધો મળ્યા છે ('કુમાર', 'પરબ', 'શબ્દસૃષ્ટિ', 'શબ્દરસ' વગેરેમાં) – પણ કોઈ ધ્યાનપાત્ર સંગ્રહ મળ્યો નથી. પ્રવાસકથાઓ એ જે-તે પ્રદેશ કે દેશનો લેખકે કરેલો પ્રવાસ, એના અનુભવો, એનાં જોવાલાયક સ્થળો ઠત્યાછિ વર્ણવે છે. જોકે મોટા ભાગની પ્રવાસકથાઓ નરી માહિતીપ્રધાન હોય છે. દાત., સોમાભાઈ પટેલની 'અમેરિકા પારી નજરે'. જેમાં સમાજની ભૂમિકાએ વાત કરવામાં આવી છે. આ કથા કોઈ વિશેષ સાહિત્યિક ગુણવત્તા ધરાવતી નથી.

સાહિત્યિક દાખિલાનું અને કંઈક ધ્યાનપાત્ર એવી ત્રણ-ચાર પ્રવાસકથાઓ મળે છે ખરી. જેમાં પ્રવીણસિંહ ચાવડારચિત 'મારો એડિનબરાનો પ્રવાસ' મહત્વની પ્રવાસકથા છે. પોતે એડિનબરા યુનિ.માં એક વર્ષ આગળ અભ્યાસ કરવા ગયા એ વખતનું કુમબદ્ધ આલેખન છે. એમનાં આ સંભારશાંખમાં લેખકની પોતાની સંડોવણી, શિક્ષણજગતની ગતિવિધિઓ, એમનું ત્યાંનું મિત્રવર્તુણ તથા ત્યાંનો પ્રાકૃતિક પરિસર પૂરા તાદૃત્યથી અને રસાળ ભાષામાં આદેખાયાં છે. ભોળાભાઈ પટેલ કહ્યું છે એમ 'એ પ્રવાસકથા વાંચતી વખતે એક સંખંચ નવલકથા વાંચતા હોઈએ એવો અનુભવ થાય છે.' કેટલાક પ્રસંગો અને મિત્રો સાથેના અનુભવનું અત્યંત સંવેદ્ય આલેખન ભાવકની આંખોને આદ્ર્ય કરે છે. એકત્રીસમો નિબંધ છે કૂંકી વાર્તાની સરહદને સ્પર્શાંતો બની રહ્યો છે. અંગેજ માત્રા અને બંગાળી પિતાનું સંતાન એવી પ્રતિભા પોતાના પિતાને મળવા કલકત્તા આવે છે. પહેલી મુલાકાત આઘાત આપનારી બની રહે છે. તે નિરાશા થઈ જાય છે. બીજી સવારે તેને એક નવો અનુભવ થાય છે. એનું વર્ણન જુઓ : 'પ્રતિભા લોથ બનીને પલંગમાં પડી હતી, આર્નલ્ડ એને ઊભા થવા, દાંત સાફ કરી પેટમાં કંઈ નાખવા સમજાવી રહ્યો હતો, ત્યાં બારાં છોભીલા ટકોરા થયા. બારણું ઉઘાડ્યું તો પેલા વૃદ્ધ નીચું ઘાલીને ઊભા હતા. અંદર આવીને એ એક ખુરશીમાં બેસી ગયા. કંઈ બોલ્યા નહિ, એક શબ્દ પણ પણ નહિ. બેઠા બેઠા રડયે ગયા, ધૂસકે ધૂસકે બાળકની જેમ. આખું શરીર ધૂજે. પ્રતિભાને બીક લાગી, આમને કંઈક થઈ જશે. તે ક્ષાળે પુત્રીએ પિતાને દીકરી-જમાઈને ઘેર તેરી ગયા. પ્રવીણસિંહમાં રહેલો વાર્તાકાર અહીં જાણે હાજર છે એટલે કથા કહેવાતી જાય છે અને ઘટનાઓ આંખ સામે ઘટતી જાય એવો બેવડો અનુભવ આ પ્રવાસકથા કરાવે છે. એ એમની શૈલીની વિશિષ્ટતા પણ છે.

‘વિદેશો મુજબ મુંઘ ભરમણ’ જગદીશ દવેની આ ભરમણકથા વિવિધ વિભાગોમાં વહેચાયેલી છે. એમાં પહેલા વિભાગમાં ૧૧ લાખિતનિબંધો તરફે એમણે ઓળખાયેલા એમના પ્રવાસનિબંધો અંગત સંવેદન સાથે પ્રવાસસ્થળનું સુચારુ આવેખન કરે છે. બાકીના હાસ્ય-કટાક્ષ, અંગત તથા ચરિત્ર અને વિચારને વ્યક્ત કરતા નિબંધો એકેટેમિક લખાણો બનીને અટકી જાય છે.

‘દીકરી સંગે દેશાટન’ કેશુભાઈ દેસાઈની પ્રવાસકથા છે. એમાં જેણું લગ્નજીવન ભરન થયું છે એવી દીકરી દિપ્રેશનમાં આવી ગઈ છે. ત્યારે એના પાલક પિતા દિલ્હી, પંજાબ અને હિમાચલ ક્ષેત્રોનો એની સાથે પ્રવાસ કરે છે અને એનામાં નવી જીવનચેતના ભરવાનો સફેન પ્રવાસ કરે છે. અનેક વ્યક્તિઓ, સહયોગીઓ, યજમાનો તથા મહત્વના અને ધ્યાનપાત્ર કર્મદ માણસોને આ પ્રવાસમાં મળવાનું બને છે. એ બધાથી વિગત ખરિત આ પ્રવાસકથામાં લેખક પોતે સવિશેષ જગ્યા રોકે છે. દીકરીનું હદ્દય, મન હળવું થાય એવા પ્રસંગોનું આવેખન ઓછું થયું છે. કેશુભાઈ બીજા અનેક અનુભવોને એમાં ઠાંસીડાંસીને ભરવાનો મોહ છોરી શકતા નથી એના કારણે આ પ્રવાસકથા જાણે પ્રસંગો અને વ્યક્તિઓના સીધાસાદા-સપાટ ચિત્રાણનો મામલો બની રહે છે. જયંતીબાઈ આહીરની ‘લક્ષ્ણીપ ટાપુની સફરે’ નામની કથા સ્થળોની માહિતી આપવામાં જ ખર્ચાઈ જાય છે.

પ્રવાસકથાલેખક પાસે હોવી જોઈતી સંવેદના, વસ્તુસંકલન, પ્રદેશના વિશેષો અને પારિસરને આવેખતી સાહિત્યિક ગુણવત્તાવાળી ભાષા આપજા જે જે લેખકો પાસે નથી એમની પ્રવાસકથા માત્ર માહિતીનો ખડકલો બનીને અટકી જાય છે. પ્રા. રક્ષા દવેનો કેરાલા પ્રવાસ ‘આત્મનિ કિમ્બુ’, ભગેશ કડકિયાની ‘અનંત પથ યાત્રાનો’ તથા દેવેન્દ્ર પટેલની ‘કુચ્છની ખુશ્ભૂ’ પ્રવાસકથાઓ ઉપર નોંધ્યું છે તેમ માહિતીના આવેખનની જરાય આગળ વધતી નથી.

આ બે વર્ષો દરમિયાન આપણને કોઈ ઉત્કૃષ્ટ હાસ્યનિબંધનો સંચય મળ્યો નથી. રમણલાલ પટેલનો ‘અઢરેય અંગ વાંકા’ ખાસ નોંધપાત્ર નથી.

### તારણો :

આપજા ઘણા બધા નવોહિતો તથા વયમાં મોટા અનુકરણિયા નિબંધલેખકોને નર્મદાની આ ઉક્તિ યાદ અપાવવાની પુનઃજરૂરિયાત છે. નર્મદ કહે છે : ‘નિબંધો લખવા એ જેવીતેવી વાત નથી. નિબંધ લખવો અધરો છે.’ આ બે વર્ષમાં આપજા સામે ગુજરાતી નિબંધનું જે ચિત્ર પ્રત્યક્ષ થતું આવે છે એ કભાસ : ઝાંખું એટલે કે ધૂંધળું માલૂમ પડે છે. વિચારપ્રધાન નિબંધોમાં પણ ભાષાની-અભિવ્યક્તિની પકડ કે પ્રભાવક સહજતા નથી દેખાતી. એ જ અન્યોનું ખુલ્લું અનુકરણ અને તર્કદોષભરી તથા કૃતક ભાષા વાચકને બેહાલ કરી દે છે. સહજ સંવેદન અને એવી જ તાજગીભરી, નવાં કલ્પનો / ભાવકલ્પનો

લઈ આવતી નિજ મુદ્રાવાળી ભાષા વિના આપણો લખિતનિબંધ ધીમે ધીમે ઘરેડિયો બનીને રહી જાય છે. પ્રવાસને નામે અધકચરી તથા વાંચીને મેળવાતી માહિતીનો રગડો રજૂ કરનારાઓ વધતા જાય છે. આ બધામાં હાસ્યનિબંધોનો દૃષ્ટકાળ પણ આપણને શિંગિત કરે છે.

આ સરવૈયાની ભૂમિકા કરતાં નોંધ્યું છે તેમ નિબંધ એના સર્જકની આંતરસમૃદ્ધિ તથા ભાષાક્ષમતાની છલ્લી ભાવકને દેખાડે છે. જીવન તથા પ્રકૃતિ, પરિસરનું નિરીક્ષણ, ઈતિહાસ-ભૂગોળ માટેની તીવ્ર ચાહત, પોતાની વ્યક્તિપત્તાને ઘડનારાં ને રસરૂચિને પોષનારાં પરિબળો નિબંધને પણ સમૃદ્ધ કરે છે. સર્જક બીજાને જરા પણ વાગે નહિ એમ પોતાનું - હું-નું જગત ભાવકને ‘જનાન્તિકે’ લઈ જઈને, માંડીને તથા રસિક રીતે ને રસાળ શૈલીમાં કહે છે... ને એમાં બીજાની કે બીજી ભળતી વાતની જરા પણ ગંધ લેખકને ખુલ્લો પારી હે છે. આવા ખુલ્લા પડી જતા લેખકો વીતેલાં બે વર્ષમાં વધ્યા છે, બાકી થોડાક પણ ઉત્તમ નિબંધો લખનારા પણ સક્રિય તો છે જ..., છીછરી સપાટ કૃતક ગજલોએ કાળો કેર વર્તાવ્યો છે એમ એવા નિબંધોએ પણ ભાવકને હતાશ કર્યો છે.



## કવિતાની અતિવૃદ્ધિ : વર્ષ ૨૦૧૨-૧૩ની કવિતાનું સરવૈયું | સુધા ચૌહાણ

આ સરવૈયું એટલે માત્ર લેખા-જોખા અથવા તો માથાં ગણવાં એમ નહીં કારણ કે છેલ્લાં બે વર્ષોમાં સરેરાશ દર ત્રણ દિવસે એક કાવ્યસંગ્રહ પ્રગટ થયો છે. ત્યારે મને મળેલા અલ્ય સમયમાં ઉત્તમ થેલા કામને આપની સામે મૂકુંબું અને કાચા-પાકા કામ તરફ અંગુલીનિર્દેશ કરવો. ૧૫૦થી વધુ કાવ્યસંગ્રહોની સૂચિ મેં તૈયાર કરી છે. આંકડો આથી પણ વિશેષ હોવાનો. એમાં એંસી જેટલા કાવ્યસંગ્રહો મારી પાસે ઉપલબ્ધ છે. એમાં કમશઃ મહત્વના સંગ્રહો વિશે આપની સામે વાત રજૂ કરું છું.

આધુનિકોત્તર ગુજરાતી કવિતામાં જેમનું મહત્વનું યોગદાન છે એવા જ્યદેવ શુક્લ, કમલ વોરા, કાનજી પટેલ, રાજેન્દ્ર પટેલ, પવનકુમાર જૈવા કવિઓના અધીંદસ કવિતાના સંગ્રહો આ વર્ષ દરમિયાન મળે છે. પોતાના પ્રથમ કાવ્યસંગ્રહ ‘પ્રાથમ્ય’ પછી પચ્ચીસ વર્ષે જ્યદેવ શુક્લ ‘બીજેખેખા હલેસાં વિના તરતી રહે’ સંગ્રહ લઈને આવે છે. ત્યારે પ્રથમ સંગ્રહથી એક જુદી સૂર સંભળાય છે. કવિ અહીં ચિત્ર, સંગીત, ફિલ્મ જેવી અન્ય કળાના સંદર્ભોથી જુદા પડી કથનાત્મક-વર્ણનાત્મક રચનારીતિએ કાવ્યલેખન કરે છે. જેમાં ‘માગશરની અમાવસ્યા’, ‘૨૬ જુલાઈ, ૨૦૦૮’ જેવાં કાવ્યોમાં આસપાસના સામાજિક વાસ્તવને સંકુલ રીતિએ વ્યક્ત કર્યો છે. જેમ કે :

“હ્લાસ્ટમાં  
 વધેરાઈ ગયેલાં  
 ને  
 ઘવાયેલા  
 સ્કીન પર;  
 જગ્યી બાળકના  
 લોહિયાળ પગ પર  
 લીલી, ભૂખરી, કાળી માખીઓ  
 બાળબણો છે.  
 બાળબણતી માખીઓ  
 ઉડાડવા  
 મારો ઉદાસ હાથ  
 ફંઝનું મારે છે,  
 ને ભીત સાથે  
 અથડાય છે  
 ધડામ્યુ ”<sup>1</sup>

આ પ્રકારનું આવેખન ‘પ્રાથમ્ય’ના કવિતાનું એક મોટું સ્થિત્યંતર છે. આ સંગ્રહની જનાન્તિકે ગુચ્છની રચનાઓમાં પિતા-પુત્રની વર્ણની સંવેદના નાટ્યાત્મક રીતે આવેખાઈ છે. તો ‘પૃથ્વીકાલ્યો’નાં ત્રણ લઘુકાલ્યોમાં અરૂઢ રીતે રમતિયાળી રીતિએ કલ્યાનવિસ્તાર થયો છે. જુઓ :

“ગીખના  
 તોર્ણિંગ તરકામાં  
 પૃથ્વીનો  
 આ નાનકડો દાણો  
 ધાણીની જેમ  
 ફૂટે તો ”<sup>2</sup>

એ જ રીતે ‘અતનસૂક્ત’નાં લઘુકાલ્યોમાં પ્રગટ્ય છીતાં રુચિપૂર્ણ રીતે સંસ્કૃત પરંપરાને પુષ્ટ કરે છે. આમ સમગ્રપણે જોતાં આધુનિકોત્તર અછાંદસ કવિતાનું રચના અને ભાવગત વિશ્વ આ સંગ્રહમાં પ્રગટે છે. એ જ રીતે માત્ર અછાંદસમાં જ સર્જન કરતા કવિ કમલ વોરાનો ‘અનેક એક’ સંગ્રહ પણ આ સમયમાં પ્રગટ થયો છે. વિચાર કે વસ્તુ, પરિસ્થિતિની આસપાસ ફરતા શબ્દ કલાપો એ આ કવિની વિશેપત્તા છે. ‘પથર’, ‘સમુદ્ર’, ‘ખુરશીઓ’ જેવાં કાલ્યોમાં કવિસંવેદન સ્પર્શક્ષમ બને છે; જેમ કે :

“ખુરશી પર

એક પંખી આવી બેઢુ,  
જુરશીમાં  
ડાળો ફૂટી  
પાંદડાં કલબલ્યાં  
પુષ્પો પ્રગટ્યાં  
ફળ લચ્યાં;  
ખુરશીમાં ઝડ જાગ્યું  
મૂળિયા વિનાનું.”<sup>3</sup>

પણ આવાં સ્થાનો આ સંગ્રહમાં ઘણાં ઓછાં છે. કમલ વોરાની કવિતામાં શબ્દો અને રચનારીતિની જેટલી બારીકાઈ છે એટલું સંવેદન અનુભવાતું નથી.

આજાઈનાં આટલાં વર્ષો પછી પણ હાંસિયામાં રહેલાં સાહિત્યમાં તો હજુ પણ હાંસિયાનીય બહાર રહેલા આદિવાસી સમૂહની અવ્યક્ત વેદના-સંવેદનાઓ કાનજી પટેલના ‘જનપદ’, ‘દુંગરદેવ’ જેવા સંગ્રહમાં કાવ્યરૂપ પામી છે. એ જ સંગ્રહોની દિશામાં ત્રીજો કાવ્યસંગ્રહ ‘ધરતીના વચન’ આ સમયમાં પ્રગટ થયો છે. પણ એમાં અગાઉના સંગ્રહોમાં રહેલી અતિસંકુલતા કે કયારેક લાગતી દુર્ભોધતા નિસ્યંદિત થઈને આવી છે. આદિવાસી જનસમૂહની આસ્થા, આનંદ-ઉત્સાહ, વેદનાનાં વલવલતા રૂપો, ગીતો-કથાઓ, માન્યતાઓને આ સંગ્રહની રચનાઓમાં ઘાટ મળ્યો છે. ‘મારી ન ઊકલી’ કાવ્યમાં વિકાસની દોડમાં અનેક રહસ્યોને ઉકેલતા જઈને પાછળ શું વણાંકલ્યું રહ્યું એ ભાવ આ રીતે વ્યક્ત થયો છે.

‘અનંત અગાધમાં ઊતર્યા  
સૂર્યતારા - નક્ષત્ર - આકાશગંગાનાં નામધામ પાડ્યા  
વીજ્યાં ને ગાજ્યાં એ બધાં  
સરવરમાં સજાવ્યાં  
સૌ પાણી પારખ્યાં  
વાયુ વલોવ્યા  
અંગારવાયુનાં માખણ કીધાં  
ભરમ ખોલ્યા  
ભરમાંડ ગાયા  
કાળાં બાકોરાંનાં જનમ-મરણ વંચ્યાં  
એક રેળા મારી અને આકાશ એક હતાં  
ઉફ્ફા ગયેલા આકાશને ભજ્યું  
હવે આકાશને જ ગાઈ સંભળાવીએ :  
આકાશ બાપા

અમને

એક આ

ધરતીની શેર મારી ન ઉકલી.”<sup>૪</sup>

એ જ રીતે ‘લુણ મારું લોહી પીએ’માં કહેવાતા સત્ય સમજના આદિવાસી જનપદમાં પગપેસારાને કારણે આદિવાસીની અવદશાનો સંકેત મળે છે. સમયના અભાવે હું બીજાં ઉદાહરણ છોડું છું. પણ કાનજી પટેલનો આ સંગ્રહ ગુજરાતી કવિતાની એક નોખી મુદ્રા છે. અનુઆધ્યાનિક યુગમાં પ્રગટેલી ગ્રામ-દ્વિતી-નારી વરે ચેતનાઓમાં આદિવાસી ચેતના માત્ર કાનજી પટેલની કવિતામાં જ એના સર્વ વિશેષો સાથે પ્રગટ થઈ છે. કાનજી પટેલના આગળના સંગ્રહોની કવિતાને સમજવા માટે પણ આ સંગ્રહ એક બારી ખોલી આપે છે.

આ જ સમયમાં સાતત્યપૂર્વક લખતા રહેલા રાજેન્દ્ર પટેલના બે સંગ્રહો ‘કબૂતર, પતંગ અને દર્પણ’ તેમજ ‘એક શોધપર્વ’ ધ્યાનપાત્ર છે. ‘કબૂતર, પતંગ અને દર્પણ’માં એક જ વિષયની આસપાસ રહી અનેક વિચાર, અનુભવ, કલ્યાણ, સંવેદનથી કબૂતર, પતંગની વસ્તુલક્ષી કવિતા કરી છે. જેમાંથી કેટલીક રચનાઓ બાદ કરી શકાય એમ છે. જ્યારે બીજા સંગ્રહ ‘એક શોધપર્વ’ની ‘પૂર’ ગુરુઢમાં પુરાકલ્યાનોના વિનિયોગ દ્વારા એક વિરાટ અનુભવવિશ્વમાંથી અંગત સૂક્ષ્મઅણુ તરફની શોધ જણાય છે. એ જ રીતે ‘ભૂંકપ ઉર્ફ એક શોધ’, ‘વિસ્કોટ’ ગુરુઢનાં કાચ્યોમાં બહારની પરિસ્થિતિના સંદર્ભે અંદર ચાલતી ઊથલ-પાથલ, અવિરત શોધનું સાયુઝ રચાયું છે. અહીં ભીતર, ભૂમિ, પગલાં, પડછાયા, ડગ, પગ, તિરાડ, ભીનાશ, પરપોટો, વમળ, વન, જન, ભૂલ, મૂળ... એમ શોધનાં અનેક રૂપો છે. માટે જ શોધધાત્રા જ અહીં શોધપર્વ બની જાય છે. રાજેન્દ્ર પટેલની કવિતા અછાંદસ છે. પણ એમાં વારંવાર આવતા શબ્દાનુપ્રાસ-અંત્યાનુપ્રાસ કવિતામાં એક સૂક્ષ્મ લય રચે છે. ‘પેસ્ટ કન્ટ્રોલ’ કાચ્યોમાં ઉધર્થ સબળ પ્રતીક બનીને ઉપસે છે. આખા સંગ્રહમાં ભાવ એક જ રાખીને, પણ વિષય બદલતા જઈને એક જ ભાવને કારણે ઊભા થતા કંટાળાને કવિ ખાળી શક્યા છે. દરેક સંગ્રહમાં જુદી ભૂમિકાએ બ્યક્ત થવાની મથામણ રાજેન્દ્ર પટેલના આ સંગ્રહમાં છે.

આ જ સમય દરમિયાન હવે આપણી વર્ચ્યે નથી એવા બે કવિઓ પ્રબોધ ૨. જોશી તથા પવનકુમાર જૈનના ગુજરાતી અછાંદસ કવિતાના મહત્વના કાચ્યસંગ્રહો મળે છે. પ્રબોધ ૨. જોશીના “... પાછો ઉઘાડ નીકળ્યો આ”માં એકવીસમી સહીની ડિજિટલ કાન્તિના કારણે બદલાયેલી વ્યક્તિચેતના, વિશ્વબાજાર, મલ્ટીનેશનલ કોર્પોરેટ કંપનીના કર્મચારીઓનું સંવેદનજગત અપૂર્વ રીતે આવેખાયું છે. ‘એક લાંબી ફલાઈટમાં’, ‘ઓફિસ-કાચ્યો’ વીજાણુંયંત્રો. સાથે સતત. ચાલતું કામ, મિટિંગ્સ, પાર્ટીઓનું એક જુદું જગત આવેધે છે. તો ‘હોટલનો આ રૂમ ખાલી કરતાં’માં વ્યાપારના કારણે થતી વિશ્વભરની

મુસાફરીઓમાં સંવેદનશીલ વ્યક્તિના સંવેદનતંત્રનો ઝાજાઝાઈ છે. પોતાના પૂર્વજીના મૃત્યુના સ્મૃતિ-સાહય્યો સાથે સતત અનુભવાતી આત્મીયતા પણ આ સંગ્રહની એકાધિક રચનાઓમાં છે. અનેક સમયપાત્રો-સ્થિતિઓ સંદર્ભોના ટુકડાઓ દ્વારા રચાતું એક ચિરંજીવ કવિતા' આ સંગ્રહનું મહત્વનું કાબ્ય છે. આધુનિકતાના સમયથી લખતા રહેલા પવનકુમાર જૈનનો '૬૫ કાબ્યો' ગાંધીકાબ્યોનો અછાંદસ સંગ્રહ છે. સર્વરિયલ અનુભવો, રૂપકોનો વિનિયોગ, ચિત્રકળાનો અનુભવ આ બધાના કારણે એમનાં કાબ્યો વિષય અને રચનારીતિએ નોખા ભાત રચે છે. જેમ કે એમની 'ઓતારી' રચના જુઓ :

“એકી હું જન્મ્યો  
કહો, કેવો જન્મ્યો ?  
ગધાતી, સાંકડી તિરાડમાંથી  
એક અળસિયું બેળે બેળે  
બહાર આવે તેમ,  
ઉંઘે માથે  
નિર્વજા, નીપટ, નાગો;  
તીણું તીણું, હાસ્યાસ્યદ  
કલપતો;  
અબૂધ, મૂંગો;  
ભૂખ્યો, તરસ્યો,  
હાથ પગ વીંગી તરફડતો  
અવતર્યો.  
ત્યારે લોકોએ હરખપદ્મા  
થઈ પેડા ખાધા બોલો.””

બાળકનું એક સુરક્ષિત જગતમાંથી અસુરક્ષિત જગતમાં અવતરવું, એની સાથે જોડાયેલી માનસિક-શારીરિક યાતના, અને લોકોનું આનંદિત થઈ પેડા વહેચવું આ બન્ને સ્થિતિમાં રહેલા વિરોધાભાસમાંથી અસ્તિત્વજન્ય નિઃસારતા પ્રગટે છે. તેમજ પવનકુમાર જૈનના શાકબકાલુંવાળાં કાબ્યો પણ નોખાં છે.

આમ તો વિવેચક-સંપાદક રીતે તરીકે જાણીતા જ્યેશ ભોગાયતા પાસેથી એમનો પ્રથમ કાબ્યસંગ્રહ 'આપ ઓળખાની વાર્તા' મળે છે. આ સંગ્રહની પ્રથમ રચના 'હિંગોળગઠનો લેન્ડસ્કેપ'માં વિગત અને વર્તમાનની સાથે કવિસંવેદન પરિસ્કૃત થાય છે. આપણી અંદર ઘૂસી ગયેલા એક હિસ્ક પશુનો વિષાદ પણ આ સંગ્રહની મહત્વની રચના છે. આમ છીતાં આ સંગ્રહનું અછાંદસ કવિની પોતીકી મુદ્રા ઉપસાવતું નથી. અનેક અછાંદસ ગીત-ગઢલોના ઢગલાબંધ સંગ્રહોની વચ્ચે કાબ્યમર્જન રાજેશ

પંડ્યાનું ‘સુવર્જભૂગ’ દીર્ઘકાવ્ય નોખી મુદ્રા રચે છે. રામ-સીતા-મૃગના પુરાકલ્પન દ્વારા પદ-ભજનના ઢળમાં પ્રાસાનુપ્રાસની ઉચિત-સહજગતિએ આપણા સમયની ભોગલાવસા તરફની દોડ આ કાવ્યમાં વ્યક્ત થઈ છે. ‘પૃથ્વીને આ છેડે’- ના અછાંદસમાંથી આ પ્રકારના દીર્ઘકાવ્ય તરફનું રાજેશ પંડ્યાનું રૂપાંતર સુખદ પરિણામ રચે છે. શરૂઆતમાં જડપથી સોળ પંક્તિઓમાં રામ-સીતાના વનગમનને આવેખી પદીની પંક્તિઓમાં મૃગ અને એની પાછળની સીતાની આસક્તિ વ્યક્ત થાય છે. વર્ચ્યે આવતાં વર્ણનો : આ કાવ્યનું સબળ પાસું છે; જુઓ :

“વાડની વચાળ રૂડી મહૂલી રચાવી  
વાવ્યા અંગણામાં અમરા ને ઉમરા  
જૂઈ ને ચમેલી ચોપો મધ્ય મધ્ય થાય  
એની ગંધથી ખેંચાય વનભમરા”૬

તો ‘હરણ તો ભાળ્યું ન ભળાય હો રામૈયા રામ, હરણ જલાય નહીં હાથમાં’ કે ‘હરણને કેટલાય પગ હો રામૈયા રામ’માં રમેશ પારેખના ‘લાખા સરખી વાર્તા’ના સમરી સાથેના યુદ્ધ પ્રસંગના પડવા સંભળાય છે. આમ છતાં આજના ગીત-ગઝલના ધોંઘાટમાં એક કવિ નિરસ્તપૂર્વક કર્દીક નવું લખવાનો પડકર ઉપાડે એ ભવિષ્યની કવિતા તરફ આશા બાંધે છે. તો ઢગલાંધ રચાતાં ગીતોની વર્ચ્યે મનોહર નિવેદીનો ‘વેળા’ ગીતસંગ્રહ વિષય, ભાષા અને રચનાગત રીતે જુદો તરી આવે છે. સોરઠી તળપદ બાની, ગ્રામપરિવેશ-પાત્રો, આ સંગ્રહનાં ગીતોમાં નવું ભાવવિશ નિપણવે છે.

અહીં હવે આપણે થોડા સમય માટે ‘આહ અને વાહ’ના પ્રદેશમાં જઈએ. આ બે વર્ષના સમયગાળામાં ગજલમાં અતિવૃદ્ધિ થઈ છે. માત્ર ગજલના જ પચાસથી વધુ સંગ્રહો પ્રગટ થયા છે. જેમાં મહેન્દ્ર જોશીનો ‘ઈથરના સમુદ્ર’, કરસનદાસ લુહારનો ‘ધૂપિયું’, આશિત હૈદરાબાદીનો ‘મુખવતના શહેરમાં’ મહત્વના સંગ્રહો છે. ‘ઈથરના સમુદ્ર’ની ગજલો અસુધ ભાવ-સંવેદન, રચનારીતિના જુદા-જુદ્ધ આચામો, ભાષાવૈવિધ્યને કારણે સમકાલીન ગજલોમાં જુદી ભાત રચે છે. તો કરસનદાસ લુહારની ગજલોમાં વિષયનાવીન્ય, પ્રતિબદ્ધતા અને ગીતોમાં રચનારીતિના પ્રયોગો ધ્યાનપાત્ર છે; જેમ કે :

“અમુક આંજે તમુક આંજને એવું તે શું કીધું જુ ?  
વગર લખ્યે – લોહીમાં મળવું કર્યાં – વંચાવી દીધું જુ !”૭

આ ત્રણ કવિઓની સાથે અન્ય નીવડેલા ગજલકારોમાં ભરત વિંઝુડાનો ‘આવવું અથવા જવું’ અશરફ ડબાવાવાનો ‘વાણિપત’, લલિત નિવેદીનો ‘બીજી બાજુ હજુ મે જોઈ નથી’, હર્ષ બ્રહ્મભણનો ‘જાકળ ને તડકાની વર્ચ્યે’, એસ. એસ. રાહીનો ‘ઘરોબો’, જલન માતરીનો ‘તપિશ’, શિવજી રૂખડાનો ‘એના ઘર ભણી’, મકરંદ મુસળેનો ‘માણસ

તોયે મળવા જેવો'; ખલીલ ઘનતેજવીનો 'સોગાઈ' સંગ્રહો મળે છે. આ સંગ્રહોની ઘણી ગજલો કૃતિ લેખે નખશિખ સુંદર છે. આમ છતાં ગજલ-સ્વરૂપનો કે કવિની પોતીકી યાત્રાનો કોઈ મહત્વનો વળ-વળાંક કે પડાવ એમાં નથી. તો એ પદીની પેઢીના નવોદિતો, પણ હેતે તો સ્થાપિત ગજલકારો અશોક ચાવડા 'બેદિલ'નો 'પગરવ તળાવમાં', અનિલ ચાવડાનો 'સવાર લઈને'; દિનેશ કાનાણીનો 'એક કપ કોઝી અને', કુમાર જૈમિનિ શાસ્ત્રીનો 'તમારા નામનો સિક્કો'; પ્રશાવ પંડ્યાનો 'કવિતાથી વધુ કંઈ નહીં', કિરીટ ગોસ્વામીનો 'સાવ સૂની પળ' મહત્વના સંગ્રહો છે. અનિલ ચાવડાની ઘણી ગજલોમાં વિષયની તાજળી છે; જેમ કે :

“થાસને ઈસ્ત્રી કરી મેં સાચવી રાખ્યા હતા,  
ક્યાંક અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો !”

આ ઉપરાંત અશોક ચાવડા 'બેદિલ'ની ગજલોમાં જાત સાથેનો સંવાદ, જીવનના સંઘર્ષો, ભૂતકાલીન પીડાઓ સતત કવિ મનને ઝંગોળ્યા કરે છે. આ જ કવિનો 'ડાળખીથી સાવ છૂટાં' વિષયને કારણો નોખો તરી આવે છે. દિવિતકવિતાની એક વિશિષ્ટ મુદ્રા આ સંગ્રહમાં છે. કહેવાતા સવર્ણ સમાજ સામેનો આકોશ આ દિવિત કવિતામાં ઠરીને સમભાવની ભૂમિકાએ વ્યક્ત છાય છે. વળી નગરજીવનના જાતિગત અનુભવો ગજલનું રૂપ ધરે છે.

“ગલી, શેરી, મહોલ્લો ને કબરની બહાર રાખ્યો છે;  
મને બહુ કાળજીપૂર્વક નગરની બહાર રાખ્યો છે.  
નજરમાં કેમ આવું હું કે મારી વેદના આવે,  
સદીઓની સદીથી બસ્ત નજરની બહાર રાખ્યો છે.  
જમાનાની નવી આબોહવાને માન આપીને,  
મને સાથે જ રાખીને સફરની બહાર રાખ્યો છે.”

આ પ્રકારની સંવેદના આ સંગ્રહની એકાધિક રચનાઓમાં છે. આ નવોદિતો પાસે પ્રતિભાની કંભી નથી પણ માત્ર એકધારી રીતે ગજલ લખ્યા કરવાથી ભાષા કે સ્વરૂપ સાથેના મોટા પડકારો જીલવાથી અહિત તો અંતે કવિ અને કવિતાનું જ થવાનું છે. ચિંતા એ જ વાતની છે કે જેમનામાં અપાર કવિત્વશક્તિ રહેલી છે એવા આ નવોદિત કવિઓ બહુધા ગજલ અને ગીતમાં ઠિતિ અલમ્બુ સમજે છે. આપણી ઉત્તમ કાવ્યપરંપરાઓને આત્મસાત્ કરવું આ લોકોને હજુ બાકી છે. માટે એ સિવાયનાં સ્વરૂપોમાં હવેની પેઢી કશુંક નોખું કરે એવું આ બે વર્ધની કવિતાને જોતાં લાગતું નથી. ફેસબુક - વોટ્સએપના આ યુગમાં સદ્ગુર્યાયન સાધતા આ સ્વરૂપમાં વાહ વાહ મળે છે. લપસણી ભૂમિ છે. એમાં વળી ચિનુ મોદી, અંકિત નિવેદી કે રાજેશ વ્યાસ 'મિસ્કીન'ની પ્રસ્તાવનાઓ ઢાળ આપી દે છે. જે જેને-

તેને બસ મોટા કવિ હોવાનું પ્રમાણપત્ર સિક્કો મારીને આપી હે છે.

હવે થોડી વાત આ જે વર્ષ દરમિયાન ‘ઇમેજ પલ્ટિકેશન’ દ્વારા પ્રગટ થયેલા અધધ અગિયાર વત્તા અગિયાર એમ કુલ બાવીસ સંગ્રહોની. જેમાં નિર્ણન ભગતનો ‘૮૬ મે’, સુરેશ દલાલનો ‘બે સ્ટેશનની વર્ચ્યે’, પન્ના નાયકનો ‘ટેઝોડિલ્સ’, લાભશંકર ઠાકરનો ‘ઈન અને આઉટ’, ચંદ્રકાન્ત શેઠનો ‘ચિદાકાશનાં ચાંદરણાં’, ચિનુ મોટીનો ‘ગતિભાસ’, અનિલ જોશીનો ‘પાણીમાં ગાંઠ પડી જોઈ’, રાજેન્દ્ર શુક્લનો ‘સેંજળ’, માધવ રામાનુજનો ‘અનહદનું એકાંત’, જવાહર બક્ષીનો ‘પરપોયના ડિલ્લા’ અને હેમન શાહનો ‘આજે ઉક્તયા અક્ષર જો’ પ્રથમ ગુચ્છમાં પ્રગટ થયા છે. ઇમેજ જેવા જાણીતા પ્રકાશનના સુંદર મુખપૃષ્ઠ, સરસ કાગળ અને લે-આઉટ જોઈ આજો સેટ ખરીદવાની ઈચ્છા કોઈ પણ ગ્રાહકની જેમ મને પણ થઈ, ને ખરીદ્યા બાદ પસ્તાવો પણ થયો. સારા પેકેટમાં ખરાબ વસ્તુ કેવી રીતે પકડાવવી એ આ સંગ્રહો જોતાં શીખી શકાય છે. આ કવિઓ નીવડેલા હોવાથી ક્યાંક-ક્યાંક કવિતાના ચ્યમકારા દેખાય છે. પણ એકંદરે તો દરેક કવિએ પોતાનું જ અનુકરણ અને એકસપ્લોયિટેશન કર્યું છે. શ્રી નિર્ણન ભગત એમના એક કાવ્યમાં લખે છે :

‘ઉમાશંકર હત્તા ત્યારે એમજો વારે વારે  
મને પૂછ્યું હતું ‘કઈ લખ્યું છે ? લખાશો ? તો કખારે ?’  
‘ના’ એટલું જ માત્ર મેં એમને કહ્યું હતું,  
નીસ વર્ષ અમે એ ‘ના’નું ફુંખ સહ્યું હતું,  
આજે તેઓ હોત... એમને મેં હોંસે હોંસે કહ્યું હોત,  
‘જુઓ, લખાયું છે, ત્યો આ રહ્યું ! એમજો  
કેટલા સુખી ગર્હયું હોત !’<sup>10</sup>

આ સંગ્રહનાં કાચ્યો જોઈ એમ થાય કે ઉમાશંકરે કહ્યું હોત – કવિ આના કરતા મૌન જ રહ્યા હોતો સારું થાત ! અહીં મને યાદ છે કે નિર્ણન ભગત આપણા મૂર્ધન્ય કવિ છે અને ગુજરાતી કવિતાને એક મોટો વળાંક એમજો આપ્યો છે.

આપણી કવિતા જો થોડી પણ ચમત્કૃતિ, વિચાર કે સંવેદન ભાવક સુધી ન પહોંચાડતી હોય તો આપણા સંગ્રહને કારણો કપાતાં હાજરો વૃક્ષોને માટે પણ ન લખવું સારું એ આ સંગ્રહોના અને આ વર્ષના બીજા અસંખ્ય કવિઓએ- પ્રકાશકોએ વિચારવું જોઈએ.

એ જ રીતે એકસાથે અગિયાર કવિયત્રીઓના સંગ્રહોનો એક ગુચ્છ પણ ઇમેજ દ્વારા પ્રગટ થાય છે. જેમાં ‘શ્યામ પંખી અવ આવ...’ (ઉષા ઉપાધ્યાય), ‘કંદમૂળ’ (મનીષા જોખી), ‘જન્મારો’ (એષા દાદાવાળા), ‘અદીઠ અક્ષર’ (નયના જાની), ‘અઢી વત્તા ત્રણ’ (માલા કાપડિયા) વગેરે સંગ્રહોને બાદ કરતાં ઉપરોક્ત વિધાન લાગુ પડે છે. નારીહંદયની

કોમળ લાગણીઓ, અલગ અસ્તિત્વનો અહેસાસ ગીત-ગંગલ-અછાંદસ રચનાઓ દ્વારા ઉપરોક્ત કવયિત્રીઓના સંગ્રહોમાં પ્રગટ્યો છે. ઉષા ઉપાધ્યાયના ‘શ્વામ પંખી અવ આવ’માં...

‘મઘમઘતા મોગરાની વેણી સજીને  
ત્યાં તો જાગ્યું આ કેવું તે પૂર !’<sup>11</sup>

અથવા

કેમ ઉત્તર કોઈ સાંપડતો નથી એ પ્રશ્ન છે,  
ઘાવ જૂનો છે છતાં નડતો નથી એ પ્રશ્ન છે.<sup>12</sup>

આપણો એ જોઈ શકીએ છીએ. એખા દાદાવાળા અને મનીખા જોખીના સંગ્રહોમાં નારીચેતના વધુ પ્રભાવક અને પ્રબળ રૂપે વ્યક્ત થઈ છે. એખા દાદાવાળાનાં ‘કવિતા : બ્રેસ્ટ કેન્સરની’, ‘વાસ’, ‘વાસ્તવિકતા’ જેવાં અનેક કાવ્યો નારીહંદયનાં પડળોમાં લઈ જાય છે. ‘વાસ’ કવિતામાં તેઓ લખે છે :

‘કબાટના એક ખૂણ્ણામાં  
સચ્યવાઈને પડેલા પાનેતરની  
વર્ષો પહેલાંની બંધ ઘડીઓ ઉઘાડી  
અને  
એક વિચિત્ર વાસ નાકને ઘેરી વળી  
આપણાં જિવાઈ ગયેલાં  
લગ્નનાં વર્ષોમાંથી  
હવે તને આવે છે  
એવી જ  
વાસ હતી એ કદાચ.’<sup>13</sup>

તો મનીખા જોખીના ‘કંદમૂળ’માં શરૂઆતના સંગ્રહોમાં રહેલી પુરુષ-પ્રિયજન દ્વેષીતા, રતિ ઊંઘનાનો ઉન્માદ દરીને આદિમ એકલતા, પ્રાણી-પક્ષી જગતના સંકેતોથી વ્યક્ત થાય છે. પુરુષદ્વેષ હવે પોતીકી પીડાનું રૂપ લઈને પ્રગટે છે. એ રીતે મનીખા જોખીની કવિતા નારીસંવેદનાની કવિતામાં વિશિષ્ટ અર્ધણ છે. આ સંગ્રહો સાથે જ પ્રગટ થયેલા ધીરુબહેન પટેલના, ‘ધોળ અને છાલક’ જ્યા મહેતાનો ‘નાદ નિરંતર જગવ્યા કરે’, પન્ના નાયકનો ‘અંતિમે’ નીતા રામૈયાનો ‘જાસૂદનાં ફૂલ’, નલિની માડગાંવકરનો ‘એક સહિયારો કપ’, મનોજા દેસાઈનો ‘ધાબ ભરીને’ સંગ્રહો પ્રગટ થતાં એમના કારણો કપાયેલાં વૃક્ષોનું બલિદાન પણ સાર્થક કરતાં નથી.

આગળ વાત કરીએ તો સંગ્રહો ઉપરાંત જેની વિગતે વાત થઈ શકે એવા સંગ્રહોમાં વિનોદ ગાંધીનો ‘ફ્લેટ બંધ છે’, ડૉ. મનોજ જોશી ‘મન’નો ‘ભીતરના અવાજો’, અશોક

ચાવડા ‘બેદિલ’નો ‘તું કહું કે તમે ?’, છાયા ત્રિવેદીનો ‘ટેરે પરપોયા’, દેવજી થાનકીનો ‘કલમ તારા સથવારે’, ગુલામ અભિસાનો ‘અવિશ્રાંત’, શૈલેષ પંડ્યા ‘ભીનાશ’નો ‘નિખાલસ’, વિરંચિ ત્રિવેદીનો ‘આંસુનો તરજુમો’ વગેરે નોંધપાત્ર સંગ્રહો છે.

આમ સમગ્રપણે આ બે વર્ષની કવિતામાંથી પસાર થતાં અનુઆધુનિક કવિતાના મહત્વના કવિઓ જ્યાદેવ શુક્લ, કમલ વોરા, રાજેન્દ્ર પટેલ, કાનજી પટેલ, પવનકુમાર જૈન, પ્રબોધ ર. જોશી, મનોહર ત્રિવેદી, રાજેશ પંડ્યા, મનિષા જોશીએ પોતાના સંગ્રહોમાં પોતાના પુરોગામી સંગ્રહોને અતિકળી નોખા પાડવાની મથામણો કરી છે. એ આ બે વર્ષની કવિતાનું જમા પાસું છે. આ ઉપરાંત અનિલ ચાવડા, અશોક ચાવડા, મહેન્દ્ર જોશી, કરસનદાસ લુહાર, આશિત હેદરાબાદી, ભરત વિંજુડાના ગજલસંગ્રહોથી આશા બંધાય છે. આમ છતાં વિષય, ભાષા કે સ્વરૂપને નાણવાના કોઈ પડકારો આ કવિતાઓમાં દેખાતા નથી. સમકાળીન કવિતા વિશે બોલવું એ હંમેશાં અધ્યરું હોય છે. પણ જમા-ઉધાર બતાવવું એ સરવૈયાકારનું કર્તવ્ય છે. કવિતાની ફુર્દ્દશા પાછળ આપણું વિવેચન એટલું જ જવાબદાર છે. આ બે વર્ષમાં પ્રગટ થયેલા અનેક કાવ્યસંગ્રહો વિશે ચંદ્રકાન્ત યોપીવાળાએ ઉમળકાથી પણ ધોરણો જાળવીને સંયત વિવેચન કર્યું છે. પણ એ સ્થિવાય માત્ર રંગદર્શિ પ્રસ્તાવનાઓમાં પ્રશાસનાં ફૂલો જ દેરાયેલાં છે. મેથ્યુ આર્નોલ્ડ તો ‘કવિતાને જીવનની સમીક્ષા કહી છે. અને એમ પણ કહ્યું છે કે વિવેચન ઉત્તમ સર્જનની આબોહવા રચે છે.’ દુભૂંયે આપણા સમયમાં વિવેચનના પ્રદૂષિત વાતાવરણને કારણે કવિતાની અતિવૃષ્ટિ થયા કરે છે.

### સંદર્ભસ્થૂચિ

૧. ‘બીજરેખા હવેસાં વિના તરતી રહે’, પૃ. ૧૦
૨. એજન, પૃ. ૬૭
૩. ‘અનેક એક’ પૃ. ૧૩૬
૪. ‘ધરતીનાં વચન’ પૃ. ૪
૫. ‘૬૫ કાલ્યો’ પૃ. ૧૫
૬. ‘ભૂવર્ષમૃગ’ પૃ. ૨
૭. ‘ધૂશિયું’ પૃ. ૫૩
૮. ‘સવાર લઈને’ પૃ. ૫
૯. ‘ડાળખીથી સાવ છૂટા’ પૃ. ૨
૧૦. ‘૮૬ મે’ પૃ. ૨૮
૧૧. ‘શ્યામ પંખી અવ આવ’ પૃ. ૧૩
૧૨. ‘શ્યામ પંખી અવ આવ’ પૃ. ૪૫
૧૩. ‘જન્મારો’ પૃ. ૪૮

# સમીક્ષા/ગ્રંથાવલોકન

## સ્વીકૃત સંવેદનાનો માપદંડ | ડૉ. પણા ત્રિવેદી

[વિભાજનની વાર્તાઓ : અનુ. શરીરકા વીજળીવાળા, ગ્રી. આ. : ૨૦૧૪, પ્રકાશક : ગુજરાત ગ્રંથરત્ન કાર્યાલય, પૃ. ૩૦+૨૧૦, મૂલ્ય રૂપિયા ૨૩૦/-]

ગુજરાતી સાહિત્યના વિવેચક તથા અનુવાદક તરીકે શરીરકા વીજળીવાળાનું નામ અજાહયું નથી. ગુ. સાહિત્ય અકાદમી તથા ગુ. સાહિત્ય પરિષદ દ્વારા તેમનાં પુસ્તકો પુરસ્કૃત થયાં છે. માત્ર ગુજરાતી જ નહીં પણ અન્ય ભારતીય ભાષાઓના લેખન વિશે અવગત રહેનારાં શરીરકાબહેનના રસનો વિષય વિશેષ રૂપે કથાસાહિત્ય રહ્યો છે. તેમજે વિદેશી વાર્તાઓના ગુજરાતી અનુવાદોની સાથે ઇન્ટિઝર હુસૈનની વાર્તાઓ, મંઠોની વાર્તાઓ તેમજ અસગર વજાહતના ઉર્દૂ નાટક ‘જેણે લાહોર જોયું નથી’ના અનુવાદો આપ્યા છે. ‘વિભાજનની વાર્તાઓ’ જેવા સરળ શીર્ષક હેઠળ તેઓ ભારતવિભાજન સમય સંદર્ભે લિલાયેલી ગહન સંવેદનાઓ આપણી સમક્ષ લઈ આવે છે. આ પુસ્તકની થયેલ ત્રીજી આવૃત્તિ સ્વીકૃત સંવેદનાનો માપદંડ બની રહે છે. ભારતવિભાજન વિષય સંદર્ભે ચિંતનમાંથી જન્મતા અનેક પ્રશ્નો તેમને ઊંડો અભ્યાસ કરવા અર્થે પ્રેરે છે. ઇતિહાસ પાસે ગયેલ અનુવાદક પ્રસ્તુત સાંપ્રદાયિક વિભાજનની પછીતે રહેલ સંકુલ પરિબળો તપાસે છે અને જે પરિણામ તરફ આવે છે તે છે પ્રજાકીય સંવેદનાની તપાસ ! જગતનો કોઈ પણ ઇતિહાસ હકીકતની નજીક લઈ જઈ શકે છે પણ નક્કર હકીકતોનો માનસિક આદેખ આખરે તો પ્રજાએ વેઠેલ-અનુભવેલ સંવેદનાઓ થકી જ પ્રાપ્ત થતો હોય છે, જે વિભિન્ન કણાઓની અભિવ્યક્તિ થકી સાંપદે છે. આ પુસ્તક નિમિત્તે ગુજરાતી વાચકોને વિભાજન સમયે ભિન્ન ભિન્ન પ્રદેશની પ્રજાએ વેઠેલ પીડાદાયક અનુભૂતિની એક દસ્તાવેજ તાસીર સાંપડે છે. તેઓ લખે છે : બધા ધર્મ સ્નેહ, સહિષ્ણુતા અને અહિંસા જ પ્રબોધતા હોવા છીતાં કેમ આપણા બધાંની શાંતિ છીનવી લેવાનું કામ હુંમેશથી ધર્મ જ કરતો આવ્યો છે ? કેમ આ દેશમાં ગાંધીજીની હાજરીમાં પણ આ વરંવો જેલ બંધ ન થયો ? કેમ હુંમેશાં ગાંડપણનો જવાબ ગાંડપણથી, પશુતાનો જવાબ પશુ બનીને જ અપાતો આવ્યો છે ? કેટલાં બધા ‘કેમ’ હતાં ... આ બધી કારમી ઘટનાઓ, દબાયેલું પ્રજામાનસ, મૂલ્યોની ઊલટફેર અને વારંવાર બડકી ઊઠતી સાંપ્રદાયિકતા વિભાજનની જ તો પશ્ચિમતિ છે. આ સંકુલ ઘટના પાછણ જવાબદાર અતિ સંકુલ પરિબળો સમજવા માટે પ્રજાકીય સંવેદના તપાસવી પડે.

અનુવાદક માતૃભાષા સિવાય હિન્દી, ઉર્ડૂ તથા અંગ્રેજી જેવી અન્ય ભાષાઓ પર પણ સારી પકડ ધરાવે છે તેને કારણે અનુવાદિત વાર્તાઓમાં વધુ સહજતા પમાય છે. અહીં સમાવિષ્ટ થયેલ કુલ ૨૪ વાર્તાઓમાં બીજી આવૃત્તિની ત્રણ વાર્તાઓ બાદ કરી

ઇન્દ્રિયાર હુસૈનની નવી વાર્તાના ઉમેરણ સાથે આ પુસ્તક પ્રકાશિત થાય છે. ઉદ્ઘૂર હિન્દી, સિંગ્હિ અને ખાસ તો તેમજે મૂળ ભાષામાંથી જ અનુવાદ કરવાનું જે વલણ દાખલ્યું છે તે પ્રશંસનીય છે. વિભાજનને વિષય બનાવનાર કથાસાહિત્યને તેઓ ત્રણ વર્ગોમાં વહેંચે છે, જ્યારે વિભાજનને વિષય બનાવતી વાર્તાઓને હસ વર્ગોમાં વર્ગીકૃત કરે છે. ખાસ તો અનુવાહિત કરેલ પ્રત્યેક વાર્તા પછી અપાયેલ સર્જક ઓળખ અને વાર્તાની આધી સમીક્ષા ભાવકને મૂળ વાર્તા તરફ કે પ્રસ્તુત વિષય તરફ જવા ચોક્કસપણે વિવશ કરશે. ભારતદેશના ભાગલાની આ માનવસર્જિત ટ્રેજરી માનવીય જીવનમૂલ્યોમાં જે રીતે અને જે રૂપે ધરખમ પરિવર્તન લાવે છે તે સ્પર્શનીય છે. એક જ ઘટના વિભિન્ન માનવજીવનને કેવી રીતે પ્રભાવિત કરે છે, તેનાં રૂપો અત્યંત હંદ્યદાવક અનુભવાય છે. આહી વિભાજનને નકારી બંને દેશની સરહદ વચ્ચે આવેલ જમીનના ટુકડા પર મરતો મંટોનો ટેબા ટેકસિંહ છે, વિભાજન સમયે બળાત્કારનો અમાનુષી અત્યાચાર જે છોકરીઓ તથા સ્ત્રીઓએ ભોગવ્યો છે તેની માનસિક પ્રતારણાની ચરમસીમા દશર્વંહતી વાર્તા ‘ઓલ દો’ છે, જે શબ્દનો એક જ અર્થ સમજતી નાયિકા સત્બધ કરી મૂકે છે. જે ભાષા અને સંસ્કૃતિની માવજત તથા ઉછેર કરવામાં હિંદુ-મુસ્લિમ બંને દેશના સર્જકોનો ઝણો હતો તેવા મુસ્લિમ પરંપરાના વારસને કે હિંદુ રાજ્યવાદને નકારતી ઠંબે ઠંન્શાની લઘુકથા છે. મહીપણિંહની ‘પાણી અને પુલ’ તથા વિષ્ણુ પ્રભાકરજા વાર્તા ‘મારું વતન’માં નાયકનો વતન માટેનો અદભ્ય પ્રેમ પ્રગટ્યો છે. ઊઝડી ગયેલ મૂળિયાં વચ્ચે પરત ફરવાની તત્પરતા તથા તડપ ‘મારું વતન’ વાર્તાની વિધવા માર્માં જોઈ શકાય. એક સમયે ગામના જે લોકો ભાગલાના ખરાખરીના ટાંકણો આ પરિવારોને હાંકી કાઢવા તત્પર હતા એ જ લોકો વતનમાં પાછા ફરવા માટે ભીની આંખે અવિરત વિનંતી કરે છે. સમયની બલિખારીનું આ વાસ્તવ પણ અનોખું જ છે ને ! આ જ લેખકની અન્ય એક વાર્તા ‘હું જીવતો રહીશ’માં લાહોરથી ભાગતી વેળાએ બાળક સાથે બેબાન અવસ્થામાં મળેલ સ્ત્રીનો સ્વીકાર કરી તેની પરતે અપાર પ્રેમ ધરાવતો હોવા છતાં પત્તિને સૌંપી દઈ તેના સુખમાં રાજ્ઞો અનુભવતો દેખાય છે. ક્યારેક અપહત સ્ત્રીઓના અસ્તીકારના હચમચાવતા વાસ્તવની સામે આવું સવાયું કથાવાસ્તવ હંદ્યગમ્ય બને છે. ખુલ્લી આંખ સામેનો વર્તમાન હોય કે અતીત હોય, જગતના ઈતિહાસમાં નોંધાયું છે કે યુદ્ધ ગમે તે પ્રકારનું હોય, બદલો લેવા સાધનપૂર્તિ માટે પુરુષની પસંદગી હંમેશાં નિહંથી સ્ત્રી પર ઊતરી છે. મંટોની ‘ઓલી નાંખ’ વાર્તામાં સતત બળાત્કારનો ભોગ બનતી સક્રીનાના નિર્જવ હાથ દાક્તરના ‘બારી ઓલી નાંખ’ શબ્દ સાંભળતા જ સલવાર સરકાવી દે છે. રાજેન્ડ્રસિંહ બેદીની ‘વાજવંતી’માં વિભાજન સમયે છૂટી પડી ગયેલી પોતાની પત્ની પર પૂર્વે કરેલા ત્રાસને યાદ કરતો પતિ પણ જીતાપ રૂપે અપહત સ્ત્રીઓ માટે ‘દિવમાં વસાવો’નું આંદોલન તો ચલાવે છે પણ જ્યારે પોતાની પત્ની પાછી ફરે

છે ત્યારે તેને દેવીનો દરજાઓ આપે છે પણ એક નઠાંડું સત્ય એ પણ ઉજાગર થાય છે કે તે દિવલીથી તેને સ્વીકારી શકતો નથી. એક તરફ નારી તું નારાયણી કહી જે સમાજમાં સ્ત્રીરૂપની પૂજા થાય છે તે જ સમાજ સ્ત્રીને કેવળ દેહની પવિત્રતાને આવા છીછા માપદંડ વડે મૂલુવે ! આવા ખોખલા દંબને ઉજાગર કરતી અશેયની ‘રમન્તે તત્ત્વ દેવતા’ જેવા જેવી છે. હમીદની ઉર્દૂ વાર્તા ‘પતર અનારાં દે’માં મારનાર કોઈ એક કોમનો કે જાતનો નહીં પણ ‘માણસ’ છે, રેખાની બંને તરફ આગ અને ઝૂલ ઉભય છે તે સાર્વત્રિક સત્ય કળાની શરતે રજૂ થયેલ છે. કોઈ પણ સ્થળ અત્યાચારના ચિત્રણથી નોખી પડતી મોહન રાકેશની ‘કલેમ’ વાર્તા સૂક્ષ્મ મનઃસંચલનો સંદર્ભ વાંચવા જેવી છે. જેમાં માણસનો ઘર, સંપત્તિ કે જમીન માટે કોઈ દાવો નથી પણ ભાડાના ઘરમાં વસતા માણસને પોતાના જે ફળિયાના આંબા માટે કે પત્ની સાથે જોયેલ મધુર સપના માટે કયું કલેમ ફોર્મ મળવાનું હતું ? તે પ્રશ્ન તો પ્રશ્નાર્થ જ બની રહી જાય છે. અહીં વિભાજનથી લાગેલ વેરવેરની આગ છે, તો ક્યાંક પોતાના પ્રાણની આઢૂતિ આપી માનવતાને બચાવી-ટકાવી રાખનાર મનુષ્યો પણ છે.

અત્યંત સરળ તથા ભાવવાહી શૈલીમાં અનુવાદિત થયેલ આ વાર્તાઓ છેવટે તો ગુજરાતી વાચકો માટે સમૃદ્ધ જ બની રહે છે. અલબત્ત ક્યાંક એવો પ્રશ્ન પણ થાય છે કે પ્રસ્તાવનામાં કૃષ્ણ ચંદ્રની વાર્તા માટે જ્યારે અનુવાદક પોતે જ કહે છે : ... ઘણી વાર્તાઓમાં સ્ત્રીની યાતનાઓની વાત માત્ર સપાટ વિધાનો રૂપે, કિસ્સા સ્તરે રજૂ થઈ છે. દા. ત., ‘પેશાવર એક્સપ્રેસ’ ત્યારે થાય કે પોતાના વાર્તાંકળાના ધોરણે ઊણી ઉત્તરતી વાર્તા સમાવિષ્ટ શા માટે ? આમ છતાં નોંધવું રહ્યું કે આ વાર્તાઓ પ્રજાકીય સંવેદનાના અનેરા વિશ્વમાં લઈ જાય છે. હવે પછીના સમયમાં જે-તે ભાષાના કોઈ એક-બે સર્જકોની વાર્તાઓથી વધુ આ બળવત્તર વિષય સંદર્ભ જે-તે ભાષાની અન્ય સંશક્ત કલમનો લાભ પણ અનુવાદક આપણને સાંપડશે તેવી અપેક્ષા રાખવી અનુચિત નહીં લેખાય.



## રતિલાલ બોરીસાગરનું ‘ભર્દંભર્દ’ અમર છે ! | અશોક દવે

[ભર્દંભર્દ અમર છે ! : રતિલાલ બોરીસાગર, પહેલી આ. : ૨૦૧૫, પ્રકાશક : ગુજરાત ગ્રંથરલન કાર્યાલય, પૃ. ૧૬+૧૫૨, મૂલ્ય રૂપિયા ૧૩૦/-]

રતિલાલ બોરીસાગરનું ‘હોવું’, એ કેવળ ગુજરાતી હાસ્યસાહિત્ય માટે જ નહિ, સમગ્ર ગુજરાતી સાહિત્ય માટે પણ ‘ભર્દંભર્દ’ને જાળવી રાખવા જેવી અમર ઘટના કહેવાશે. આપણે નહિ જાળવીએ, તો આવનારી સાહિત્યિક પેઢી જાળવશે, એવું કાઢું એમના હાસ્ય સાહિત્યે કાઢવું છે. એક આદર્શ પિતાની જેમ, એમણે એમના સર્જનોની

સંખ્યા મર્યાદિત રાખી છે, છતાં (અથવા એટલે જ) એમણે જેટલું લખ્યું છે, એ સધણું સાહિત્યના 'થઈમ-કેપ્સ્યુલ' માં સારી જ્યાએ મુકાય અનું મૂલ્યવાન બન્યું છે. ચિંતા આવનારી પેઢીના ગુજરાતી પ્રેમની કરીએ તોપણ, બોરીસાગરનાં સર્જનો સાહિત્યચિત્કો માટે ભય ઉત્પન્ન કરે એવાં 'વન મેચ વન્ડર' જીવાંનાં નથી. 'ભદ્રભદ્ર'ની જેમ બોરીસાગરનાં સર્જનો પણ - છેવટે અનુવાદિત થઈને પણ આવનારી પેઢી સુધી જીવંત રહેશે, જેમ સ્વ. રમણભાઈ 'નીલકંઠ' નહિ, 'ભદ્રભદ્ર' શિરેજીવ રહ્યા છે.

આધારભૂત માહિતી તો નથી, પણ 'ભદ્રભદ્ર'નું મૂળ પાત્ર તત્ત્વમયના એક વિદ્બાન સાક્ષરની ઠણી કરવા માટે શ્રી રમણભાઈ 'નીલકંઠ' ઊભું કર્યું હતું, તેમ કહેવાય છે. તે સત્ય હોય તોપણ એનો કટાક્ષ સ્થૂળ અથવા અંગત રાગદ્વેષવાળો નહોતો જણાયો. એક સર્જનની દસ્તિ જ તે આજે પણ જોવાય છે. બોરીસાગરસાહેબ તો સ્વભાવગત, એમના ખબે ચઢેલા મંકોડાનેય ઉતારી પાડે એવા નથી, એટલે મૂળ 'ભદ્રભદ્ર'ના જન્મને તો દેખતી રીતે જ આ પુસ્તકને કોઈ લેવાઢેવા નથી. બોરીસાગરનું આ નવું સર્જન 'ભદ્રભદ્ર અમર છે' વાંચતાં પહેલાં 'નીલકંઠ'ની મૂળ કૃતિનું સંક્ષિપ્ત સંસ્કરણ પણ હું વાંચી ગયો. (સંક્ષિપ્તિકરણ : ડૉ. બિપીન જી. જવેરી, વોરા ઓન્ડ કંપની, મુંબઈ-૧૮૬૮) હવે... સ્વભાવગત, બોરીસાગર તો એમના મકાન-માલિકને નુકસાન પહોંચાડે એવા નથી, ત્યાં મકાનને ખંડહર બનાવવાનું તો એમના જન્માકારમાંય ન આવ્યું હોય. મૂળ કૃતિને રતિભાઈએ કીડીના ચટકા જેટલુંય નુકસાન પહોંચાડ્યા વિના 'રતિયન' બ્રાન્ડનું હાસ્ય ઉમેરીને 'ભદ્રભદ્ર'ને નવસંસ્કરિત કર્યા છે. માધવબાગની મારામારી કે બિભારીઓનું સરઘસ કે હરજીવનનાં પાત્રો જેવી થોડીધાણી ઘટનાઓ કે પાત્રો એમણે પોતાની કૃતિમાં આવકાર્યાં નથી, છતાં પણ મુંબઈને બદલે અમદાવાદને પાર્શ્વભૂમિ બનાવી એમણે પોતાના પુસ્તકને 'રિવરફન્ટ-ટ્યા' આપ્યો છે અને છતાંય, પુસ્તકની ભાષા આજકાલના 'વોટ્સઑપ' કલચરની નહિ, પણ સંપૂર્ણ સાહિત્યિક બની છે. સામાન્યતાઃ, કૃતિ 'પેરારી-કથા'એ પહોંચવા જતી હોય, ત્યારે સર્જને એમાં પ્રવર્તમાન ઘટનાઓ, બોલી, અને બદલાતા સમાજની જ્ઞાસ તો આયાતી રીતભાતો ઉમેરવાની લાવચ થતી રહે છે, તો રતિભાઈ એ બાજુ ફરક્યા જ નથી. ભલે 'ભદ્રભદ્ર'ને આજની પેઢી સુધી કે, એમનો પહેરવેશ, ભાષા, ઘટનાઓ તથા પ્રવર્તમાન જીવનશૈલીથી રતિભાઈએ 'ભદ્રભદ્ર'ને અભડાવા દીધા નથી. તેમ છતાંય, છેલ્લાં દસેક વર્ષથી દેશ માટે રાજમંત્ર બની ચૂકેલા 'સ્ત્રીસશક્તિકરણ'ના મુદ્દાને બોરીસાગર સાવ આયાત વિના ખેંચી લાવ્યા છે અને તેની યથાર્થતાય પુરવાર કરી છે, મુદ્દાને રાજકીય સ્પર્શ આપ્યા વિના !

અંબારામના પાત્રને એમણે કાચની શીશી જેવું જાળવી રાખ્યું છે. એમની સરળતા

અને 'ગુરુ' (!) પ્રત્યેની શરણાગતિ જોઈને ક્યારેક એમ જ લાગે કે, અંબારામના પાત્ર દ્વારા લેખક સ્વયં પ્રગટ થયા છે. રત્નભાઈને નજીકથી ઓળખનારાઓ સહમત થાય કે, અંગત જીવનમાં પણ બોરીસાગર અંબારામ જેવા જ છે.

વધુ આનંદ આપે છે, બોરીસાગરની રમતિયાળ શૈલી અને લગભગ આયાસ વિનાનું જ લાગે, તેવા હાસ્યનું સાતત્ય, શક્ય છે આજ સુધી વણાખેડાયેલા રહેલ હાસ્યસાહિત્યના કોઈ નવા પ્રયોગને બળવત્તર બનાવે છે જેમ કે, હર વખતે ઉશ્કેરાયેલા રહેતા અને કોઈ વિરાટ તોંકન કરી બેસશે, એવો ભય ઊભો કરતા 'ભંડભદ્ર'ને જે ઢંકથી અંબારામ સમજાવીને ટાડા પાડે છે, એ તમામ પ્રયાસો મારી સમજ મુજબ હાસ્યસાહિત્યમાં નવા અને સફળ પ્રયોગો છે.

'ભંડભદ્ર' ઊભા રહેવાનું કષ્ટ લે, તેમાં મને કોઈ વાંધો ન હતો, પણ એ કષ્ટમાં મને શામેલ કરે, તે મને ઈષ નહોતું.... 'ભીષ્પિતામહને જેમ ઈચ્છામૃત્યુનું વરદાન હતું, તેમ ભંડભદ્રને 'ઈચાકોધનું વરદાન હતું...' અથવા તો અવારનવાર ભંડભદ્રને એમના પૂર્વિવતારની સમૃતિ અપાવીને એમના કોધાણિ અને જડબુદ્ધિને શાંત કરવા માટેના અંબારામના પ્રયોગો હાસ્યોદ્ભવ કરનારા છે. અર્થાત્, જે જે ક્ષણે અંબારામના સ્વરૂપમાં સ્વયં લેખક પ્રગટે છે, તે તમામ ક્ષણો રમૂજ્યોરક અને વિવેકી પણ છે. એક પણ સ્થળે, અંબારામે 'ભંડભદ્ર'ને નીચા પડવા દીધા નથી.... તેઓ આ કાર્ય માટે સ્વાવલંબી હોવાથી પણ લેખકની મર્યાદા જળવાઈ હોય.

ઉપર લખ્યું કે, આવનારી પેઢી માટે પણ બોરીસાગરનાં સર્જનો અમરત્વ પ્રાપ્ત કરે એ પૈકીનાં છે, તેમ છતાં, એક ભય દેખાઈ રહ્યો છે, 'ભંડભદ્ર'નું મૂળ પાત્ર અને પાત્રાવલેખન આવનારી કે આજની જ નહિ, હજુ હમણાં સુધીના ભૂતકાળની પેઢી માટે કેટલા પ્રસ્તુત હતા, તેની ચર્ચા થઈ શકે. પરિણામે, પ્રયોગ સફળ હોવા છતાં એની પ્રસ્તુતિના આયુષ્ય અંગે ચિંતા રહે. મૂળ કૃતિને આંશિક પણ નુકસાન ન પહોંચે, તેની કાળજી રાખવામાં બોરીસાગરને તેમના હાસ્ય ઉપર પણ સંયમ રાખવો પડેલો દેખાય છે, નહિ તો તેમનાં તમામ પુસ્તકો વાચકોને ખડ્ખડાટ હસાવનારાં બન્યાં છે. આ વિષય પક્કીને ક્ષયાંક એમને પોતાની હાસ્યવૃત્તિને બાંધી રાખવી પડી હોય, એવું કોક કો રથ્યે ફ્લિત થાય છે. અલબત્ત, 'સંભવામિ યુગેયુગો'ની જેમ આ પુસ્તક પણ બોરીસાગરે સામાન્ય વાચકો કરતા સાહિત્યિક ધોરણો જાગ્રતા વાચકો માટે લખ્યું હોય, તેવું વધારે જગ્યાય છે. જે છૂટ એમને 'ઓન્જિયોગ્રાફી' જેવા અગાઉના સર્જનોમાં મળી છે, તેની સરખામણીમાં સાહેબ અહીં આંશિક બંધાયેલા લાગે છે, જેનું કારણ પુસ્તકનું આવું 'ફોર્મેટ' હોઈ શકે. અંબારામના સ્વરૂપે સાહેબ પોતે પ્રગટ્યા હોવા છતાં, 'રત્તિયન-ટચ' સ્વાભાવિક છે કે, અહીં જવલ્યે જોવા મળે. કારણ મૂળભૂત સ્વરૂપે રત્તિલાલ

હાસ્યસાહિત્યના સર્જક છે, કટાક્ષના નહિ !

પણ, સર્જક રતિભાઈ માટે સમગ્ર સાહિત્યજગત સંભાનની દસ્તિ રાખે છે, એની પાછળ પણ એમનાં અગાઉનાં સર્જનોમાં પ્રસ્થાપિત કરેલા આવા પ્રમોગો પણ છે. સીધેસીધા નિબંધો લખવા હાસ્યકાર માટે સરળ હોય છે, પણ પ્રયોગશીલ રહીને નવસર્જનો કરતા જવું, એમને માટે સાહજિક બની ગયું છે.

શ્રી રતિલાલ બોરીસાગર અર્વાચીન તમામ હાસ્યલેખકો માટે ઘણું સંભાનનીય નામ છે. હું એમના પ્રારંભથી એમનો વાચક અને ચાહક રત્યો છું.

પ્રશ્નામ સાથે એમને મારી શુભેચ્છા.

૬ ફેબ્રુઆરી, ૨૦૧૫



## પુત્રના હૃદયસ્પર્શી પત્રો | કીર્તિદા શાહ

[તારો-તમારો પ્રકુલ્પ : લે. પ્રકુલ્પ રાવલ, પ્ર. આ. : ૨૦૧૫, પ્રકાશક : કૃતિ પ્રકાશન, પૃ. ૮૫, મૂલ્ય રૂપિયા ૧૦૦/-]

ગુજરાતી સાહિત્યમાં કવિતા, વાર્તા, નવલકથા, નિબંધ જેવાં સાહિત્યસ્વરૂપોનો પ્રચાર-પ્રસાર માતબર છે. એની તુલનામાં પત્રસાહિત્ય એવું-એટલું કૂલ્યુંફાલ્યું નથી. ગુજરાતીમાં કલાપીના પત્રો, કાન્તના પત્રો, લિ. હું આવું છું (મેધાણીના પત્રો), પરલોકે પત્રો (હીરા રા. પાઠકના પત્રો), રેખાએ રેખાએ ભરી જ્ઞાનંંબા (ભૂગુરાય અંજારિયાના પત્રો) જેવાં પત્રસંપાદનોમાં ‘તારો-તમારો પ્રકુલ્પ’ (પ્રકુલ્પ રાવલના પત્રો) એક ધ્યાનપાત્ર પત્રસંચય ઉમેરાય છે. ગુજરાતી પત્રસાહિત્યમાં સ્વજનોને, સાહિત્યકારોને, પતિને, પત્નીને, પ્રેમિકાને, મિત્રોને લખાયેલા પત્રો મળ્યા છે પરંતુ માતા-પિતાને સંબોધાયેલા પત્રોમાં ‘તારો-તમારો પ્રકુલ્પ’ ગુજરાતી પત્રસાહિત્યનું ગણપતિ બનતું પ્રથમ પુસ્તક છે.

આમ તો પત્ર અંગત લાગાડીની અભિવ્યક્તિનો પ્રકાર છે. એમાંય જ્યારે એ મૃત વ્યક્તિને લખાય છે ત્યારે એ આત્મિકપણો એટલે કે સ્વ સાથે કરેલો વાર્તાલાપ બને છે. એ સંદર્ભમાં એ સ્વઅે જ સ્વ માટે કરેલી અભિવ્યક્તિ છે.

માતા-પિતાને પત્ર લખવા નિભિતે સ્વ સાથે ગોચિ કરતા કુલ ૪૨ પત્રોના પ્રસ્તુત સંચયમાં આરંભના ૨૧ પત્રો માતાને સંબોધીને અને બીજા ૨૧ પિતાને સંબોધીને લખાયા છે. માતાપિતાને સંબોધીને લખાયેલા આ પત્રોમાં સંબોધન ‘પરમ પૂજ્ય બા’ અને ‘પરમ પૂજ્ય પિતાજી’ એ રીતે થયાં છે. પત્રાંતે માતાના પત્રોના વિભિત્તંગમાં ‘તારો પ્રકુલ્પ’ અને પિતાના પત્રોના વિભિત્તંગમાં ‘તમારો પ્રકુલ્પ’ લખેલું છે. વિભિત્તંગના આ શબ્દો પત્રસંચયનું શીર્ષક બન્યા છે. માતાને તા. ૧૪-૧-૧૩થી તા. ૧૮-૮-૧૪ સુધીના

સમયગાળમાં પત્રો લખાયા છે અને પિતાને તા. ૧-૫-૧૧થી તા. ૭-૮-૧૩ સુધીના સમય દરમિયાન પત્રો લખાયા છે. પત્રલેખકે પિતાને પત્ર લખવાની શરૂઆત માતા કરતાં પહેલાં કરી છે.

પત્રલેખક ‘મારી વાત’માં નોંધે છે : ‘સંચિત થયેલું કનડતું હતું. વળી પરિતાપ વીટળાય અને વળી હું કલમ ઉપાડું’ એ રીતે અહીં સ્વની વેદના શબ્દબદ્ધ થઈ છે. કશુંક જે સંચિત છે જો એ હૃદયમાં રહે તો ખૂંગે, પીડે, ચીરે, બાળે – એમાંથી ઊગરવા માટે આ પત્રલીલા થઈ છે. એક વાર અંદર ધરબાધેલી વેદના વ્યક્ત થઈ જાય એટલે એનું વિરેચન-કેથાર્ટિસ થઈ જાય પછી શેષ રહે નિર્મળ શાંતિ જેમાં સ્વની ઓળખાજી થાય. આર્થિક સંકડામણને કારણે પત્રલેખકના જીવનમાં સર્જયેલી કેટલીક વેદનાજનક પરિસ્થિતિઓ પત્રોમાં શબ્દબદ્ધ થઈ છે. જુઓ સંચયનો પ્રથમ પત્ર. અહીં કુઠુંબ સાથે અંબાજીથી પાછા ફરતાં લેખકપત્ની લારીમાંથી બોર-જામફળ ખરીદે છે. એમાંથી એક બોર દાંતથી તોડતા પત્રલેખક પત્નીને પૂછે છે ‘કેટલા પૈસા થયા ?’ જવાબ મળે છે ‘સો રૂપિયા – ચાલીસ બોરાના, સાડ જામફળના’. આ સાંભળતાં જ પત્રલેખક ફ્લેશબેકમાં સરી પડે છે. બાળપણમાં મા પાસે બોર માગેલાં અને ‘મૌંધાં હતાં - એક રૂપિયે શેર એટલે ન લીધાં’ – માનું આ વાક્ય લેખકને સંભળાય છે. બીજા પત્રમાં પોતે મા પાસે ફાંડા માગ્યા અને અભાવમાં જીવતી માટે પત્રલેખકે ખરીદેલા ફાંડા પાછા આપીને મોરસ અને ચાની પડીકી ખરીદી. ત્રીજા પત્રમાં ગરીબાઈની ભીંસમાં શેકાતી મા પાસે હોળી નાગરિયાને આપવા માટે ધાણી, ખજૂર નથી એટલે નાગરિયા ઘરના બારણા સુધી આવે તે પહેલાં બારણું વાસી દેવાય છે. ને એક સ્ત્રી બોલે પણ છે : ‘નહીં હોય ઘરમાં કશુંય’. પિતાને સંબોધાયેલા પત્રો જોઈને. પિતાના પત્રોના આરંભે પત્રલેખક નોંધે છે, ‘આમ તો બાપાનું જીવન પાનખરમાં વસંતના ટહુકા જેવું હતું... જીવન તાજાનો પર્યાય બની રહ્યું હતું...’ માતાને લખાયેલા પત્રોની જેમ પિતાને સંબોધાયેલા પત્રોમાં પણ આર્થિક ભીંસને કારણે પ્રગટ થતી વેદનાની તીણી ચીસ સંભળાય છે. જુઓ પહેલા પત્રમાં અનાજવાળાના પૈસાનો સંદર્ભ, બીજામાં સ્કૂલબેગનો પ્રસંગ, ત્રીજામાં વરસાદમાં ચૂતા ઘરનાં પાણી ઊગાયેલી હથેળીઓનું ચિત્ર, ચોથામાં જમાદિવસે વેડમીનો પ્રસંગ, પાંચમામાં પિતાનાં ફાટેલાં વસ્ત્રોનો ચિત્રા, તૂટેલાં ચંપલ અને ચાનું દૂધ બિલાડી ગટગટાવી ગઈ તે ઘટના વગેરે.

આમ, માતાપિતાના પત્રોમાં આર્થિક ભીંસની ભારોભાર વેદના વિવિધ સંદર્ભઘટનાઓ દ્વારા રજૂ થઈ છે.

પત્રલેખક આજે સંપન્ન છે પરંતુ એ સંપન્તિનામાં પેલી પૂર્વજીવનની વેદના એટલી જ તાજી છે... જુઓ પત્રલેખકના શબ્દો – ‘મને ખાવાનું મન થતું નથી... આજે તો હોળીભૂષ્યા જ રહેવું છે’ (પૃ. ૬); ‘બા, આજે તો ફાંડા ખાવાની નવાઈ નથી. અરે

કશું જ ખાવાની નવાઈ નથી. પરંતુ પેલી ભૂખ ક્યાં છે ?" (પૃ. ૧૧)

આર્થિક સંકડામણમાં જીવતા પત્રવેખકનાં માતાપિતાની જીવન પ્રત્યેની સમજ, સંતોષી અને વિધીયાત્મક જીવનદળિ જ પત્રવેખકની જીવનશ્રદ્ધામાં આજ્ય પૂરે છે. પત્રવેખકનું વિધાન જુઓ : 'હું જોઉ હું તમને અને મારી બધી ઉપાધિઓ જાણો ઉડી જાય છે... તમારા ચહેરાનો એ જાદુ છે' (પૃ. ૮૬)

પત્રોમાંથી માતાપિતા અને પુત્રનું ક્યારેક વેદનાગ્રસ્ત, ક્યારેક સંતોષમાં મહેકતું, ક્યારેક પરિસ્થિતિને સાક્ષીભાવે જોતું એવું ભાતીગળ વ્યક્તિત્વ અનુભવાય છે. પત્રો વાંચનાર કોઈ પણ સહદ્યની આંખ ભીજાયા વગર રહેશે નહીં. દુઃખની લાગણીનું અવગમન રોચક બન્યું છે એનું કારણ પત્રોની અભિવ્યક્તિનો જાદુ છે. પત્રવેખકની ભાષા - ગયે નીતિયું પાણી જેવાં સ્વચ્છ અને પાણીદાર છે.

આ પત્રોની બીજી એક લાક્ષણિકતા એ છે કે પત્રવેખકે ગુજરાતી મહિના, તહેવાર, તિથિઓ, રાશિઓ, ઋતુઓ અને નક્ષત્રોને અંગ્રેજી કેલેન્ડરથી લથપથ આપણો વિસરતા ગયા છીએ એ દેશી - આપણું વિશ્વ જુદા જુદા પત્રોમાં ઉજાગર કર્યું છે.

થોડાં નિર્દર્શનો જોઈએ :

- પચીસ વર્ષે પત્ર લખ્યું હું અને તેથી સૂર્યના મકર રાશિના પ્રવેશ ગણે.

(પૃ. ૧)

- ફૂલકાજળીનું જાગરણ કરતી હીરલ... (પૃ. ૧૫)

- અંગારક ચોથ પછી કાલે અષાઢી પાંચમે વરસાદનું આગમન થયું. (પૃ. ૩૭)

- ફાગણની ઠળતી સાંજે હોળીભૂષ્યો હું. (પૃ. ૫૮)

ગદ્યાંનાં નિર્દર્શનો

- બાનો ચહેરો આ ક્ષાણો ઝણુંબી રવ્યો છે. (પૃ. ૫૨)

- બાના ચહેરા પર ચિંતાના કરોળિયા ફેલાયા હતા. (પૃ. ૪૫)

- નાના સુખે પણ ન્યાલ થઈ જતા. (પૃ. ૮૬)

- વય વધતાં અભાવો હણહણવા લાગ્યા અને અપેક્ષાઓને પાંખો ફૂટી. (૬૮)

તાણમય પરિસ્થિતિમાં જન્મેલા-રહેલા પત્રવેખકનાં માતાપિતાના ભાગ્યમાં પાનખર રહી. પણ એ પાનખરે જ એમનું ઘડતર કર્યું એ જ એમને મળેલો વારસો છે. જેમનું સ્મરણ અને રટણ કરતાં નિખાલસ હંદયથી લખાયેલા આ પત્રો તે માત્ર પ્રકુલ્પ રાવલનાં માતાપિતાના નથી રહેતા; તેમના જેવા અનેક પુત્રોના બની રહે છે. એ સાધારણીકરણની અનુભૂતિ જ પત્રવેખકની સિદ્ધિ છે.



## શિશુપ્રેમી સોનીએ ઘડેલાં મૂલ્યવાન ઘરેણાં | ઈશ્વર પરમાર

ગૂર્જર બાળવાતવિભવ શ્રેષ્ઠી : (રમણલાલ સોનીની શ્રેષ્ઠ બાળવાર્તાઓ) : સંપા. યશવન્ત મહેતા અને શ્રેષ્ઠ નિરેટી, પ્રકા. ગૂર્જર ગ્રંથરન કાર્યાલય, ગાંધીમાર્ગ, અમદાવાદ-૧, પહેલી આવૃત્તિ ૨૦૧૧, પૃ. ૮૫૨, ડિ. ૩. ૧૦૦/-]

ગુજરાતી બાળસાહિત્યક્ષેત્રે ગિજુબાઈ બધેકા જેમ 'વિશ્વસર્જક બ્રહ્મ' સમાન તેમ રમણલાલ સોની 'વિશ્વપાલક વિષ્ણુ' સમાન સ્વીકારાયા છે. રમણલાલ સોનીએ પોતાની ૮૮ વર્ષની આવરદા દરમિયાન પાંચ-પાંચ પેઢીઓના પ્રિય બાળવાચકો (અને બાળશ્રોતાઓ) માટે બાળવાર્તાના સ્વરૂપમાં વિપુલ અક્ષરપ્રદાન કર્યું. ઠયત્તા અને ગુણવત્તાની દસ્તિએ સમયની કસોટીમાંથી માનબેર પાર ઉત્તરેલી એમની બાળવાર્તાઓ મૂલ્યવાન ઘરેણાં સમાન છે. આવા શ્રેષ્ઠ સર્જકની નીવડેલી બાળવાર્તાઓમાંથી વધુ શ્રેષ્ઠ જણાયેલી બાળવાર્તાઓનો સંચય કરવો એ સંપાદકો માટે ખરેખર મીઠી મૂલ્યવણી બાબત લેખાય. આ સ્થિતિમાં એમણે રમણલાલ સોનીની શ્રેષ્ઠ બાળવાર્તાઓનું પ્રતિનિધિત્વ કરતી માત્ર ૨૨ વાર્તાઓ અને પ્રસ્તુત કરેલ છે. આ અને આવી અનેક બાળવાર્તાઓ થકી ગુજરાતી બાળકો ખરેખર ન્યાલ થયા છે.

બાળવાર્તાકાર રમણલાલ સોનીને વિષયોનું વૈવિધ્ય કલમસહજ રહ્યું છે. પ્રસ્તુત પુસ્તકના આધારે તારવીએ તો 'ધરખૂણિયા છોકરા'ની વાર્તા દ્વારા એમણે કર્મ-કૌશલ્યનો મહિમા કર્યો છે; ચતુરાઈની વાતો તો અનેક વાર્તામાં વણાયેલ છે. એમાં ગલબા શિયાળની ચતુરાઈ તો એવી ચોટદાર કે વાઘ જેવા વાઘને નટીમાં વહાવી દીધો ! બીજી ચાતુરીકથાઓ, જેવી કે 'બાપા, જામફળ !', 'છોટુનો ભોડુ', 'ગગલાનો ડગલો' વગેરેની વિરોધતા એ છે કે તેમાં હાર્ય પણ સાથોસાથ વણાતું રહે છે.

બાળકોને નવાઈંમાં ગરકાવ કરી દેતી વાર્તાઓ જેમ કે ખવડાવીને ખાવું, જિવાડિને જીવું, 'રામરાજ્યનાં મોતી', 'ચંદુની ફૂલદાની' વગેરે ચિત્રકથા જેવી બાળશ્રોતાને લાગવાની. ચંદુની ફૂલદાનીમાંથી રોજ ફૂલ મળે ને તેની સાથે એક સોનામહોર પણ મળે ! એ જ ફૂલદાનીમાંથી એકવાર તો ધૂમાડાના ગોટેગોટા ને કાળા હાથવાળાઓની લાંબી કંતાર ! 'બે તારા - કોનારક ને સોનારક' જેવી કલ્યના-પ્રદેશની સેર કરાવે છે, 'ગલાનું શમણું' રહસ્યના રોમાંચમાં બાળચિત્રને વીઠી દે છે, તો રામરાજ્યનાં મોતી જેવી વાસ્તવકથા ધરતી પર લાવી દે છે. એક વાર્તા તે 'બુદ્ધિકન્યા'માં ચાર ચાર કોયડા ને તેના ઉકેલો બૌદ્ધિક મનોરંજન કરે છે; આનંદલોકમાં વિહાર કરાવતી 'ખેડૂતની કાકડી', 'ચકુડી', 'માટલી રાણી', 'લાડુની જાત્રા', 'હાથી જેવડો ઉંદર' ...બાળક ફરી ફરી સાંભળવા-વાંચવા ઈચ્છે રેવી છે.

રમણલાલ સોનીની બાળવાર્તાઓ લખાયેલી છે એવી ફબે કે જાણે તે મુખોમુખ કહેવાતી હોય. વળી, એ સંવાદોના સથવારે આગળ ને આગળ સરકતી રહે છે. 'હાથી

જેવડો ઉદર' વાર્તામાં ફ્રટા વૈટે ઉદરને કહ્યું : "બહાદુરી અંદરની ચીજ છે. દુનિયાનો કોઈ વૈટ બહાદુરીની પરીકીઓ આપતો નથી." યાબરાએ કહ્યું : "તો હાથી થઈને મારે શું કરવાનું ?" ફ્રટાવૈટે ઠડકથી કહ્યું : "મનથી મનથી કુલાવાનું, ધાતી કાઢી ફરવાનું. બીએ એને બિવડાવવાનું અને જે ન બીએ એનાથી પોતે બીને ભાગી જવાનું !" - આવા સંવાદો નજર સામે ભજવાતા લાગે.

શિશુપ્રેમી સર્જક સોનીએ ઘટેલાં વારતાનાં ઘરેણાં મૂલ્યવાન એવાં કે એમાં જીવનમૂલ્યો જડાયેલ હોય, વધારે સાચું, રસાયેલ હોય. વાર્તાને છેડે બોધ તારવી આપવાની એમને જરૂર જગ્ઝાઈ છે. જે કહેવાનુંહોય તે પાત્રો જ વાતવાતમાં કહી છે : 'છબ્બુની કિમત' વારતામાં રાજા બોલી ઊઠ્ઠા : 'ઓહ ! સેવા અને શ્રમ ! હું તો શું, પણ ગમે તેવો મોટો રાજા પણ સેવા અને શ્રમનાં ફળને ઝૂટવી લઈ શકતો નથી !' 'ખેડૂતની કાકડી'માં ખેડૂત આત્મગૌરવ રણકાવતાં કહે છે : 'જો ભાઈ, અમે રચા ખેડૂત ! માલ મઝીતમાં જાય અનો વાંધો નહીં, પણ માન રહેવું જોઈએ.'

કથ્ય શૈલીમાં રચાયેલી આ વાર્તાઓમાં વરચે વરચે જોડકણાં કે ગીતોની ગુંથણી કરીને સર્જક વિશેષ રંગત આપી છે. ઓછા શબ્દોવાળાં વાક્યો તો આ લેખકને કલમવગાં છે : 'એક હતો કુભાર', ધરખૂણિયો કહે : 'ઉંહ !', બે બળદ નવા લીધા. - આવાં ઓછા શબ્દોવાળાં વાક્યો શિશુવાચકને અર્થગ્રહણ માટે અનુકૂળ રહેતાં હોય છે એ ખરું, આમ છતાં કુશળ સર્જક રમણલાલ સોનીને બા-અદબ સલામ કરવાનું મન થાય કે આઈ-દસ નહીં, પૂરા છવીસ શબ્દો ધરાવતું આવું વાક્ય પણ આનંદ અને અર્થગ્રહણ સાથે બાળક વાંચી જઈ શકે છે : "લાડુ હરખાતો હરખાતો કૂદીને બ્રાહ્મણના મોંમાં એની જીબ પર જઈને બેઠો અને બેઠો એવો જ લીસા લપસણિયા પરથી સરકે એમ સરકીને સડસડાટ બ્રાહ્મણના પેટમાં ઊતરી પડ્યો !"

દીર્ઘ સમયનો સર્જન-કાળ ધરાવતા લેખકની કૃતિમાં એના શબ્દપ્રયોગો જોવા મળી શકે કે જે સર્જનકાળ પછીની પેઢીનાં બાળકો માટે અપરિચિત હોય, જેમ કે, છબ્બ-પાવલી, ગામમાં પડો વજડાવવો, ધરનું માલણ, કોવડાવવું. નવી પેઢીના વાચકો માટે એ વિશે વોંગ સ્થાને મુકાયેલી નોંધ ઉપયોગી થાય ખરી.

આ પુસ્તકમાંની વાર્તાઓ વાંચી-સાંભળીને બાળકો આ જ લેખકની વધુ વાર્તાઓ વાંચવા-સાંભળવા દીચ્છશો. એમની દીચ્છા વાલીઓ અને શિક્ષકો સંતોષે તો બાત બન જાય !

## આવરણચિત્ર : સંદર્ભનોંધ

પીપુષ ઠક્કર

કળાકૃતિનું શીર્ષક : અષાઢી વર્ષા પછીની સાંજ

કળાકાર : નીલિમા શેખ (જ. ૧૯૪૫, હિન્દુ)

માધ્યમ : કેન્વાસ પર તૈલચિત્ર - માપ : ૧૨૨ સેમી x ૭૬ સેમી -  
વર્ષ : ૧૯૮૧

વડોદરાનિવાસી નીલિમા શેખ ભારતનાં એક પ્રતિષ્ઠિત ચિત્રકાર છે. શાંત અને સૌભ્ય સ્વભાવનાં નીલિમાબહેન વિચારપ્રધાન કળાનાં હિમાયતી છે. સમકાળીનતા, કળાભાષા અને વૈયક્તિતતાના સજા સમન્વય દ્વારા એમની કળાદિષ્ટ રસાયેલી છે. માતા, પત્ની, મિત્ર, ભારતીય સ્ત્રી અને સત્તિશે તો એક કળાકાર તરીકેનાં ઉત્કટ પ્રમાણો/ બયાનો એમની ચિત્રકળામાં સાંપડે છે. એમના જ શાબ્દો છે : I think I am an artist because I am a painter and not a painter because I am an artist.

વર્ષ ૨૦૧૩માં નીલિમા શેખની સમગ્ર કળાયાત્રાને આવરતો એક ચિત્રગ્રંથ “TRACE RETRACE”, સંસ્કૃતભીમાંસક કુંકુમ સાંગારીના સંપાદનમાં પ્રકાશિત થયો છે. એમાં વર્ષ ૧૯૬૬થી ૨૦૧૨ સુધીની કળાયાત્રાનો સચિવત આવેખ જોવા-વાંચવા મળે છે. ગ્રંથનાં પૃષ્ઠોમાંથી પસાર થવાનો અનુભવ અનોખો છે. ભાવક નીલિમાનાં ચિત્રોમાં ખોવાઈ જઈ શકે છે. પહેલાં તો રંગો અને આકારોની લયાત્મકતા પર એ મુશ્ય થાય છે ને પછી આસ્તે આસ્તે પૂરેપૂરું ચિત્ર જોવા પામે છે. નીલિમા પોતીકી શૈલીમાં પ્રત્યેક આફૂતિનું વિગતસરનું, ઝીણવટભર્યું આવેખન કરે છે. બહુધા નાના એવા ચિત્રફલકમાં તેઓ એક આગવી સૂચિ રચે છે. એટલે જ ચિત્રને જોતાં-જોતાં જાણે ચિત્રને વાંચતાં હોઈએ એવો પણ અનુભવ થઈ શકે છે. નીરખનું અને વાંચવું બંને નીલિમા શેખ જેવાં ચિત્રકારોમાં એકરૂપ થઈ જાય છે. કદાચ એટલે જ આ ગ્રંથની દર્શન-વાંચનયાત્રા અનોખી બની છે.

આવરણ : અષાઢી વર્ષા પછીની સાંજનું મનાંકન છે. ઉપરેથી, અભેથી જોવાયેલો, લોંગ શૉટ એરિયલ બ્યૂ છે. વર્ષા પછીની આદિમ આવેગથી સ્પંદિત થઈ ગયેલી આ સૂચિ છે. કાન્તનું કાલ્ય ‘વસંતવિજય’ સહેજે જરા જુદી રીતે સ્મરણો ચઢે : “ધીમે ધીમે છયાથી કુસુમરજ લઈ ડોલતો વાયુ વાય, / ચોપાસે વલ્લિઓથી પરિમલ પ્રસરે, નેત્રને તૃપ્તિ થાય.....” પશુ-ધ્યાની, ઝાડપાન, માનવી સર્વેમાં અપૂર્વ એવો સંચાર છે. ચિત્રકારે રંગની વિધવિધ છયાઓમાં અષાઢી સાંજને બહેલાવી છે. જોકે ચિત્રમાં બે પાત્રો એવાં છે કે જેઓ સાંજની પાર કશુંક નીરખી રહ્યાં છે, એક તે બાળક ને બીજો તે પુરુષ. સમગ્ર ચિત્રમાં સંચાર અને સ્થિરતાનો સરસ સંયોગ રચાયો છે.

(નીલિમા શેખ વિશે વધુ આવતા અંકે)



## આપણી વાત

સંકલન : પ્રકૃત્વ રાવલ

### પરિષદના આગામી કાર્યક્રમો

તા. ૩-૮-૨૦૧૫ અને તા. ૧૭-૮-૨૦૧૫ને ગુરુવારના રોજ પાકિસ્તીમાં વાર્તાનું  
પઠન થશે સાંજે ૬.૧૫ કલાકે.

### વિશ્વકવિતા કેન્દ્ર અંતર્ગત

તા. ૨, ૮, ૧૬, ૨૩-૮-૨૦૧૫ના રોજ બુધસભા અને ૩૦-૮-૨૦૧૫ના રોજ  
વાખ્યાન સાંજે ૭.૦૦ કલાકે.

### ગુજરાતી સાહિત્ય પરિષદનું આગામી અધિવેશન

ગુજરાતી સાહિત્ય પરિષદનું આગામી ૪૮મું અધિવેશન ઇન્સ્ટિટ્યુટ ઓફ યુથ  
ટેવલપમેન્ટ તેમજ શ્રી મુક્તજીવન સ્વામિબાપા આદ્ર્સ-કોમર્સ અને બી.સી.એ. મહિલા  
કોલેજના યજમાનપદે ભુજ મુકામે તારીખ ૨૫, ૨૬, ૨૭ ડિસેમ્બર-૨૦૧૫ના રોજ  
યોજાશે. આ અધિવેશનમાં નીચે મુજબની બેઠકો રહેશે.

### ઉદ્ઘાટન બેઠક

૨૫-૧૨-૨૦૧૫ને શુક્રવારે બપોરે ૩.૦૦થી ૬.૦૦

### પ્રથમ બેઠક

૨૫-૧૨-૨૦૧૫ને શુક્રવારે સાંજે ૮.૦૦

આસ્વાદ બેઠક - કચ્છના પરિવેશની કૃતિઓનું વાચિકમું

૨૬-૧૨-૨૦૧૫ને શનિવારે સવારે ૮.૦૦થી ૮.૦૦

મધ્યરથ અને કાર્યવાહક સમિતિની સંયુક્ત બેઠક

### બીજી બેઠક

૨૬-૧૨-૨૦૧૫ને શનિવારે સવારે ૮.૩૦થી ૧૨.૩૦

### ચરિત્રાસ્પક સાહિત્ય

### ત્રીજી બેઠક

૨૬-૧૨-૨૦૧૫ને શનિવારે ૩.૦૦થી ૬.૦૦

### તિવેચન-સંશોધન

### ચોથી બેઠક

૨૬-૧૨-૨૦૧૫ને શનિવારે રાતે ૮.૩૦થી ૧૦.૩૦

યજમાન સંસ્થા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ

## પાંચમી બેઠક

૨૭-૧૨-૨૦૧૫ને રવિવારે ૮.૩૦થી ૧૧.૦૦

## ગુજરાતી ભાષાનું શિક્ષણ



### ગુજરાતી સાહિત્ય પરિષદ અધિવેશન બાબત

આદરણીયશ્રી,  
વંદન.

ગુજરાતી સાહિત્ય પરિષદ દર બે વર્ષે ગુજરાતમાં વિવિધ સ્થળે અધિવેશન યોજે છે. આ અધિવેશન ખૂબ જ સાહિત્યિક અને સાંસ્કૃતિક વાતાવરણ સર્જે છે અને જે તે વિસ્તારના સાહિત્યપ્રેમીઓ તથા સર્જકોને પ્રેરણ આપે છે.

૨૦૧૫ના ડિસેમ્બરમાં આ પરિષદનું અધિવેશન ભુજમાં યોજાય તેના પ્રયાસો ઉપરોક્ત બંને સંસ્થાઓએ કર્યા અને સફ્ટભાયે પરિષદે તેને લીલી ઝડી આપી છે. એટલે તા. ૨૫-૨૬-૨૭ ડિસે. ૨૦૧૫ના ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન ભુજ ખાતે યોજાશે.

આ પરિષદમાં આશરે ૮૦૦થી ૧૦૦૦ સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ કંઈ તથા સમગ્ર ગુજરાતમાંથી હાજર રહેશે તેવી ધારણા છે. તેમનાં નિવાસ તથા ભોજન વગેરેની વ્યવસ્થા કરવાની રહેશે. તે તથા અન્ય ખર્ચ વિશે આયોજન કરતાં આશરે ૨૦ લાખનો ખર્ચ અંદાજિત કરવામાં આવ્યો છે. આ ખર્ચ મહાજનો તથા સાહિત્યપ્રેમીઓ અને નાગરિકોની સહાયથી એકઠો કરવાનું વિચાર્યુ છે. આ બાબતને ઉભાબેર સહકાર મળશે તેવી આશા છે.

આ માટે આ રીતે દાન સ્વીકારવાનું નક્કી કર્યું છે :

સુરેનીયર પેજ શુભેચ્છક તરીકે (નીચે સ્ટ્રીપ) રૂ. ૨૦૦૦/-

સુરેનીયરમાં મલ્ટીકલરપેજ જાહેરાત રૂ. ૨૫,૦૦૦/-

સુરેનીયરમાં મલ્ટીકલર કવરપેજ-૨ રૂ. ૭૫,૦૦૦/-

સુરેનીયરમાં મલ્ટીકલર કવરપેજ-૩ રૂ. ૭૫,૦૦૦/-

સુરેનીયરમાં મલ્ટીકલર કવરપેજ-૪ રૂ. ૧,૨૫,૦૦૦/-

શુભેચ્છક સભ્ય તરીકે રૂ. ૫૦૦૦/- કે તેથી વધુ રકમ નોંધાવીને સહયોગ સ્વીકારશે.

ભોજનદાતા તરીકે રૂ. ૧ લાખ નોંધાવી શકાશે. આખા દિવસના ભોજનદાતા તરીકે રૂ. ૩ લાખ નોંધાવી શકાશે.

સ્વાગત સભ્ય તરીકે રૂ. ૧ લાખ કે તેથી વધુનો સહયોગ આવકાર્ય છે.

પરિષદના સભ્યો માટે કિટના દાતા તરીકે રૂ. ૩ લાખ નોંધાવી શકાશે.

આમાંથી કોઈ પણ વિભાગમાં આપનું દાન આવકાર્ય રહેશે. ૮૦-જીનું પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા ચાલુ છે.

આપને અમારી વિનંતી છે કે આ સાહિત્ય યજ્ઞમાં આપ પણ સક્રિય સહયોગ બનો અને કચ્છની જનતાને જે એક અનન્ય લાભ મળી રહ્યો છે તેને પ્રોત્સાહન આપો.

આ માટે શ્રી રસનિધિ એ. અંતાડી (ઓબાઈલ નં. ૮૮૨૫૭૩૦૩૧૫)નો સંપર્ક કરવા અને મદદરૂપ થવા વિનંતી છે.



- ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના લિલિતકલા કેન્દ્રના ઉપકમે તા. ૧૦-૭-૨૦૧૫ના રોજ શ્રી નિર્ણન ભગતનું કાવ્યપઠન અને એ કાવ્યનું ગાન શ્રી અમર ભાઈ હીરાલાલ ભગતવતી સભાગૃહમાં કર્યું હતું.

- ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા શ્રી ભર્દંકર વિદ્યાર્થીપક શાન-વિજ્ઞાન વ્યાખ્યાનશ્રેષ્ઠી અંતર્ગત તા. ૨૮-૭-૨૦૧૫ના રોજ શ્રી હરિ દેસાઈએ 'નવી નજરે સરદાર વલલભભાઈ પટેલ' વિશે વક્તવ્ય આપ્યું હતું.

- પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના સ્તરે માતૃભાષા પ્રત્યેનો પ્રેમ વિદ્યાર્થીઓમાં સંવર્ધન પામે, તે માટે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા જુદા જુદા પ્રયત્નો શરૂ કર્યા છે. જેમાં તા. ૩૧-૭-૨૦૧૫ના રોજ ગુરુપૂર્ણીમા નિમિત્તે 'વાત ગુરુની માનીએ' એ શીર્ષક અંતર્ગત ડૉ. અલ્યા શાહે લખેલું નાટક સી. એન. વિદ્યાલયના વિદ્યાર્થીઓએ પ્રસ્તુત કર્યું હતું. આ ઉપરાંત વિષયોચિત ચરિત્રો વિશેનાં વક્તવ્યો રજૂ થયો હતાં.

- વડોદરાની કલાસંસ્થા 'ત્રિવેણી'ના ઉપકમે કવિ-વૈખક કીર્તિકાન્ત પુરોહિતની સંગ્રહત્રણી 'અચરજના ઓવારેથી', 'રેતશીશીના રજકણ' અને 'મધુર સ્વખ'નું વિમોચન શ્રી માર્કન્ડ ભાઈ કર્યું હતું.

- વિખ્યાત લોકધર્મી સાહિત્યકાર શ્રી દિલીપ રાણપુરાને સ્મરવા માટે અને એમના સાહિત્યના પુનઃ આસ્તાદ માટે યોજાતા સ્મૃતિ-સ્નેહમિલનની પરંપરામાં તા. ૮-૮-૨૦૧૫ના રોજ ડૉ. શ્રદ્ધાભાન ત્રિવેણીએ 'દિલીપ રાણપુરાના વાર્તાસંગ્રહ 'ભાર'ની વાસ્તવદર્શી વાર્તાઓ' વિશે પ્રવચન આપ્યું હતું.

- ભુજની સાહિત્યિક સંસ્થા કવિ કલાવૃદ્ધ દ્વારા આચારી બીજ પ્રસંગે સંસ્થાનો વાર્ષિકોત્સવ - 'કાવ્યકિરણ' કાવ્યસંગ્રહ, મુશ્ખાયરા અને સંગીતસભા સાથેનો કાર્યક્રમ તા. ૧૮-૭-૨૦૧૫ના રોજ જોરાવરસિંહ રાઈડ 'ચાંદ'ના અતિથિપદે યોજાયો હતો.



ઈલા આરબ મહેતાકૃત 'વાડ' નવલકથાને સાહિત્ય પરિષદ અને મહારાઝ, ગુજરાતી સાહિત્ય અકાદમીનું પ્રથમ ઠિનામ પ્રાપ્ત થયું છે, જેનો અંગેજ અનુવાદ રીયા કોડારીએ કર્યો છે. તાજેતરમાં દિલીપના પ્રકાશનગૃહ 'જુબાન' તરફથી 'વાડ'નું વિમોચન

મુંબઈના કોસવર્કમાં થયું અને અમદાવાદ ‘કોસવર્ક’ ખાતે આઈ ઓગસ્ટના રોજ થયું.  
ઇલા આરબ મહેતાને ‘વાડ’ પર ચર્ચા માટે જ્યપુર લિટરલી હોસ્પિટલમાં આમનત્રણ  
મળ્યું છે.

## વર્ષી અડાલજા

### ગુજરાતી સાહિત્ય પરિષદને મળેલ દાન

- (૧) શ્રી હરેશ મહેતા, મુંબઈ : પ્રકાશક સહાય રૂ. ૧૬,૭૦૦/-
- (૨) શ્રી ગૌતમ પી. વાઘેલા, અમદાવાદ : સાઢું દાન રૂ. ૭૦૦૧/-

### સાભાર નોંધ

#### પ્રકીર્ણ

(૨૮૨) આઈ પ્રવાસ : ડૉ. સુધીર શાહ, ૨૦૧૪, અશોક પ્રકાશન મંદિર,  
અમદાવાદ, પૂ. ૬+૧૪૦, રૂ. ૧૫૦/- (૨૮૩) અન્નિજીવનની ગઈ કાલ આજ અને આવતી  
કાલ : સંપા. હેમરાજ શાહ, ૨૦૧૪, નવભારત સાહિત્ય મંદિર, મુંબઈ, પૂ. ૬+૨૦૨  
રૂ. ૨૨૫/- (૨૮૪) વરેણ્ય વિશેષજ્ઞો : સંકલન : કિશોરચંદ્ર શુક્લ, ૨૦૧૫, ભૂતપૂર્વ  
તાલીમાર્થી સંધ્ય, મોડાસા, પૂ. ૪+૬૦, રૂ. NIL (૨૮૫) વિવેચનવિશેષ : મુનિકુમાર  
પંડ્યા ૨૦૧૫, લેખક પોતે : ઉત્ત, ગ્રીનપાર્ક શેરી નં. ૧, ગોવિંદભાઈની વાડી સામે,  
એરપોર્ટ રોડ, રાજકોટ-૧, પૂ. ૧૨૭, રૂ. ૧૨૫/- (૨૮૬) આ દૂરનું આકાશ : હરિવંન  
મહેતા, ૨૦૧૩, શુભમ પ્રકાશન, મુંબઈ, પૂ. ૮+૭૬, રૂ. ૮૦/- (૨૮૭) સરદાર : અનુ.  
છાયા નિવેદી, ૨૦૧૫, ગુર્જર પ્રકાશન, અમદાવાદ, પૂ. ૧૨+૪૫૨ રૂ. ૪૩૦/- (૨૮૮)  
જરા હસી લે : પ્રા. હિન્કર દેસાઈ, ‘વિશ્વબંધુ’, ૨૦૧૪, લેખક પોતે : ૧૭/૩૪૨,  
સત્યાગ્રહ છાવણી ઈસરો સામે, સેટેલાઈટ, અમદાવાદ-૩૮૦૦૧૫, (૨૮૯) કેળવણીનો  
વૈકલ્પિક માધ્યમ : હરેશ ધોળકિયા, ૨૦૧૫, ક્ષિતિ પબ્લિકેશન, અમદાવાદ, પૂ. ૧૨૦,  
રૂ. ૧૨૫/- (૨૯૦) વેદવાણી : ડૉ. પ્રતાપ પંડ્યા, ૨૦૧૫, આદર્શ પ્રકાશન, અમદાવાદ,  
પૂ. ૧૭૬, રૂ. ૧૬૫/- (૨૯૧) ઓસરીમાં તડકો : ગુલાબ દેઢિયા, ૨૦૧૨, વિવેકગ્રામ,  
પ્રકાશન, માંડવી, કર્ણા, પૂ. ૧૭૬, રૂ. ૧૨૦/- (૨૯૨) આપકી પરણાઈયાં : રજનીકુમાર  
પંડ્યા, ૨૦૧૪ : આર. આર. રોઠ ઓન્ડ કંપની પ્રા. લિ., મુંબઈ-અમદાવાદ, પૂ.  
૨૬+૩૨૦, રૂ. ૨૭૫/- (૨૯૩) નહીં માફ નીચું નિશાન : અનુ. હેતલ સોંદરવા, ૨૦૧૫,  
આર. આર. શેઠ ઓન્ડ કંપની પ્રા. લિ., મુંબઈ-અમદાવાદ, પૂ. ૨૬૪, રૂ. ૨૨૫/-

## પત્રસેતુ

---

પ્રતિ,

તંત્રીશ્રી,

‘પરબ’

માન. શ્રી યોગેશભાઈ જોશી,

નમસ્કાર ! ‘પરબ’ એ ભાષા, જોડણી, શૈલી તરણે કક્ષાએ સંપન્ન અને શુદ્ધિસભર હોવું જોઈએ.

‘પરબ’ એપ્રિલ, ૨૦૧૫માં કેટલીક ભૂલી રહી ગઈ છે, જે મેં દર્શાવેલ છે. અન્ય લેખોમાં પણ ભૂલ હોવાનો સંભવ છે. વધારે જોડણી શુદ્ધ થાય તેવો ખ્યાલ (અથવા જે તે જોનારને જાણ) કરવા માટે પ્રૂફરીડરને જાણ કરવી જોઈએ, પ્રેસ પણ જવાબદાર છે.

પરબ-પૃષ્ઠ	છે	હોવું જોઈએ
પૃ. ૭	ઈત્યાદિ	ઈત્યાદિ
”	તેમજ	તેમ જ
પૃ. ૮	alll	all
પૃ. ૪૦	પોતાની ચુકાઈ ગયું છે	પોતાની જાતે ચુકાઈ ગયું છે
પૃ. ૪૧	ચતુર્માસને	ચાતુર્માસને
પૃ. ૪૨	વિલિનીકરણ	વિલીનીકરણ
પૃ. ૪૪	મોળો	મોડો
પૃ. ૪૬	અસ્કમતો	અસ્કામતો
પૃ. ૪૮	એટેલ	એટેલે
પૃ. ૫૮	ભૂદાનપ્રવૃત્તિના	ભૂદાનપ્રવૃત્તિના
પૃ. ૫૯	સાતે જ	સાથે જ
પૃ. ૬૦	પરિષદ્ધથી	પરિષદ્ધના

— એન. એલ. રાડોડ, અમદાવાદ

## આ અંકના લેખકો

અરુણ જાડેજા : એ/૧, સરગમ ફ્લેટ્સ, ઈશ્વરભૂવન રોડ, નવરંગપુરા, અમદાવાદ-  
૩૮૦૦૦૯

અશોક દવે : ભૂમિદીપ ફ્લેટ્સ, નારણપુરા ચારરસ્તા, અમદાવાદ-૩૮૦૦૧૩

ઇશ્વર પરમાર : ‘ભોરપોઈ’, સિદ્ધનાથ સામે, દ્વારકા-૩૬૧૩૫, જિ. જામનગર

એન. એલ. રાહેઠ : ૨૨, સરસ્વતીનગર, ચાંદલોડિયા, ગોતા રોડ, અમદાવાદ-૩૮૨૪૮૧

કિશોરસિંહ સોલકી : ‘ફ્રેટ’, ૪૩, તીર્થનગર વિ-૧, સોલા રોડ, ઘાટલોડિયા, અમદાવાદ-  
૩૮૦૦૬૧

કીર્તિદ્વારા શાહ : ૧, ‘સ્વાશ્રય’, એ.ડી.સી. બેન્ક સોસાયટી, સહજાનંદ કોલેજ પાછળ,  
અંબાવાડી, અમદાવાદ-૩૮૦૦૧૫

ધનસુખલાલ પારેખ : ૧૦૧, મેહુલ એપાર્ટમેન્ટ, નાની મહેતવાડ, વલસાડ-૩૮૬૦૦૧

ધીરુ પરીખ : ‘લાવણ્ય’, વિજયપાર્ક, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૮

નિર્મિશ ઠાકર : બી/૬૪, હેરિટેજ બંગલો, સાયન્સ સિટી સામે, સોલા, અમદાવાદ-  
૩૮૦૦૬૦

પન્ના ત્રિવેદી : આસ્ર. પ્રોફેસર, ગુજરાતી વિભાગ, વીરનર્મંડ દશ્ક્ષિણ ગુજરાત યુનિવર્સિટી,  
ઉધના-મગદલા રોડ, સુરત-૩૮૫૦૦૭

પીયુષ ઠક્કર : બળવંત પારેખ સેન્ટર, સી/૩૦૨, સિદ્ધિ વિનાયક કોમ્પ્લેક્સ, રેલવે સ્ટેશન  
પાછળ, ફરામજી રોડ, વડોદરા-૩૮૦૦૦૭

પ્રકુલ્લ રાવલ : ૩, રાજમહેલ ફ્લેટ, આઈઓસી કોલોની રોડ, વીરમગામ-૩૮૨૧૫૦  
પ્રીણસિંહ ચાવડા : ૨૧૨, વૃદ્ધાવન-૨, સેટેલાઈટ, રીંગરોડ, અમદાવાદ-૩૮૦૦૧૫

ભગીરથ બ્રહ્મભટ્ટ : એ/૩, યુનિવર્સિટી સ્ટાફ કોલોની, વલ્લભભિવ્યાનનગર-૩૮૮૧૨૦

રમણ સોની : ૧૮, હેમદીપ સોસાયટી, દિવાળીપુરા, જૂના પાદરા રોડ, વડોદરા-  
૩૮૦૦૧૫

રમણીક સોમેશ્વર : ‘રમ્ય’, સી/૨, સંસ્કૃત ટેનામેન્ટ્સ, સી. એચ. વિદ્યાલય સામે, સુભાનપુરા,  
વડોદરા-૩૮૦૦૨૩

રામ મોરી : ૫૮, ‘આસ્થા’, મીરાં પાર્ક, કિશ્ચા ટાઉનશીપ, સુભાનનગર, ઘોઘા રોડ,  
ભાવનગર-૩૬૪૦૦૧

વિનોદ જોશી : ‘પ્રયાગ’, ૩૨, શેતકરી સોસાયટી, વિદ્યાનગર, ભાવનગર-૩૬૪૦૦૧

સંજુ વાળા : એ/૭૭, આલાપ એવન્યૂ યુનિવર્સિટી રોડ, રાજકોટ-૩૬૦૦૦૪

મુદ્ધા ચૌહાણ : ૪૩, શાહિત્રામ બંગલો, વિનુકાકા માર્ગ મુ. બાકરોલ, જિ. આણંદ-  
૩૮૮૩૧૫

હીરીશ દાસાણી : જી/૫૦૩, ગ્રીનવુડ કોમ્પ્લેક્સ, અંધેરી-કુર્વા રોડ, મેટ્રો સ્ટેશન પાસે, અંધેરી  
(સ્ટેટ), મુંબઈ-૪૦૦૦૮૩

વર્ષ ૨૦૧૫નાં, સાહિત્યરૂપિને તાજગી બક્ષતાં પુસ્તકો

### નવલકથાઓ

21 ડિસેમ્બર	બાળન્દુશૈખર જાની	110
ઘર્ણા પોઠીન્ટ	મનહર ઓળા	240
સાજિશ (લઘુનવલ)	મનહર રવૈયા	130
સ્વદેશાભિમાન	પુરુષોત્તમ સોલકી	160
અંખો (લઘુનવલ)	ગૌરવ પંડ્યા	120
અમૃતપુત્ર	પ્રકાશ નિવેદી	150
તમે માનશો ? (લઘુનવલ)	ધીરેન્ડ મહેતા	150
લવલી પણહાઉસ	ધૂવ ભણ	225




### નવલિકાસંગ્રહો

સરનામું બદલાયું છે	વિજય શાસ્ત્રી	100
અદશ્ય પાત્રો	હુરેશ ધોળકિયા	125
યહી તો હે જિંદગી	બહાદુરભાઈ જ. વાંક	160
ગંધાઈ ગયેલું લોહી	ધીરેન્ડ મહેતા	140
એમનાં જીવન	હિમાંશી શેલત	90
ફિંગરપ્રિન્ટ	મનહર રવૈયા	150
રમત આટાપાટાની	પ્રકુલ્પ કનાબાર	130
હારોહાર	ગીજમશી પરમાર	170
કૂઝ	હરીષ થાનકી	150
ગતિ	પૂજા તત્ત્વસત	120
સાચ્ય	નાનિની કિશોર નિવેદી	140
આકાશગંગા-1,2	અંબાલાલ ચૌડાણા	360



### હાસ્યસાહિત્ય

પંદરમું રતન	કલ્યાણ દેસાઈ	120
હાસ્યકલરવ	પ્રધુમ આચાર્ય	100
બહુરંગી	સંપા. સ્વાતિ મેઢ	160



## ગુર્જર ગંધરવન કાર્યાલય

રસનપોળનાકા સામે, ગંધીમાર્ગ, અમદાવાદ-380001

■ ફોન : 22144663, 22149660 ફેક્સ : 22144663

■ ઈ-મેઈલ : goorjar@yahoo.com

### સંસ્કાર સાહિત્યમંદિર

5, N.B.C.C. હાઉસ, સહજાનંદ કોલેજની બાજુમાં, અંબાવાડી, અમદાવાદ-380 015

ફોન : 26304259



## કવિ શ્રી સુન્દરમુના નવા કાવ્યસંગ્રહો

૧. પલ્લવિતા	૧૮૮૫	૮૩૪૬	રૂ. ૧૬૦
૨. મહાનંદ	૧૮૮૫	૭૧૬૩	રૂ. ૮૦
૩. પ્રભુ-પદ	૧૮૮૭	૧૩૪૪૧	રૂ. ૨૨૫
૪. અગમ નિગમા	૧૮૮૭	૧૧૨૬૨	રૂ. ૧૫૦
૫. પ્રિયાંકા	૧૮૮૭	૧૧૩૬૭	રૂ. ૧૫૦
૬. નિત્યશ્લોક	૧૮૮૭	૧૨૧૮૮	રૂ. ૧૦૦
૭. નયા પૈસા	૧૮૮૮	૧૩૩૩	રૂ. ૧૭૫
૮. વરદા	૧૮૮૮	૧૬૪૨૮	રૂ. ૨૫૦
૯. ચક્કાંત	૧૮૮૮	૮૨૫૮	રૂ. ૧૨૫
૧૦. લોકલીલા	૨૦૦૦	૧૩૨૫૨	રૂ. ૧૦૦
૧૧. દક્ષિણા-૧	૨૦૦૨	૧૭૩૨૩	રૂ. ૫૦
૧૨. મનની મર્મર	૨૦૦૩	૧૦૪૩૮૭	રૂ. ૫૦
૧૩. ધ્રુવયાત્રા	૨૦૦૩	૧૨૩૪૫	રૂ. ૫૦
૧૪. ધ્રુવચિત્ર	૨૦૦૪	૧૭૨૭૪	રૂ. ૫૦
૧૫. ધ્રુવપદે	૨૦૦૪	૧૧૨૫૩	રૂ. ૫૦
૧૬. શ્રીમાતાજીના સાન્નિધ્યમાં-૧	૨૦૦૪	૧૬૩૨૦	રૂ. ૨૦૦
૧૭. શ્રીમાતાજીના સાન્નિધ્યમાં-૨	૨૦૦૪	૧૬૩૭૦	રૂ. ૨૦૦
૧૮. શ્રીમાતાજીના સાન્નિધ્યમાં-૩	૨૦૦૬	૩૨૩૧૭	રૂ. ૨૫૦
૧૯. મંગળા-માંગલિકા	૨૦૦૭	૨૮૨૩૮	રૂ. ૧૫૦
૨૦. તું ક્યાં... હું ક્યાં ! ?	૨૦૦૮	૨૮૩૦૪	રૂ. ૨૫૦
૨૧. સ્વાગતમૂળ ગીતવાહીને	૨૦૦૮	૧૬૨૦૭	રૂ. ૧૫૦
૨૨. 'સાવિત્રી'ના કાવ્યખંડો	૧૮૮૫	૨૪૪૭૩	રૂ. ૩૦૦
(અનુવાદ : શ્રી અરવિન્દના મહાકાવ્ય Savitriમાંથી, મૂળ અંગેજ સાથે.)			
૨૩. દક્ષિણા-૨	૨૦૦૨	૧૮૬૭૬	રૂ. ૫૦
(અનુવાદ : શ્રી અરવિન્દના Last Poems, More Poems, Collected Poemsમાંથી, મૂળ અંગેજ સાથે.)			

### આ તમામ સંગ્રહોનાં પ્રાપ્તિસ્થાન :

૧. ગ્રંથવિહાર, ગુજરાતી સાહિત્ય પરિષદ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા પાઇલ, આશ્રમમાર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૮
૨. ગૂર્જર ગ્રંથરતન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧

## મારા બે વિદ્ધાન પ્રોફેસરો

સ્વ. પ્ર. ભગુભાઈ એમ. પટેલસાહેબ

[ગુજરાતીના પ્રાધ્યાપક અને અધ્યક્ષ,  
આર્ટ્સ ઓન્ડ કોમર્સ કોલેજ, જામજોધપુર]

તથા

સ્વ. ડૉ. હેમન્તભાઈ જી. દેસાઈસાહેબ

[રીડર, ગુજરાતી ભાષાસાહિત્યભવન, ચૌરાખ્ણ પુનિવર્તિયી, રાજકોટ]

ને

શિક્ષકદિનના પાવન પર્વ

શત શત કોટિ વંદન.

સ્થાનસમર્પિત

ડૉ. અરુણ જી. કક્કડ

એસોસિએટ પ્રોફેસર, હેડ ઓફ ગુજરાતી ડિપાર્ટમેન્ટ, દેવમણિ કોલેજ,  
વિસાવદર

## ગુજરાતી સાહિત્ય પરિષદનાં મહત્વનાં પ્રકાશનો

### ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ

ગ્રંથ ૧ : ઈ. સ. ૧૧૫૦-૧૪૫૦	રૂ. ૨૧૦
ગ્રંથ ૨ : ખંડ ૧ : ઈ. સ. ૧૪૫૦-૧૬૫૦	૨૮૦
ગ્રંથ ૨ : ખંડ ૨ : ઈ. સ. ૧૬૫૦-૧૮૫૦	૨૫૦
ગ્રંથ ૩ દલપત્રમથી કલાપી	૪૨૦
ગ્રંથ ૪ ન્હાનાલાલથી જવેરચંદ મેઘાણી	૩૬૦
ગ્રંથ ૫ ઈ. સ. ૧૮૮૫-૧૯૭૫	
ગાંધીયુગીન - અનુગાંધીયુગીન કવિઓ	૩૨૫
ગ્રંથ ૬ ઈ. સ. ૧૮૮૫-૧૯૭૫	
ગાંધીયુગીન - અનુગાંધીયુગીન ગંધસર્જકો	૪૭૦

### પરિવાર-કાવ્યો

સંપાદન :

ડૉ. શ્રદ્ધા ત્રિવેદી, ડૉ. ઉર્મિલા ઠાકરે

કિંમત : રૂ. ૩૨૦

### ગ્રંથવિહાર

ગુજરાતી સાહિત્ય પરિષદ, 'થઈમ્સ' પાછળ, નરી ડિનારે, આશ્રમ માર્ગ,  
અમદાવાદ-૩૮૦ ૦૦૮. ફોન : ૨૬૫૮૭૮૪૮

## અરુણોદય પ્રકાશન

પુસ્તક પ્રકાશક, પ્રસારક અને પ્રચારક

૨૦૨, હર્ષ, કોમ્પ્લેક્સ, ખરીપોળ સામે, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧

ફોન : ૨૨૧૧૪૧૦૮ - email : arunodayprakashan@yahoo.co.in

### તાજેતરનાં તદ્દન નવાં પ્રકાશનો

પી. ખરસાહિનો વેશ	જીવનચિત્રિ	પ્રફુલ્લ ખરસાહિ	૮૦૦
શિલ્પ સમીપે	સ્થાપત્ય પરિચય	કનુ સૂચક	૫૦૦
જ્ઞાન પરબ (જનરલ નોલેજ ૨૦૧૫)	જનરલ નોલેજ	સં. બંસીધર શુક્ર	૨૦૦
અમરવાણી	ગૂટેવાં પ્રવચનો	સં. બંસીધર શુક્ર	૨૬૦
ઉપાનાર	સાહિત્ય-સિનેમા	અમૃત ગંગર	૩૨૫
નવલક્ષ્ય : સ્વરૂપ ને વૈવિધ્ય	સ્વરૂપ-વિવેચન	સં. શિરીષ પંચાલ	૬૨૫
આત્મકથા	સ્વરૂપ-વિવેચન	સતીશ વ્યાસ	૧૦૦
ટૂંકી વાર્તા	સ્વરૂપ-વિવેચન	વિજ્ય શાસ્ત્રી	૧૨૦
મે. ગણશેઠીનો ગલો	દ્વિઅંકી	સતીશ વ્યાસ	૭૦
લાભશંકર ઠકરના આદર્શ એકાંકી	એકાંકી સંગ્રહ	સં. સતીશ વ્યાસ	૧૦૦
પદ્ધિયન	સુવિચાર	સં. મહેન્દ્ર શાહ	૧૪૫
પરસખા પરમેશ્વરને	ઈશ્વરન પ્રાર્થના	નીલમ દોશી	૮૦
સાદ સંભળીએ સર્જનહારનો	ઈશ્વરના પત્રો	નીલમ દોશી	૧૦૦
જીવન જરૂરેથી	પ્રેરણાત્મક	નીલમ દોશી	૧૪૦
૪૦૧ પ્રશ્નોત્તરમાં સકળ જ્ઞાન	સવાલ-જવાબ	સં. બંસીધર શુક્ર	૨૦૦
બોમહિલા	નવલક્ષ્ય	અનુ. પ્રતિભા દવે	૧૬૫
સિદ્ધાર્થ	નવલક્ષ્ય	અનુ. કમલ સિંહા	૧૦૦
શિત્રલેખા	નવલક્ષ્ય	અનુ. અલકેશ પટેલ	૧૦૦
નોખી માટીના માનવો	ચારિત્રો	ઓક્ટેન્ટ ડેસાઈ	૧૦૦
ગુજરાતના ઘડવૈયા (ભાગ-૨)	ચારિત્રો	મફરં મહેતા	૩૨૫
શાઢે શાબ્દે રણકાર	પ્રેરણાત્મક	હેતા ભૂષણ	૬૦
શાઢે શાબ્દે શાશ્વત	પ્રેરણાત્મક	હેતા ભૂષણ	૬૦
શાઢે શાબ્દે જબકાર	પ્રેરણાત્મક	હેતા ભૂષણ	૬૦
શાઢે શાબ્દે સંસ્કાર	પ્રેરણાત્મક	હેતા ભૂષણ	૬૦
શાઢે શાબ્દે જાણકાર	પ્રેરણાત્મક	હેતા ભૂષણ	૬૦
જીવન સંજીવની	પ્રેરણાત્મક	પ. વિજયશંકર મહેતા	૬૦
જીવન ઉઘાડ	પ્રેરણાત્મક	પ. વિજયશંકર મહેતા	૬૦
જીવન ઓજશ	પ્રેરણાત્મક	પ. વિજયશંકર મહેતા	૬૦
જીવન પરોઢ	પ્રેરણાત્મક	પ. વિજયશંકર મહેતા	૬૦
જીવન જીઓતિ	પ્રેરણાત્મક	પ. વિજયશંકર મહેતા	૬૦
જીવન ઉત્સવ	પ્રેરણાત્મક	કાન્તિ ભણ	૬૦
જીવન જીવનાની કળા	પ્રેરણાત્મક	કાન્તિ ભણ	૧૨૫
અહા! જિંદગી વાહ! જિંદગી	પ્રેરણાત્મક	કાન્તિ ભણ	૧૨૫

## આપણાં સુખ-દુઃખ તુલનાનાં !

વિચાર કરતાં એમ લાગે કે આ તુલનાશક્તિની તો કેવી ખૂબી છે !

મનમાં એક વિચાર ચાલતો હતો, મોં મલકાતું હતું. પોતાની જાતને મોટી સમજતો હતો, સુખી માનતો હતો. અચાનક જ કાંઈ યાદ આવ્યું; તેની સાથે સરખામણી થવી શરૂ થઈ. મોં પડી ગયું ! સુખ રાખ થઈ ઉડી ગયું. દુઃખના વિચારોથી મન હવે કડવું થઈ ગયું. મનમાં પીડા ઉપડી. અજંપો થયો. દેહમાં વેદના થઈ આવી.... એવામાં બીજું કંઈ યાદ આવ્યું. કોઈકે આવી વધુ દુઃખી માણસની વાત કરી. એ સાંભળી મનને સારું લાગ્યું ! પેલી વેદના ઓસરવા લાગી.

શું છે આ ? તુલનાની આ તે કેવી તાકાત ?

મેળમાં મહાલવા એક માણસ જતો હતો. મસ્તીભરી ચાલ હતી અને ગળામંથી ગીતોના સૂર રેલાતા હતા. એવામાં રસ્તે ઉત્તાવળે ચાલતા. માણસોના પગ પર નજર પડી. અનેક નર-નારીને એ જાત જાતનાં પગરખાં પહેરીને જતાં જોયાં. રે નસીબ ! મસ્તીનાં ગીતો વરણ થઈ ઉડી ગયાં ! હાય રે ! મારા પગમાં કાંઈ નહીં ? હું ઉંઘાડ્યાં ! અટકી ગયો.. મોળો પડી ગયો. દુઃખી દુઃખી થઈ ગયો ! આગળ વધતાં, ચકડોળ પાસે એક ઠેલણગાડીમાં સૂતેલો માણસ જોયો. આને તો પગ જ ન હતા ! તેને જોયો અને થયું : હાશ ! મને પગ તો છે ! મલકાયો. મનને ઘેરી વળેલો વિષાદ દૂર થયો.

આપણો, આપણાં સુખ-દુઃખને કશીયે સરખામણી વિના તેના સ્વરૂપને પામીએ અને સ્વીકારીએ તો કેવું સારું ? જ્યારે તુલના કરીએ છીએ ત્યારે જ ઉપાયિ આવે છે ! આમ, આપણાં સુખ-દુઃખ વાસ્તવિક છે જ નહીં. કશી તુલના વિના જ જો સુખ-દુઃખનો વિચાર કરીએ તો કેવું સારું. અરે ! આપણો કોઈને સારા કે ખોટા કહીએ છીએ એ પણ અન્યની સરખામણીએ જ ને ?

હવે, તુલનાના કશા વળગણ વિના વિચારવાની ટેવ પાડવા જેવી છે.

તુલના બધી ખપની નથી.

(પાઠશાળા)

- પ્રધુભનસ્તુરી

સ્થાનસમર્પિત

## વસન્ત આત્મા ચેરિટેબલ ટ્રસ્ટ

ગુજરાત સ્ટીલ ડિસ્ટ્રિબ્યુટર

અમદાવાદ

## ધ્યેયની સ્પષ્ટતા ગતિને સાર્થક કરે છે

આપણો કાંઈ ને કાંઈ પુરુષાર્થ તો રોજ કરતા જ રહીએ છીએ, પણ એ પુરુષાર્થની સર્વળતાની આધારશિલા છે : ધ્યેયની સ્પષ્ટતા.

આપણું ધ્યેય સ્પષ્ટ હોય તો જ, તેને સામે રાખીને કરેલી ગતિ સાર્થક બને છે; એ ગતિ પ્રગતિમાં રૂપાંતર પામે છે. ધ્યેયની સ્પષ્ટતા અને તે પછી, તે માટેના પુરુષાર્થનું સાતત્ય જરૂરી છે. આ સરળ નથી. તેમાં વિધ આવે તોપણ તે ધ્યેયનો વિકલ્પ ન સ્વીકારવો. ધ્યેયપ્રાપ્તિની તીવ્રતા એ વિધોને વિભેરી નાખે છે; ઓળંગી જવાનું બળ આપે છે.

માટે, ધ્યેય સિદ્ધ ન થાય ત્યાં સુધી અવિરામપણે મંડચા રહેવું તે સિદ્ધિની પૂર્વશરત છે.

ગામ જવા નીકળ્યા, પણ થોડું ચાલીને જો બીજી દિશાના ગામે જવા વિચાર્યું, એટલે વિધ શરૂ ! તેથી ધ્યેયની સ્પષ્ટતાની જેમ નિશ્ચલતા પણ તેટલી જ જરૂરી છે. તેમાં ચંચળતા ન ચાલે. નિર્ણય લેતાં પહેલાં ‘આ કે તે’ વિકલ્પ ભલે શોધ્યા કરીએ – એ ચાલે. પણ પછી નહીં.

તે નિર્ણય પછી તબક્કો ગતિનો આવે છે. ગતિ જ પ્રગતિનું રૂપ લે છે અને ધાર્યા ગામ અને ડામ પહોંચાય છે. માત્ર ચાલવાથી ગામ નથી પહોંચાતું, પણ જે ગામ જવું છે તે ગામની દિશામાં ચાલવાથી તે ગામ પહોંચાય છે – જરૂર પહોંચાય છે.

ધ્યેયની સ્પષ્ટતા ગતિને સાર્થક કરે છે.

(પાઠશાળા)

– પ્રદ્યુમનસ્કૃતિ

: સ્થાનસમર્પિત :

નિમેષભાઈ ડગલી

એમ. બી. ટ્રેડિશનલ પ્રિન્ટસ પ્રા. લિમિટેડ

ઉ/એ, અલકાપુરી સોસાયટી, ઉસ્માનપુરા ચાર રસ્તા પાસે,  
આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૧૩. ફોન : ૦૨૭૦૬૬૫૫

માય ડિયર જ્યુની પોતાની પ્રકાશન-વ્યવસ્થા

## લટૂર પ્રકાશન

'અવનિલોક', ઉ શાંતિનગર સોસાયટી, ૨૨૭૩ હિલ ફ્રાઈવ, ભાવનગર-૧

‘માય ડિયર જ્યુ’ : વાતવીવિદ્યા - સં. ઈલા નાયક - કિં. રૂ. ૨૨૫/-

(વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પાઠ્યપુસ્તક)

‘માય ડિયર જ્યુની વાર્તાકુણ વિશે’ - કિં. રૂ. ૪૫૦/-

(માય ડિયર જ્યુની વાર્તાઓ વિશે ત્રેપન અભ્યાસલોખોનો માતબર સંદર્ભગ્રંથ)

જીવ - માય ડિયર જ્યુ - રૂ. ૧૮૦/-

(ગુજરાત યુનિવર્સિટીમાં પાઠ્યપુસ્તક)

સંજીવની - માય ડિયર જ્યુ - કિં. રૂ. ૧૮૦/-

(સરદાર પટેલ યુનિવર્સિટીમાં પાઠ્યપુસ્તક)

મને યાણ લઈ જાવ ! - માય ડિયર જ્યુ - કિં. રૂ. ૧૪૦/-

### નવી કલમ, નવી વાર્તાઓ

- પડ્થારો - ગોરધન લેસાણિયા - રૂ. ૧૫૦/-

- ગોત્ર - ગિરીશ ભણ - રૂ. ૧૮૦/-

- વાતોડિયો - જોતીન્દ્ર પંચોલી - રૂ. ૧૬૦/-

- રિફન્ડ - મનીષ રાજ્યગુરુ - રૂ. ૧૫૦/-

- અંતરધનિ - જિશેશ વ્યાસ - રૂ. ૧૨૫/-

- રીઆલિટી શો - નવનીત જાની - - રૂ. ૨૦૦/-

- નીચે નહીં ધરતી, ઊપર નહીં આકાશ - બહાદુરભાઈ જ. વાંક - રૂ. ૧૫૦/-

### તરોતાજા નિબંધસંગ્રહો :

- તેઓ - મનોહર ત્રિવેદી રૂ. ૨૨૫/- ઘરવખરી મનોહર ત્રિવેદી રૂ. ૧૫૦/-

- તોરણમાળ - માણિલાલ હ. પટેલ રૂ. ૨૨૫/-

### કાવ્યસંગ્રહો :

- પાથરણવાળો - રમેશ આચાર્ય - રૂ. ૧૧૦/-

- ઘર બદલવાનું કારણ - રમેશ આચાર્ય - રૂ. ૧૨૫/-

- સમય સાક્ષી છે - (અનુ.) વંદના શાન્તુર્ણદુ - રૂ. ૧૦૦/-

તમારા બુક્સેલર પાસેથી મળશે. સીધો સંપર્ક કરો : વિશેષ વળતરથી ઘેર બેઠાં પહોંચાડીશું.

માય ડિયર જ્યુ : ૮૮૮૮૮૬૮૬૨૬ - ૮૪૨૬૧૬૦૨૦૮

અવનીન્દ્ર : ૮૬૨૪૬૮૫૬૪૬ - ૯૩૭૭૧૧૫૬૪૬

Email : latoorprakashan@yahoo.com









## ટાઈટલનું મેટર

### ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ

ગ્રંથ : ૧, પાદુક પૂર્ણ, પુ. કિંમત : રૂ. ૨૧૦/-

‘ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ’ના આ પ્રથમ ગ્રંથમાં ઈ. સ. ૧૧૫૦થી ઈ. સ. ૧૪૫૦ સુધીના સમયગાળાના મધ્યકાળીન ગુજરાતી સાહિત્યસર્જનની ગતિવિધિનો આવેખ છે. આ ગ્રંથમાં ભૂમિકા તપે પ્રાચીન-મધ્યકાળીન ગુજરાતના રાજકીય-સાંસ્કૃતિક વિકાસનો, ગુજરાતી ભાષાના ફુળકમનો વિવિધ વિધાયક પરિબળોનો તથા સાહિત્યિક પૂર્વ પરંપરાઓનો જ્યાલ અપાયો છે. આ ઈતિહાસ-ગ્રંથને વિદ્ધાનોની કલમનો લાભ મળ્યો હોવાથી આ ગ્રંથ શાસ્ત્રીય અને સમૃદ્ધ બન્યો છે. ઘણાં સમયથી આ ગ્રંથ અપ્રાય હતો, તેનું આ પુનર્મુદ્રણ વિદ્ધાનો અને અભ્યાસીઓને ઉપયોગી નીવડશે.

### ગુજરાતીસાહિત્યનો ઈતિહાસ

ગ્રંથ : ૨, બંડ-૧, પાદુક પૂર્ણ, પુ. કિંમત : રૂ. ૨૮૦/-

‘ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ’ના આ ગ્રંથમાં ઈ. સ. ૧૩૫૦થી ઈ. સ. ૧૬૫૦ સુધીના સમયગાળાના સાહિત્યનું પ્રવાહદર્શન છે. મધ્યકાળનાં સાહિત્યસ્વરૂપોની ગતિવિધિનો આવેખ, એ સમયગાળાના જૈન સાહિત્યનું અવલોકન, નરસિંહ-મીરાં અને અખા – જેવા પ્રમુખ તથા અન્ય સર્જકોના પ્રદાનની વિસ્તૃત મુલવણી તથા અખા પછીની ગુજરાતી જ્ઞાનમાર્ગી કવિતાની વિચારણાનો આ ગ્રંથમાં સમાવેશ થયો છે. ઘણાં સમયથી અપ્રાય આ ગ્રંથનું પુનર્મુદ્રણ વિદ્ધાનો અને અભ્યાસીઓને ઉપયોગી નીવડશે.

### ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ

ગ્રંથ : ૨, બંડ-૨, પાદુક પૂર્ણ, પુ. કિંમત : રૂ. ૨૫૦/-

‘ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ’ના આ ગ્રંથમાં ઈ. સ. ૧૬૫૦થી ઈ. સ. ૧૮૫૦ સુધીના મધ્યકાળના અંતિમ ચરણના સાહિત્યનું પ્રવાહદર્શન છે. પ્રેમાનંદ, શામળ, દ્યારામ એ પ્રમુખ કવિઓના પ્રદાનની મુલવણી તથા એ સમયગાળાના જૈનસાહિત્યની, આખ્યાનકવિતાની અને પદ્કવિતાની ચર્ચા આ ગ્રંથમાં થઈ છે. તદ્વપરાંત મધ્યકાળીન કથાપ્રવાહની, સંતકવિતાપ્રવાહની, ગદ્યસાહિત્ય અને લોકસાહિત્યની તથા પરિશિષ્ટ તપે મધ્યકાળીન કથાઘટકો, કથાપ્રકૃતિ અને છંદોબંધની વિચારણા પણ અહીં થઈ છે. ઘણાં સમયથી અપ્રાય આ ગ્રંથનું પુનર્મુદ્રણ વિદ્ધાનો અને અભ્યાસીઓને ઉપયોગી નીવડશે.

### ગુજરાતી નવલિકાચયન : ૨૦૧૪

સં. મુનિકુમાર પંડ્યા, કાચું પૂર્ણ, પુ..... કિંમત : રૂ. ૧/-

ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ઈ. સ. ૧૯૮૪-૮૫થી પ્રતિવર્ષ ‘નવલિકાચયન’નું પ્રકાશન થાય છે. ‘ગુજરાતી નવલિકાચયન : ૨૦૧૪’ના ભાષાનાં વિવિધ સામયિકીમાં પ્રસિદ્ધ થયેલી નવલિકાઓમાંથી ઉત્તમ નવલિકાઓનું સંપાદન કર્યું છે. કથાસાહિત્યના

એમના અભ્યાસનો લાભ આ સંપાદનને મળ્યો છે. એમજે ઘણી ચીવટથી અને સમયસર  
આ સંપાદન તૈયાર કરી આપ્યું છે. ગુજરાતી સાહિત્યના ભાવકો અને સૌ વાર્તારસિકોને  
આ સંપાદન ગમશે એવી આશા છે.

$\frac{1}{15750}$

## அக்வாட்டர் நூல்களில் தாவரங்கள்

### அக்வாட்டர் நூல்களுக்கும்



#### அப்:1

**அக்வாட்டர் 35, ஓப்பு: ₹ 20/-**

அக்வாட்டர் நூல்களுக்கும் அப்:1  
அப்:1%. ₹. 1150%. ₹. 1450 ரூப்புக்கு  
வினாதானால் கணக்கு செய்யப்படும். நீங்கள் என்  
அய்யாவது கீத்திரு. நீங்களின்பேருத்  
கால்தானால் கால்தானால் நீங்களுக்கு  
சிர்க்கால், அக்வாட்டர்கள் போன்ற சிர்க்கால  
வினாக்களுக்கு கால்தானால் நீங்களுக்கு  
வினாக்கள். உயிர்மனி கால்தானால் போன்ற,  
ஏதோப்பாக அம்புக்கு அதே நீங்களின்கூல்  
நீங்களுக்கு.

### அக்வாட்டர் நூல்களுக்கும்

#### அப்:2, ஓப்:1

**அக்வாட்டர் 58, ஓப்பு: ₹ 20/-**

அக்வாட்டர் நூல்களுக்கும் அப்:2  
%. ₹. 1350%. ₹. 1650 ரூப்புக்கு  
வினாதானால் நீங்களுக்கும் தாவரங்கள்  
முக் கால்தானால் கால்தானால் நீங்கள், தா  
வினாதானால் நீங்களுக்கும் அக்வாட்டர்  
கால்தானால் கால்தானால் நீங்களுக்கும்  
அக்வாட்டர்கள் போன்ற பியிரும்புகள்  
அக்வாட்டர்களுக்கும் போன்ற பியிரும்புகள்  
வினாக்களுக்கு கால்தானால் நீங்களுக்கும்  
அக்வாட்டர்களுக்கும் தாவரங்களுக்கும் அக்வாட்டர்  
அப்:2.



## **Aಶ್ವಿನ್‌ನಾಗ್ರಾಹಿ. ಹಿಂದು**



### **Aಶ್ವಿನ್‌ನಾಗ್ರಾಹಿ**

**Aಶ್ವಿನ್‌ನಾಗ್ರಾಹಿ**

**Aಶ್ವಿನ್‌ನಾಗ್ರಾಹಿ, Aಶ್ವಿನ್‌ನಾಗ್ರಾಹಿ : ₹. 250/-**


Aಶ್ವಿನ್‌ನಾಗ್ರಾಹಿ. ನಾಗ್ರಾಹಿ ಹಿಂದು ಪಾಠ್ಯ ಮತ್ತು ವಿಷಯ ಶಾಸಕ. ಇದು ಸಾಮಾನ್ಯ ಜೀವನದಲ್ಲಿ ಬಳಸುವ ಸಾಧನೆಗಳನ್ನು ಉದ್ದೇಶಿಸಿರುತ್ತದೆ. ಇದು ಸಾಮಾನ್ಯ ಜೀವನದಲ್ಲಿ ಬಳಸುವ ಸಾಧನೆಗಳನ್ನು ಉದ್ದೇಶಿಸಿರುತ್ತದೆ.

### **Aಶ್ವಿನ್‌ನಾಗ್ರಾಹಿ : 2014**

**ಶಾರೀರಿಕ ವಿಷಯ**

**Aಶ್ವಿನ್‌ನಾಗ್ರಾಹಿ, ₹. 130/- : ₹. 110/-**

Aಶ್ವಿನ್‌ನಾಗ್ರಾಹಿ. ನಾಗ್ರಾಹಿ ಕೃಷ್ಣ. ₹. 194-  
ಕಾರ್ಯಕ್ರಮ ಅಂತರಾಳದಲ್ಲಿ ಬಳಸುವ ಸಾಧನೆಗಳನ್ನು ಉದ್ದೇಶಿಸಿರುತ್ತದೆ.  
Aಶ್ವಿನ್‌ನಾಗ್ರಾಹಿ : 2014 ಅಂತರಾಳದಲ್ಲಿ ಬಳಸುವ  
ಸಾಧನೆಗಳನ್ನು ಉದ್ದೇಶಿಸಿರುತ್ತದೆ. ಇದು ಸಾಮಾನ್ಯ  
ಕಾರ್ಯಕ್ರಮ ಅಂತರಾಳದಲ್ಲಿ ಬಳಸುವ ಸಾಧನೆಗಳನ್ನು ಉದ್ದೇಶಿಸಿರುತ್ತದೆ.  
Aಶ್ವಿನ್‌ನಾಗ್ರಾಹಿ : 2014 ಅಂತರಾಳದಲ್ಲಿ ಬಳಸುವ ಸಾಧನೆಗಳನ್ನು ಉದ್ದೇಶಿಸಿರುತ್ತದೆ.  
Aಶ್ವಿನ್‌ನಾಗ್ರಾಹಿ : 2014 ಅಂತರಾಳದಲ್ಲಿ ಬಳಸುವ ಸಾಧನೆಗಳನ್ನು ಉದ್ದೇಶಿಸಿರುತ್ತದೆ.  
Aಶ್ವಿನ್‌ನಾಗ್ರಾಹಿ : 2014 ಅಂತರಾಳದಲ್ಲಿ ಬಳಸುವ ಸಾಧನೆಗಳನ್ನು ಉದ್ದೇಶಿಸಿರುತ್ತದೆ.



PARAB 2015 September

Regd. under Postal Registration No.

RNI No. GU/GUJ/2006/17273 GAMC-306/2015-2017, valid upto 31-12-2017

Posted at Ahd. PSD on 10th of every month SSP Ahd


INTRODUCING

FEVICOL  
Science  
Project  
Challenge  
2015

In your school

Young minds  
creating a better  
tomorrow

Participate &  
win a chance to win  
**LONDON TRIP**  
& many other  
exciting prizes



For more details visit  
[www.fevicolsciencechallenge.com](http://www.fevicolsciencechallenge.com)